

# ਪ੍ਰਕਾਸ਼

स्थापना वर्षः १८६०

q&gt; : >

માર્ચ : ૨૦૧૦

અંક : ૮

# ભગવતીકુમાર શર્મા

पुस्तकालय

ભોગાભાઈ પટેલ

## વरिष्ठ કાર્યવાહકસમિતિ સભ્ય

ਪ੍ਰਕੂਲਲ ਰਾਵਲ

प्रकाशनमंत्री

१८

યોગેશ જોખી

સહતંત્રી :

ਪ੍ਰਕੂਲਲ ਰਾਵਲ



## ગુજરાતી સાહિત્ય પરિષદ

મેઘાણી શાન્પીઠ m ક. લા. સ્વાધ્યાયમંદિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ,  
‘થાઈમ્સ’ પાછળ, નાનીકિંનારે. અમદાવાદ-૩૮૦ ૦૦૬

ફોન. : ૨૬૪૮૭૯૮૪૭

ਪੁਰਖ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

- v "પરબ" દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.
  - v "પરબ"ના આહક તથા પરિષદ્ધના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.
  - v "પરબ"નું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦ છે.
  - v વિદ્યાર્થીઓ માટે "પરબ"નું વાર્ષિક લવાજમ રૂ. ૭૫ છે, પ્રમાણપત્ર સાથે બીડવું.
  - v ગુજરાતી સાહિત્ય પરિષદ્ધના વાર્ષિક તેમજ આજીવન સભ્યપદના શુલ્કમાં "પરબ"ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.
  - v પરિષદ્ધના વાર્ષિક વ્યક્તિગત સભ્યપદનું શુલ્ક રૂ. ૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક રૂ. ૩૦૦ છે.
  - v પરિષદ્ધના આજીવન સભ્યપદનું શુલ્ક રૂ. ૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સભ્ય ફી રૂ. ૩,૦૦૦ છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)
  - v "પરબ" લવાજમ તથા પરિષદ સભ્યપદ શુલ્કની રકમ મનીઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાઇફ્ટ્યુ ગુજરાતી સાહિત્ય પરિષદના નામે જ મોકલવી.

લેખકોને :

- v ‘પરબ’માં પ્રગટ થતાં લખાડોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
  - v લેખકોએ પોતાનું લખાડા ફૂલ્સકેપ અથવા ડાઇ સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ અક્ષરે લખી મોકલવું. પોસ્ટકાર્ડ, ઇનલેન્ડ કે ચબરખીઓમાં કૃતિ મોકલવી નહીં. પ્રત્યેક કૃતિ નીચે પૂરું સરનામું લખવા તથા એક નકલ પોતાની પાસે રાખીને જ કૃતિઓ મોકલવા વિનંતી.
  - v સ્વીકૃત કૃતિની જાણ કરશે. ટ્યાલ-ટિકિટે ચૌંટેલું કવર મોકલ્યું હશે તો અસ્વીકૃત કૃતિ પરત કરવામાં આવશે, અન્યથા કૃતિ રદ ગણવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતિની જાણ કરશે.
  - v પત્રવ્યવહારનું સરનામું : તંત્રી, ‘પરબ’ ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, ‘યાઈમ્સ’ પાછળ, નદીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

३-१२५३ : द्वितीय @ अ३१३. विष्णु

**ଅନ୍ତର୍ଭାବ:** ତିତିତି.ମାନ୍ଦିବିଦିବିଶବ୍ଦିମୁଖୀରାଧିଭରିବିଶବ୍ଦିମୁଖିଜ. ଏହିତିତିତିତି.ମାନ୍ଦିବିଦିବିଶବ୍ଦିମୁଖୀରାଧିଭରିବିଶବ୍ଦିମୁଖିଜ. ଏହିତିତିତି.ମାନ୍ଦିବିଦିବିଶବ୍ଦିମୁଖୀରାଧିଭରିବିଶବ୍ଦିମୁଖିଜ.

ਫੋਨ ਅਨੇ ਫੈਕਸ : ੨੬੪੮੭੯੮੭

ISSN 0250-9747 ਪੰਜਾਬ

ପ୍ରକଟିକ୍ ନଂ. ୩. ୨୦/-

**માર્ગિક :** ગુજરાતી સાહિત્ય પરિષદ વતી મુદ્રક અને પ્રકાશક : પ્રકૃત્તલ રાવલ (પ્રકાશનમંડળી), ગોવર્ધનનભવન,  
આશ્રમમાર્ગ, 'ઘર્યાંસ' પાછળા, નદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૮ S તંત્રી : યોગેશ જોણી S મુદ્રણસ્થાન :  
**શારદા મુદ્રણાલય**, ૨૦૧, તિલકરાજ, પંચવડી હેઠળ લેન, આંબાવાડી, અમદાવાદ-૫ & ૨૬૫૬૪૨૭૫

## અનુક્રમ

પરિષદ-પ્રમુખનો પત્ર	'ગુજરાતી શાસી વાણી રાણીનો વકીલ છું.' • ભગવતીકુમાર શર્મા ૪
તંત્રીવેખ	ઢાંકિસાહેબને પચભૂષણ • યોગેશ જોષી ૬
કવિતા	ચાર ગજલ • નીતિન વડગમા 10, બા • દિલીપ જોશી 12, પદ્માયો • દિલીપ જોશી 12, બાધ્યો ધમકાવે • વસ્તલ ૨. શાહ 13, પરબ • ગિરીશ ભણ 14, ડેંક કેશી પી નાંખી... • સુસ્થિત્વ જોષી 14, અને હું એકલો • આબિદ ભણ 15, સંદ્યા ઢળી ? • ભાનુપ્રસાદ પંડ્યા 15, ડાણ પર મેદી રણી... • એસ. એસ. રાહી 16, વરસો પહેલાં ભીતરથી... • અનિલ ચાવડા 16
વાર્તા	અઝેલિયાનાં ફૂલ • પ્રીતિ સેનગુપ્તા 17
લઘુકથા	સુખી હોવાનું વૃત્તાંત • રમેશ નિરેદી 22
નિબંધ	બુશવોક • ડૉ. કાલિન્દી પરીખ 23
નાટક	સ્વભન - દુસ્રભન • ચિનુ મોરી 27
આસ્વાદ	કવિ રમેશ પારેખની કાવ્યરચના 'નદીએ હબસણ નહાય' • લાભશંકર ઠાકર 36
ભારતીય સાહિત્ય	ત્રણ કાલ્યો • મીરાં તારણેકર, અનુવાદક : કાજલ ઓઝા વેદ 41
અભ્યાસ	શતદલપદમાં પોઢેલો : કવિશ્રી નહાનાલાલને સ્મૃતિવંદના (૧૮૭૭-૧૮૪૬) • નરોત્તમ પલાશ 45, સંસ્કૃતિવિર્મર્શ સંદર્ભ મધ્યકાળીન ગુજરાતી સાહિત્ય • પ્રવીણ દરજ 48
દર્શન-શાસ્ત્ર	કેમ મકનજી ક્રયાં ચાલ્યા ? • પ્રા. જનક હ. દવે 56
પ્રાચીનીક	'ગુજરાત બચાવો' • ડૉ. સોમભાઈ સી. પટેલ 61
સમીક્ષા/ગ્રંથાવલોકન	'ભેણો' વિશે • નવનીત જાની 63, એ પણ ગજલ, આ પણ ગજલ • ડૉ. એસ. એસ. રાહી 67, ઝનૂનથી ખરડાચા વગરની હિજરતકથા • એસ. ડી. દેસાઈ 70, બાલપુષ્ટો પ્રત્યેનું વહાલ • શક્તા નિરેદી 72
પત્રસેતુ	ધીરેન્દ્ર મહેતા 75
પરિષદવુત્ત	સંકલન : રાજેન્ડ્ર પટેલ 78
સાહિત્યવૃત્ત	સંકલન : પ્રકુલ્લ રાવલ 84
આ અંકના લેખકો	88
આવરણચિત્ર	નભીબક્ષ મનસુરી

## પરિષદ-પ્રમુખનો પત્ર

'ગુજરાતી શાસી વાણી રાણીનો વકીલ છું.'

ગુજરાતી ભાષાના ભાવિ અસ્તિત્વ વિશે સુશ્ર જનોએ આશાંકાપુક્ત ચિંતા વ્યક્ત કરી તે કાંઈ આટલા ટૂંકા સમયગાળામાં નામરોષ ન થઈ શકે. ભાષાઓ અને બોલીઓના ઉદ્ભબ, વિકાસ અને ક્યારેક વિલય એ લગભગ એક સતત ચાલતી પ્રક્રિયા છે. હજ થોડાક જ દિવસો પૂર્વે એક ભાષા અથવા બોલીના સંપૂર્ણ વિલયના સમાચાર જાણ્યા. આનંદામાનમાં બો જાતિ અને તેની ભાષા અથવા બોલીનું નામ પણ બો. બો બોલી બોલનાર અને સમજનાર એકમાત્ર વૃદ્ધ મહિલાનું થોડાક દિવસો પૂર્વે જ પંચાશી વર્ષની વિશે અવસાન થતાં બો બોલી નામરોષ થઈ ગઈ છે. ભાષા કે બોલી પરંતે ભવિષ્યે બની શકનારી એક કુશળતિકાનો પણ મારે ઉલ્લેખ કરવો જોઈએ. પારસી જેવી ભલી, ઉદાર, પ્રેમાળ, દેશભક્ત કોમની આ વાત છે. પારસીઓ બહુધા ગુજરાતી છે અને તેઓ જે પારસીશાઈ ગુજરાતી બોલે છે તેને હું ગુજરાતી ભાષાની એક બોલી ગણવા પ્રેરાઉં છું. વારંવાર કહેવાઈ ચૂક્યું છે કે પારસીઓની વસતિ ક્રમશઃ ઘટતી જાય છે. અનેક પારસીઓ વિદેશોમાં વસે છે. એક મોટો હિસ્સો મુખ્યમાં રહે છે. સ્વાભાવિક રીતે જ આ બધા પારસીઓની રહેણીકરણી અને ભાષા પર અંગ્રેજિયત તથા અંગ્રેજનો ઘણો પ્રભાવ છે. ભય રહે છે તે મુજબ જો પારસીઓની વસતિ ઘટતી જાય અને ગુજરાત તથા ગુજરાતી ભાષા સાથેનો પારસીઓનો સંસ્કૃતીય બનનો જાય તો કદાચ ભવિષ્યે ગુજરાતીની એક બોલી સમાન પારસી ગુજરાતી પરાત્માયિલય તોળાય અને ગુજરાતી માટે તે જેવીતેવી હાણ નહિ હોય. પણ કણાં વાદળાંને રૂપેરી કિનાર હોય જ. આશાપ્રેરક બલકે શક્તાવર્ધક હકીકત એ છે કે ગુજરાતીઓમાં માતૃભાષા અંગેની જાગૃતિ વધવાના અણસાર શરૂ થઈ ચૂક્યા છે. તા. ૨૧મી ફેબ્રુઆરીનો 'અંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' ગુજરાતમાં ગયા વર્ષથી વિશેષ ઉત્સાહપૂર્વક ઊજવાય છે અને આ વર્જે તો તેમાં ઉત્સાહની મોટી ભરતી ચઢી છે. લગભગ બધાં જ શહેરોમાં તે દિવસે ભાષા-યાત્રાઓ, પરિસંવાદો, વિદ્યાર્થી સ્તરે સ્પર્ધાઓ ઈત્યાદિનું આપોજન થયું છે અને એ રીતે એક વાયુમંડળનું નિર્માણ થયું છે.

પરિષદના પૂર્વે પ્રમુખ શ્રી નારાયણભાઈ દેસાઈએ 'પરિષદને ઉપક્રમે સાહિત્યયાત્રાઓ શરૂ કરાવી. 'પરિષદના નવા કાર્યવાહકોએ તો સાહિત્યયાત્રાની એ પ્રવૃત્તિને ચાલુ રાખવાનો, વિસ્તારવાનો સંકલ્પ કર્યો જ છે, પણ તદ્વપરાંત શ્રી નારાયણભાઈ દેસાઈના એ વિચાર-આચાર-બીજના અન્યત્ર પણ તૃષ્ણાંકુરો ફૂટવા લાગ્યા છે જે સંતોષજનક અને શક્તાવર્ધક સ્થિતિ છે. નિબંધકાર, વિચારક, શિક્ષક અને વક્તા ડૉ. ગુણવંત શાહની 'નરસિંહથી નર્મદાની 'માતૃભાષા વંદના યાત્રા'ને આનું તાજું ઉદાહરણ લેખી શકાય. તા. ૩૦મી જાન્યુઆરીએ જૂનાગઢથી આરંભાઈ તા. ૬ફી ફેબ્રુઆરીએ સૂરતમાં સમાપ્ત થયેલી આ યાત્રા ગુજરાતનાં અધાર શહેરોમાં ફરી અને કુલ ચાણીસ સભાઓનું તદ્તર્ગત આપોજન થયું. સર્વત્ર સારો જનસમૂહ ઉમટ્યો. 'ગુજરાતી સાહિત્ય પરિષદ' આ યાત્રાને પૂરો સહકાર આપ્યો. યાત્રાની સાથે જ ગુજરાતી ભાષાનાં ચૂટેલાં એકસો એક પુસ્તકોનું

પ્રદર્શન ફરતું રહ્યું અને લોકોએ સારી સંખ્યામાં પુસ્તકો ખરીદ્યાં પણ ખરાં. ‘ગુજરાતી પુસ્તકો બહુ વેચાતાં અને વંચાતાં નથી’ તેવી આપણી લાંબા સમયની ફરિયાદ છે, પણ હવે સહૃદ્દુને સમજાવા માંડળું છે કે લોકો પુસ્તકો સુધી ન આવતા, ન આવી શકતા હોય તો હવે પુસ્તકોએ બધી છોછ છીએને સામે ચાલીને લોકો સુધી પહોંચયું પડશે.

ઉપરોક્ત ‘માતૃભાષા વંદના યાત્રા’ દરમિયાન સ્વાભાવિક રીતે જ ગુજરાતી ભાષા વિશે મહિનસ્તોત્રો ઉચ્ચારાયાં. આધુનિક માતાઓની મૂળવણને વાચા મળી : ‘મારે મારા બાળકને ભવિષ્યે સહૃદાતાના ઉચ્ચ શિખરે પહોંચાતું જાવું છે, પણ તે શિક્ષણના અંગેજ માધ્યમ વિના આજની દુનિયામાં શક્ય બનશે ખરું ?’ આ વાસ્તવિક મૂળવણનું સમાધાન પણ બે’ક વક્તાઓએ સૂચયું. માધ્યમ તો ગુજરાતી જ હોય અને તેની સમાનાન્તરે અંગેજના ઉત્તમ શિક્ષણની સુવિધા હોય; જ્યાં અંગેજ માધ્યમ અનિવાર્ય લાગતું હોય ત્યાં પણ તેની પડછે ગુજરાતીના ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા અનિવાર્યતઃ હોય જ.

પણ એક મુદ્દે સહૃદ સંમત થશે : ગુજરાતી ભાષાના અસ્તિત્વ અંગેની આશંકા માત્ર યાત્રાઓ અને જોશીલાં ભાષણોથી નિર્મણ નહિ થાય. વળી આવા ઉપકમોમાં માતૃભાષાનો પદાર્થ કેન્દ્રમાં રહેવો જોઈએ. ખુશીની વાત એ છે કે સાહિત્ય-યાત્રાઓ અને ‘માતૃભાષા-દિવસ’ની ઉજવાણીની સાથોસાથ આ ઉપકમોમાં અનુગામી પગલાંઓ પરત્વેનું સહિતેનું પણ શરૂ થઈ ચૂક્યું છે અને ગુજરાતી ભાષાની ગરિમાની પુનઃ સ્થાપનાનો પ્રજાકીય, સંસ્થાનીય અને શાસકીય એમ ત્રિવિધ સ્તરે પુરુષાર્થ પ્રારંભાયો છે. પુસ્તકાલય-પ્રવૃત્તિનું સુવ્યવસ્થિત વિસ્તરણ, પુસ્તકાલય-પ્રસારના વ્યાપક, દિઝિવંત પ્રયત્નો, ઉત્તમ પુસ્તકોની સહજ પ્રાર્થતા, લોકજીવનને સીધો ટકોરો મારે તેવા સાહિત્યસર્જન ભાણીનો સર્જકોનો જોક, સાહિત્યકારો, શિક્ષકો, અધ્યાપકો અને પત્રકારોની સાહિત્ય પ્રત્યેની ઈમાનદારી, સાહિત્યસંસ્થાઓનું પ્રવૃત્તિસાતત્ત્વ અને તેઓની લક્ષ્ય પરત્વેની અસંદિઘતતા, અભિયાનમાં સહૃદ કોઈને, કશા ભેદભાવ વિના જોડવાની વિવેકબુદ્ધિ અને સમગ્ર પુરુષાર્થેને શાસનતંત્રનું સ્વાર્થરહિત સમર્થન : આવાં અનેક વાનાંઓનાં સહઅસ્તિત્વ તથા સમાયોજન વડે જ ગુજરાતી ભાષાના પુનરુથાનનો ઉદ્દેશ સફળ થઈ શકે, અને ‘વિવેક-બૃહસ્પતિ’નું બિસુદ્ધ ધરાવતી ગુજરાતી પ્રજામાં એટલી શ્રદ્ધા રાખવાપણું હજુ ટકેલું છે, અન્યથા ચેકબુક, પાસબુક અને ડિસાબી ચોપડાઓ ઉપરાંત નરસિંહ મહેતાથી માંડીને આજના નવીનતમ સર્જક પર્યન્ત ગુજરાતીની અક્ષરયાત્રા અખંડ ન રહી હોત. દલપતરામે સગૌરવ લખ્યું હતું :

**‘ગુજરાતી શાષ્ટી વાણી’**

**રાણીનો વકીલ છું’**

ગુજરાતી પ્રજા અને વાણી બંને શાણી છે. તેને આજે આવશ્યકતા છે દલપતરામ જેવા અસંખ્ય વકીલોની. ચાલો, આપણે ગુજરાતી શાણી વાણી રાણીના કદાચ વકીલ ન થઈ શકીએ, પણ તેના ગુમાસ્તા તો થઈએ.

૧૧-૨-૨૦૧૦

**ભગવતીકુમાર શર્મા**

## તંત્રીસ્થાનેથી....

### ઢાંકીસાહેબને પદ્મભૂષણ



દવા લઈને સૂઈ ગયો, ઘસઘસાટ ઘેનમાં હતો ત્યાં કવિમિત્ર યજોશ દવેનો જીન આવ્યો – ઢાંકીસાહેબને પદ્મભૂષણ....

રજી રજી રજી થઈ ગયો. ઢાંકીસાહેબના જીન નંબરના અડધા આંકડા દબાવ્યા, પણ પછી રિસિવર મૂકી દીધું. ના, અત્યારે જલેલ નથી પહોંચાડવી. સવારે રૂબરૂ જઈશ એમની પાસે.

સાવલીમાં જ્યાદેવ શુક્લે યોજેલા એક સેમિનારમાં ઢાંકીસાહેબને સૌ પ્રથમ જીયેલા, સાંભળેલા. ખાસ્સાં વર્ષો અગાઉ એમને ‘કુમાર’માં વાંચેલા. ઢાંકીસાહેબ અમદાવાદ આવ્યા એ પછી યજોશ સાથે એમને મળવાનું થયું ને એ પછી તો વારંવાર મળવાનું થતું રહે છે. એમની પાસે એમની વિદ્વત્તાનો જરીકે ભાર ન લાગે.

નરી હળવાશ, નીત્યો સ્નેહ. નર્યા વાત્સલ્યનું જ જાણે સાક્ષત સ્વ-રૂપ ! જાણે વાત્સલ્યનું જવંત મંદિર ! ક્યારોક જરીક વાર છૂટવાનુંયે મન થઈ આવે એવું એમના સ્નેહનું આદિગન !

નાજુક શરીર. મેરુ જેવું મન. જગત આખાયને સૂક્ષ્મતાથી નીરખવા, ચાહવા સર્જયું હોય તેવું હૈયું. સર્વ રંગ-રૂપ-ધ્વનિ-રસને પીવા, આસ્વાદવા હંમેશાં તત્પર એવી છ્યે ઠિન્ડિયો. મુખડાની માયા લાગે એવું નમણું લંબગોળ મુખ. થોડું મોહું નાક હડપચી જરીક આગળ પડતી. વિશાળ કપાળ. આધા થઈ ગયેલા વાળ. યુવાનીના ફોટાઓમાં વાળ ખાસ્સા, જરી વાંકડિયા. કપાળ પર જમણી તરફ જતો વાળનો ફાળ. ચીવથી ઓળેલા વાળ. પ્રમાણમાં જરી મોટા, બ્રાઉન ફેમમાં ચેરમાં. ચેરમાંના કાચ પાછળ મેધાવી વેધક આંખો – જાણે અંદર-બહાર આરપાર જોતી આંખોમાં જાણે સૂક્ષ્મદર્શક મંત્ર અને દૂરબીન બંને એક સાથે. ગીણું અને દૂરનુંયે જોનારી, પળમાં પરખનારી નજર. કાળની સાપેક્ષ અને કાળથી પર થઈનેય, પુશતત્વને, સત્ત્વને, અભિલ બ્રહ્માંડના સૌદર્યને ‘દર્શન’ સાથે ઘટક ઘટક પીનારી અને પાનારી દિશિ. એમની પાસે જન્માત સંશોધકનું મગજ; હાથમાં લેપટોપ રાખવું ન પડે. ઈંશ્રે જાણે મગજમાં જ આખ્યાં. હોય વધારણાં. માઈકો-પોસેસર અને મેમરી-ચીપ્સ્ય – જે વિવેકપૂર્વક, પ્રમાણ સાથે અવિરત કાર્ય કર્યા કરે. નર્મ-મર્મ સાથેની વાતો વેળાએ પાતળા હોઠના ખૂણોથી, અને આંખના ખૂણોથી, વિનોદસભર સ્મેન્ટ રેલાય, મરક મરક, કૂણા કૂણા બનારસી પાનના. રેલાતા. રસ સમુદ્ર ! તો કોઈ કોઈ વાત વેળા મુક્તમને ખડ્ખડાટ હસે. એમના મુક્ત હાસ્યનાં મોજાં પર મોજાં જોઈને ભાયાણીસાહેબનું હાસ્ય તરત સાંભરે. આ ઉમરેય મૂડમાં આવી જાય ત્યારે મીમિકીય કરે. અસલ ભાયાણીસાહેબ જેવો જ અવાજ કાઢીને એમની જ શૈલીમાં વાત કરે. જીન પર પણ તેઓ રૂબરૂ વાત કરતા હોય એવી નિરાંતે વાત કરે. પણ ગીતાબહેનની ક્યારેય ફરિયાદ ન હોય. ઢાંકીસાહેબને જે ગમેતે તેઓ નિરાંતે કરી શકે એ માટેની બધી જ અનુકૂળતા ગીતાબહેન કરી આપે.

ઢાંકીસાહેબ નિરાંતે, રસથી અનેક વિષયોને સંકળતા જઈને સરસ વાતો કરે. દરમ્યાન

મર્માણું સિમત અને રમૂજ તો વાતવાતમાં જારનાં દાખાનાં જેમ વેરાતા જાય. અનેક વિષયોનાં તેઓ ખાંઢું, આથી એમની વાતોની રેન્જ પણ ખૂબ મોટી – શાસ્ત્રીય સંગીતના કોઈ મોટા ગાયકની હોય તેવી. કેળવાયેલો, ધૂંગરાયેલો, મધુર અવાજ. વાતોમાં અનેક વિષયો રસ રેલાવતા પ્રગટ થતા જાય ને અનેક ‘મૂડ’ અને રંગ ઉઘાડ પામતા જાય અને ‘બાત બનતી’ જાય. કોલેજકાળ દરમ્યાન, મિત્ર સાથે લગાવેલી શરતના કારણે, આગલી બેન્ચે બેઠેલી સહાધ્યામી કન્યાના અંભોડામાંથી પોતે એક કૂલ કઈ રીતે સેરવી લીવેલું અનીય વાત કરે ને પછી બાળક જેવું નિર્દેશ હાસ્ય રેલાવતાં રેલાવતાં એમનો ચહેરો રત્ના પડતો ગુલાબી થઈ જાય. કોઈ સેમિનારમાં એ શું બોલ્યા હતા એની વાત કરતાં, જરી પોજ વર્દિને, હળવોક ખોખારો ખાઈને, જાણે રેઝ પરથી બોલતા હોય તેમ – સંભાપણના ટોનમાં બોલે – એમની એ વાણી તો જાણે આણા ગુલાબી કોરા કાગળ પર ચીપી ચીપેને એકેદય ભૂલ વગર લખાતા મરોડાર જાંબલી અક્ષરો જેવી ! એમનાં વ્યાખ્યાનો પણ એવાં જ નમૂનેદાર. કેરી વિશે વાત નીકળે તો કેરીનીય લગભગ બધી જ જાતો વિશે એમને પૂરી જાણકારી – રંગ-રૂપ-સોડમ-સ્વાદ-રસની લાક્ષણિકતાઓ આદિ. અન્ય વિષયોની વાતોમાં પણ કેરીની સુંદર જાતો જેવા વિવિધ ‘રસ’ છલકાતા જાય. શાસ્ત્રીય સંગીતની વાતો કરતા હોય ત્યારે તો સૂર-રાગ-ધ્વનિ આદિ જાણે રંગો અને આકારો પણ ધારકો કરતા જાય ! કષાટકી સંગીતને તેઓ દક્ષિણ ભારતનાં મંદિરોનાં સ્થાપત્ય સાથે સરખાવે તથા ઉત્તરભારતના સંગીતની તુલના ઉત્તરભારતનાં મંદિરોના સ્થાપત્ય સાથે કરે ત્યારે તો જાણે જામો પરી જાય ! પ્રમાણ માટે કશુંગ ગાઈન તેઓ જ્યારે એની જલક રજૂ કરે તો મનમાં જાણે દક્ષિણનાં મંદિરોનાં શિખરો રચાવા લાગે ને અવાજ-રાગ સાકાર – સાદશ્ય થવા લાગે – થોડી કાંશોમાં જ કલ્યાનમાં રચાઈ જતા મંદિરની જેમ !

એમના ઘરે જતાં જ એમના વાત્સલ્યનો, હુંકનો ને એમની કળારસિકતા તથા કલાર્મર્જનતાનો અનુભવ થાય. નંદુ પરીખ તથા ધર્મશ પંચાલનાં ચિત્રોથી દીવાલો શોભતી હોય. જોનારન્ય મન ઠરે તેવાં એ ચિત્રો. નાની-મોટી ચીજો સરસ ગોઠવી હોય. એમાં નાનકડી સુંદર ફેમાં મદેલી એમના યુવાન શિષ્યોની છબીઓ પણ હોય. કેટલાક શિષ્યો તો એમને મન દીકરા કરતાંય અધિક. લાડથી કેટલાંકનાં તો વિશિષ્ટ, લાક્ષણિક નામ પણ પાડાયું હોય. આ નામોનો તથા ચચિત્રનાં કેટલાક અંશનો તેઓ તેમની વાર્તાઓમાં માર્મિક ઉપયોગ પણ કરે. એમના ઘરે પીયુષ કે અમિતાભ મદિયા જેવા નવા થનગનતા ચિત્રકારો બેઠા હોય, કલા ઉપરાંત ‘દર્શન’માં રસ ધરાવતો હેમત હોય, જાણીતા કવિઓ કે સાહિત્યકારો પણ હોય; પુરાતત્વમાં, જૈનવિદ્યામાં કે સ્થાપત્યકલામાં રસ ધરાવનારા પણ હોય. સંગીત, ચિત્રકણા ઉપરાંત નૃત્યકળામાંય એમને ભારે રસ. સાહિત્યના વાદો વિશે પણ તેઓ ઘણી વાર ગોછિ કરે. શિરીષ પંચાલ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ભોળાભાઈ પટેલ, લાભશંકર ઠાકર, શ્રીકાન્ત શાહ આદિ સાથે ઝોન પર પણ લાંબી ચર્ચાઓ ચાલે. આપણા સાહિત્યમાં ‘તત્ત્વજ્ઞાન’ કે ‘દર્શન’ ઊંડાણપૂર્વક, સમજપૂર્વક નથી પ્રગટતું એની ફરિયાદનો સૂર પણ અવારનવાર ગેડે. સાહિત્યકારોએ તત્ત્વજ્ઞાનો અભ્યાસ કરવો જોઈએ એવું તેઓ માને. આધુનિકતાના નામે માત્ર કલાનો – તરંગોના ઘોડા દોડાવવાથી અંતે શું ? એવો પ્રશ્ન એમને થાય. ‘તામ્રશાસન’ નામે એમણે ફેન્ટસી – કાલ્યનિકા રચી. જેમાં એમણે કલ્યાનની

સાથે સાથે ઠોસ વાસ્તવનો પણ ઉપયોગ કર્યો; તત્ત્વજ્ઞાન, પુરાતત્વ, દેવાલયોની સ્થાપત્યકલા આદિના એમના ઊંડાનવિશ્વાળ જ્ઞાનનો પણ આ કાલ્યનિકામાં વાસ્તવિક પાત્રો રચીને, સમુચ્ચિત વિનિયોગ કર્યો. ‘તામ્રશાસન’ તેમજ બીજી થોડીક એમની વૈવિધ્યસલભ વાર્તાઓ ‘પરબ’માં પ્રગટ કરેલી. એમના જેટલી સુંદર હસ્તપ્રત ભાગ્યે જ ‘પરબ’ માટે મળે છે. કમ્યૂટરમાં મેટર કમ્પોઝ કરાવીને, પાંચ-છ વખત પ્રૂફ જોઈને, લગભગ ભૂલરહિત થયા પછી તેની પ્રિન્ટાઉટ કઢાવીને તેઓ ‘પરબ’ માટે મોકલે. જોડણી માટેય એમના ચોક્કસ આગાહો. જેમકે, ‘બંને’ નહિ, પણ ‘બન્ને’. જીવનની પાછલી વયમાં એમણે વાતાવરીન શરૂ કર્યું અને કેટલીક સુંદર વાર્તાઓ આપી. ગીતાબહેનની અને પછી પોતાની ગંભીર માંદગી આવી. પથારીમાં પડ્યા રહ્યું પડે. મેલ નર્સ એમની દૈનિક ડિયાઓ માટે આવે. એમને નવડાવે, માથામાં તેવા નામી દે વગેરે. આમ છતાં એમનું મન પ્રસન્ન ! નર્મ-મર્મ સાથે રમૂજો વેરતું. નબળા-માંદા શરીર પાસેથીય તેઓ મક્કમ મને કામ લેતા રહે.

ઢાંકિસાહેબનો જન્મ ઉ ૧ જુલાઈ, ૧૯૮૭ના રોજ પોરબંદરમાં. મૂળ વતન ઢાંક. દશશીમાળી સ્થાનિક જૈન વિશ્વાળ ઢાંક ગામથી આવીને પોરબંદરમાં સ્થાયી થયેલા. પિતા અમિલાલ અને માતા રળિયાતબહેન. પિતા ઉદ્યાનવિદ્યાના જાણકાર તથા ચિત્રકાર, સાહિત્ય તથા સંગીતમાં રસ-સુર્ચિ. મધુસૂદન ઢાંકિનું શાળાનું શિક્ષણ પોરબંદરમાં. વિદ્યાર્થીઓની ચેતનાને સંકોરનારા રહિતલાલ ધ્યાય તથા મણિભાઈ વોરા જેવા શિક્ષણો તેમને મળ્યા. તેઓ શાળામાં હતા ત્યારથી ‘કુમાર’માં આવતા ચિત્ર, કવિતા તથા શિલ્પ-સ્થાપત્ય આદિ કળા-વિષયક લેખોમાં રસ પડવા માંડ્યા. મોટા થયા પછી એમણે ‘કુમાર’માં લેખો લખ્યા અને ૧૯૭૪માં એમને કુમારચંદ્ર મળ્યો. પોરબંદરની શાળામાંની ડિસ્ટિક્શન સાથે તેઓ મેટ્રિક થયા. ત્યારથી આ જન્માત સંશોધક જીવને પુરાતત્વવિદ્ય થવાની જંનના. પૂનાની ફર્જુસન કોલેજમાંથી તેઓ ભૂસ્તરશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્ર સાથે ૧૯૮૮માં સાતક થયા. ૧૯૮૦માં પિતાજીના આગાહી સેન્ટ્રલ બેન્કમાં નોકરી સ્વીકારી. પણ બેન્કના કામમાં આ કલારસિક સંશોધક જીવને ગોઠાયું નહિ. મિત્રો તથા વડીલોની સાથે મળીને એમણે ‘આર્કિયોલોજીકલ સોસાયટી’ ઓફ પોરબંદરની સ્થાપના કરી. મંદિરોનું નિરીક્ષણ, તસ્વીરીકરણ તથા દસ્તાવેજકરણ કામ આરંભ્યું. ને આમ રસની ક્રિતિજ બણી મક્કમ ડાગ ઉપાડ્યા. વડોદરા મ્યુલિયમના ક્યુઓરેટ અને પુરાતત્વ નિયામક ડૉ. ગોમેતજીનું પ્રોત્સાહન એમને મળતું રહ્યું. એ સમયને યાદ કરાંને ઢાંકિસાહેબને નોંધ્યું છે – ‘મારી મુખ્યત્વા અને જિજ્ઞાસાનો એ યુગ. મંદિરો પરતે તીવ્રતમ લાગણીઓ હતી. સપનામાં પણ એ બધું જ દેખાતું... શોખની સાથે જ પશ્યતા (perception) પ્રાપ્તિની બુનિયાદ નંખાઈ.’

૧૯૮૮-૮૯ના ગાળામાં એમણે કૃષિ ખાતાના સંશોધનવિભાગમાં જૂનાગઢ ખાતે કામ કર્યું. ત્યારબાદ મ્યુલિયમના ક્યુઓરેટ તથા ડિસ્ટ્રીક્ટ આર્કિયોલોજીકલ ઓફિસર તરીકે કામ કર્યું. (૧૯૮૮-૮૯ જૂનાગઢ, ૧૯૮૯-૯૦ જીમનગર). આ દરમ્યાન મંદિરોના સ્થાપત્યનો એમણો સંઘને અભ્યાસ ચાલુ રહ્યો. જામનગરના વિશિષ્ટ મકાનોનાં કાણશિલ્પોનું એમણે સર્વેક્ષણ કર્યું અને કાણશિલ્પના શાસ્ત્રગ્રથ ‘પ્રમાણમંજીરી’ સાથે તેની તુલના કરી. ૧૯૯૧-૯૨ દરમ્યાન તેમણે પુરાતત્વ ખાતામાં એક્સાવેશન એન્ડ એક્સ્પોરેશન બ્રાન્ચના ઈન્ચાર્જ તરીકે રાજકોટની મુખ્ય ઓફિસમાં કામ કર્યું. પ્રભાસ, લાખાબાવળ, આમરા-ટીંબાઓ,

બાદરકંઈ રોડી વગેરે જગ્યાઓના ઉત્તનન કાર્ય વજતે એમને વિશુદ્ધ પુરાતત્ત્વના પ્રત્યક્ષ અનુભવો થયા. આ સંદર્ભે એમણે નોંધ્યું છે –

‘પછી મેં વિશુદ્ધ-પુરાતત્વમાં ઘણો રસ લીધો. પહેલાં મારો રસ પુરાતત્વની એક જ શાખા – દેવાલય સ્થાપત્ય પૂરતો સીમિત હતો; પણ હવે પુરાતત્વ પ્રોપરનો ચસકો લાગ્યો.’

આ ચસકો મધુસૂહન ઢાંકીને ક્યાં ક્યાં લઈ ગયો? – અમેરિકન એકેડેમી ઓફ બનારસ (૧૯૬૬-૭૭), અમેરિકન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન સ્ટડીજમાં સંશોધન અધિકારી તરીકે (૧૯૭૦-૭૨, બનારસ), ભારતીય કલા અને પુરાતત્વના રિસર્ચ પ્રોફેસર તરીકે લા. ડ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંહિરમાં (૧૯૭૭), વળી પાછા બનારસમાં Alls ખાતે એસોસિએટ ડાયરેક્ટર તરીકે ડેપ્યુટેશન પર, પછી ડાયરેક્ટર તરીકે પ્રમોશન, આ જ સંસ્થામાં ૧૯૮૬થી ૨૦૦૫ સુધી ડાયરેક્ટર તરીકે કાર્ય, રોમન અને ગોધિક સ્થાપત્યના અભ્યાસ અર્થે યુ.કે., ફાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ તથા યુ. એસ. એ.નો પ્રવાસ (૧૯૮૧ અને ૧૯૮૩) આ દરમાન યુ.એસ.એ.માં શિકાગો યુનિવર્સિટી, તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન, યુ.કે.માં ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે વ્યાખ્યાન ઉપરાંત અનેક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સેમિનાર તથા પરિસંવાદોમાં ભાગ લીધો. દેશની તથા વિદેશની કેટલીક યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. માટેના સલાહકાર, માર્ગદર્શક બન્યા.

ગંગાવતરણ જેવું એમનું ભગીરથ કાર્ય છે – ‘ધી અનેસાઈકલોપીડિઆ ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર’.

કિશોરવસ્થાથી પાંડિત ઓમકારાનાથ, ફેયાઝાં વગેરેનું તથા જ્યુશિકા રોય અને એમ. એસ. સુભ્બલક્ષ્મિનાં ભજોનું એમને ભારે આકર્ષણ હતું. સુભ્બલક્ષ્મિના વિશિષ્ટ કંપન-ઝંકારે તેમને કર્ણાટકી સંગીત શીખવાનું મન થયું. એક વર્ષ સુધી તેમણે કર્ણાટકી સંગીતની તાલીમ લીધી. શ્રી છન્નુલાલ મિશ્ર પાસે તેઓ પાંચેક વર્ષ પદ્ધતિસર હિન્દુસ્તાની સંગીત પણ શીખ્યા. એમણે ‘આગિયો અને સ્વર્ણભામર’, ‘સંગીતમાં રક્તિનો વિભાવ’, ‘રાગ માલકૈંસનું અસલી અભિધાન’, ‘સંગીતમાં વાદ્વાદની શ્રેષ્ઠતા’ જેવા સંગીત-વિષયક નિબંધો – લેખો લખ્યા. ઉપરાંત એમણે સંગીતકલા વિભૂતિઓનાં શબ્દશિખ્રો પણ આલેખ્યાં. આ લેખોનો પછીથી ‘સત્પક’ નામે સંગ્રહ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદે એમનો ‘શનિમેખલા’ ગ્રંથ પ્રગટ કર્યો. જેને ઉમા-સ્નેહરાશિમ પારિતોષિક (૨૦૦૬) પ્રાપ્ત થયું હતું.

પદ્મભૂષણની ઘટનાને મુ. ઢાંકીસાહેબ સાક્ષીભાવે તટસ્થતાથી જુયે છે અને કહે છે કે, પદ્મભૂષણ કોઈ યુવાન પ્રતિભાને મળવો જોઈએ. કણ-ઇતિહાસ, સાહિત્ય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય આદિ અનેક વિષયોના જાણતલ, કલાધર્મી, સૌંદર્યધર્મી એવા આ જન્મજાત રચિક સંશોધક વિદ્વાનને વંદન.

૨૪-૨-૨૦૧૦

યોગેશ જોણી

## કવિતા

ચાર ગંગા | નીતિન વડગામા

### ૧. નોંધ લેવી જોઈએ

આવતાં-જાતાં બધાંની નોંધ લેવી જોઈએ.  
દેહના આ દબદ્બાની નોંધ લેવી જોઈએ.

આજ કડવી જેર છે, એ વાત જુદી છે છતાં,  
કાલની મીઠી મજાની નોંધ લેવી જોઈએ.

ઉંઘનું ઓસડ બનીને રાતને પંપાળતી,  
બાલભીની વારતાની નોંધ લેવી જોઈએ.

પ્રાણ પૂરે છે અહીં એકાદ પગલું કોઈનું,  
જવતી કોઈ જગાની નોંધ લેવી જોઈએ.

બાદબાકી એક વ્યક્તિની થતાં શું થાય છે?  
સાવ સૂની આ સભાની નોંધ લેવી જોઈએ.

અદ્વિતીયાને પણી લેણુર જાગું થઈ જશે,  
ઉગતી એ આપદાની નોંધ લેવી જોઈએ.

આજને તો આપજો આધાર સ્તર્યો એ જ છે,  
ચાસ જેવા આ સખાની નોંધ લેવી જોઈએ.

### ૨. સમાધાનો નથી કરવાં

ચરણને ચાલવા માટે સમાધાનો નથી કરવાં.  
જવા કે આવવા માટે સમાધાનો નથી કરવાં.

અમારે જવતી એ પાંખનો આધાર મોટો છે,  
કદીયે ઉડવા માટે સમાધાનો નથી કરવાં.

સહજ રીતે થતા અજવાસને તો આવકાંદું પણ,  
તિમિરને તાગવા માટે સમાધાનો નથી કરવાં.

હશે જો જંખના પગની, પગથિયું આવશે સામે,  
પગથિયે ખોંચવા માટે સમાધાનો નથી કરવાં.

શિખર લગ લઈ જશે અમને અમારી સહેજ આ સમજજા,  
ધજા ફરજાવવા માટે સમાધાનો નથી કરવાં.

### ૩. લખાતું હોય છે

જાતમાંથી કેક જાતું હોય છે.  
આ બધું ત્યારે લખાતું હોય છે.  
વ્હેચવાને વ્હાલ આખા વિશ્વને,  
ટાંડ-તડકો ઝાડ ખાતું હોય છે.  
  
ફૂટા એ પાનની ભીનાશથી,  
પોત ટફકાતું રચાતું હોય છે.  
  
એક વરસાદે બધું ભીનું થતું,  
એક વરસાદે દાખાતું હોય છે.  
  
આંખ અંદરની ઉઘાડી હોય તો –  
ભોગિયા વિના ભમાતું હોય છે.  
  
ક્યાં ગજું છે આપણા આ કઠનું ?  
કોઈ આવીને જ ગાતું હોય છે.  
  
શબ્દનું જરણું વહે એકાદ ને –  
આખરે હળવું થવાતું હોય છે.

### ૪. ઓછી પડી

જાતની સાથે કરેલી જાતરા ઓછી પડી.  
કોણ જાણો કેમ સંઘળી આવ-જા ઓછી પડી !  
  
આપણો તો આપણાથી વેગળું રહેવું પડકું,  
પંડને પણ પામવાની પાત્રતા ઓછી પડી.  
  
આમ ઝાકળને વધીરી તોય એ તરસ્યો રહ્યો,  
સૂર્યને શું એટલી એ માનતા ઓછી પડી ?  
  
કુવરીની જેમ ખાડો પેટનો વધતો રહ્યો,  
બાળકોને એકલી આ વારતા ઓછી પડી.  
  
એટલે તો ઘાટ ઘડવામાં પછી પાછા પડ્યા,  
આ સુગંધી આયખામાં આપદા ઓછી પડી.

### ૫. | દિલીપ જોશી

બા ! મને પહેલાં કરતીંતી એવું વ્હાલ કર...  
હળુહળુ મમતાળો હાથ મૂક માથા પર  
કિલ્લોલે આખુંયે ઘર....  
  
પહેલાંની જેમ ફરી, હોંશિલી છોળ ભરી  
ઝાંખ હવે ઝરમર વરસાદ  
જળગણિયા આંજેલી આંખોમાં તગતગતી  
કાયમની મારી ફરિયાદ  
બા ! મને ગમતું નથી રે ક્યાંય તારા વગર...  
  
રજાઓમાં આવતો હું, ત્યારે પીરસતી તું  
થાળીમાં આખો સંસાર !  
આજે કંદેહ તારો ચેતન વિહોષો ને  
ધબકે છે કેવળ સંચાર !  
બા ! જરા પડખું ફેરવ તો બને સહુનો અવસર !...

### પડછાયો | દિલીપ જોશી

હું ચાલુ તો ચાલે સાથે અરકું તો એ અરકે !  
કદ પરમાણો વધી-ઘટે ને પગલે પગલે ભટકે !  
  
બાથ ભરું તો સંકોરઈ શરમાતો તરબેટે !  
આમ જુઓ તો હોય લગ્નોલગ આમ જુઓ તો છેટે !  
પળેપળોને વ્યક્ત કરે છે લાંબા-ઢૂકા લટકે !  
  
કાપો તો કષ્યાય નહીં ને સંધ્યે ના સંધ્યાતો !  
ઉજળાનો પણ હોય જગતમાં ઘન-ઘેરાતો નપતો !  
વાદળનું છતાર ધરવાથી ક્યાંનો ક્યાં એ છટકે !  
  
ઓળખની આડસ વચ્ચેથી સન્નાટો ફેલાવે !  
તખ્તા પરનું સાચ સમયના કારી ઘાવ રુઝાવે !  
મૂળો રૂહીને વાત કહે છે તો પણ કાયમ ખટકે !

## બાધ્યો ધમકાવે | વત્સલ ર. શાહ

બાધ્યાને એક વાર થયું  
કે હું કયાં બાધ્યો છું.  
હું તો અડધો નથી આપણો છું.  
હું કયાં બાધ્યો છું.

તે એણે તો યોજી શાનગોળિ  
એમાં બોલાવ્યા શાની પંડિત અને ભજોશરી  
ને થયાં ચર્ચા, વાદ વળી વિવાદ  
ઉઠ્યો ગગનલેદ નિનાદ

કોઈ કહે કો અન્યો અસ્તિત સદશો મયા  
કોઈ કહે નેતિ નેતિ  
કોઈ કહે અહી બ્રહ્માસ્તિ  
બાધ્યાને થાય ડકોળ છે બધા હાળા  
બધી કાગડા કાળા

છે જરાયે છાંટો બુદ્ધિ, ને કહે થઈ અમારી અંતરશુદ્ધિ  
જન્મયાં ને થોડું વાંચ્યું  
લઈને સળિયો મગજને થોડું ખાંચ્યું  
હવે થઈ ગયા સહુ યામી  
ખુશ થાય જો મણે સલામી  
ને કૃદ્ધ બાધ્યો, થઈ રાત્પોપીળો  
ઉંચા આસને એક થયો ઉલ્લો

ને પાડી ચીસ  
બસે...  
બહુ થયું હવે  
કરો બંધ આ શાન્દવિલાસ  
ચૂપ,  
ન જોઈએ એક અવાજ  
મોંને સીવી દો  
હોઈ ફક્ષાવી, મુખનિવર ઉઘાડી  
હલાવી જીભ તળેઉપર  
ફેફસાંથી ફેંકી હવા આસપાસ  
એથી તમે શું માની બેઠા તમને ખાસ ?  
હવે તમે જેતરમાં હળ ચલાવો.  
લુહારની ધમક્ષ ચલાવો.

સીવો, કાંતો, પીજો, વાવો, બાંધો,  
ઓદો, ક્ષિટ કરો...  
બાધાને ભૂસી કાઢો  
શાન્દને લૂછી કાઢો  
ને મૂંગા મૌઢે હાથ-પગ ચલાવો

બસે.

## પરબ | ગિરીશ ભદ્ર

ધૂટ પીવો કે ઘડા ?  
પરબ પ્રેમની માંડી, ક્યાં આ  
લેશાદેશના થડા ?  
લીતરથી આવે સરવાળી,  
ક્યાંય ન એનું તળિયું;  
હેંચો ને એ વધી અધિકું,  
કરુણાનું ઝળાળિયું !  
રણની તરસ છિપાવે, ઓબે  
ભરીભરી ક્યારડા;  
ધૂટ પીવો કે ઘડા ?  
પીવાથી તો પમાય, એથી  
અદ્ધુ પિવચયામાં;  
અશુજા સિંચી સિંચીને  
વનનાં વન વાવ્યામાં.  
આઠ પ્રહર અર્દિંગા દેશો,  
કલીચા, લીતર-ખડા;  
ધૂટ પીવો કે ઘડા ?

## કેંક કેંકી પી નાંખી... | સુસિમતા જોખી

કેંક કેંકી પી નાંખી  
ઘસદસાટ ઊગતી સવારોના સમ ખાઈ  
કૂકૂદે કૂકૂની સાક્ષીએ  
બે ને બે ચાર કરતાં કરતાં  
ખબર નહીં  
કેટલા યુગો પસાર થઈ ગયા.  
કોઈ જ ભાન વિના સમય  
ગટગટાવી  
પરાજે ઉલ્લા રખા પછી  
અસંખ્ય દિશાઓ તરફ  
કુપળો જેમ ફૂટી વળતા રસ્તાઓ  
બોલાવે છે.  
રસ્તા પર ઊગોળાં બોર તેરી છે.  
કશેય  
જવાની ઠંરણા નહીં  
જમીનમાં પગ ખૂંપી જાય  
મૂળ ફૂટી જાય  
ત્યાં સુધી  
સિથર  
ઉભા રહી શકાય તો કેટલું સારું !

## અને હું એકલો | આબિદ ભટ્ટ

કેટલાં સગપણ અને હું એકલો,  
સેકડો વળગણ અને હું એકલો.

એમ લાગે છું અજાણી ભોમમા,  
લાખ છે દર્દ્દ અને હું એકલો.

ઓતરતાતા વાયરા તો સૂચવે,  
ઢૂકડો ફાગણ અને હું એકલો.

ના મળે છે સાદનો પ્રતિસાદ પણ,  
છે તરસતું રજા અને હું એકલો.

ચાલ ગોકળગાયની એ રાખ તું,  
દોખલું ઘડપણ અને હું એકલો.

એક પળ પણ ચાસ લેવા દે નહીં,  
ઘણ ઉપર છે ઘણ અને હું એકલો.

આ સમયને સાંધવો ના શક્ય છે,  
છે ક્ષણો બટકણ અને હું એકલો.

વિસ્મરણ જો થાય તો રાહત રહે,  
યાદનું બળતણ અને હું એકલો.

## સંધ્યા ઢળી ? | ભાનુપ્રસાદ પંડ્યા

લોક કૃહેતાં કે હવે લ્યો, આપની સંધ્યા ઢળી,  
કૂલ ખીલે છે હંદેરોં આપણી સંધ્યા ઢળી ?

પાનખરમાં થાય થોડો પર્ણહિણો તેથી શું -  
વૃક્ષથી ભરચક દીસે એ બાગની સંધ્યા ઢળી ?

આ નથી કેં સાંજ મારી આજલગ શિરપે રખા  
આયુભરના બોજ શા સંતાપની સંધ્યા ઢળી !

ઓ ઢળી સંધ્યા હવે કલશોર સૂણું પંખીના,  
ઓસરે કોલાહલો - ધોંઘાટની સંધ્યા ઢળી !

કોઈ સંધ્યા હોય એવી ઊજળી મધ્યાહ્નથી  
બાણશયા પર પ્રતાપી ભીખની સંધ્યા ઢળી.

## ડાળ પર મુદ્દી રહી... | એસ. એસ. રાહી

ડાળ પર મુદ્દી રહી છે પાનખર  
રંગ પીળો ઓફરો નક્કી ડગર.

માત્ર બે છાંચ પડવા તો શું થયું  
ક્યાં ગયું લાપેલું મારું પ્રેમઘર ?

પંચતત્ત્વોનો જ હું છું એક અંશ  
કેમ પૃથ્વીને નથી એની ખબર ?

મૌતનો સાઝો મેં હેઠો બેધડક  
ક્યાં હવે લાગે ખુદાનો કોઈ ડર ?

બે ઘડીમાં વર્ણવું મારી બથા  
બે ઘડી આવો તમે પાસે અગર.

## વરસો પહેલાં ભીતરથી... | અનિલ ચાવડા

વરસો પહેલાં ભીતરથી કેં ઘૂઘવ્યાં'તાં પારેવાં  
અનિલ નામના ઘરમાં જ્યારે આયું'તું કોઈ રહેવા.

હીડોળાઓ ખૂબ હોશથી

જૂલ્યા'તા આંગણીયે,

રહુકા તો આવી બેઠા'તા

ઘરનાં નળિયે નળિયે;

થીજી ગયેલું પળમાં સથાણું લાગ્યું'તું રે વહેવા,  
અનિલ નામના ઘરમાં જ્યારે આયું'તું કોઈ રહેવા.

નક્કી ભીતર કોઈ સ્મરણાનું

વાગી ઉઠાણું છે વાજું,

વરસો હેલાં ઘરબાયેલું

ચારેબાજુ તાજું;

વરસાદ વગર નહિતર આ રીતે ટપકે શીદને નેવાં ?

સબર્બન ન્યૂજર્સીના મોટા સરસ ઓડિટોરિયમમાં ગુજરાતી નાટક જોવા આવનારાંની ઘણી ભીડ થઈ ગઈ હતી. હમેશા મુજબ શરૂ થવાને વાર હતી. હોલનાં બારણાં ખોલવામાં આવ્યાં નહોતાં. લોભીમાં જ અસંખ્ય લોકો આમથી તેમ જતા હતા, ભીડ વધારતા હતા, ઘોંઘાટ કરતા હતા. લોપા ફરિયાદ કરવા લાગી ગઈ હતી. મોહું બગાડી એણે કહ્યું, ખ્યાલ આવ્યો ને હવે કે હું કેમ આવા પ્રોગ્રામોમાં જતી નથી?

એની ફેન્ડ કોકિલાએ બહુ આગ્રહ કરેલો. કહેલું, મુંબઈથી ગ્રૂપ આવ્યું છે. ને નવું જ નાટક લઈને આવ્યાં છે એ લોકો. બહુ જ હસવાનું છે. પણ ભીડ, ઘોંઘાટ ને વિવંબને કારણે લોપા એટલામાં જ થાડી ગઈ. લોભીનો કોઈ જરા ખાલી ભાગ શોધવા એ પાછળ તરફ ગઈ. બારણાંથી દૂર એ બાજુ લીડ જરા ઓછી હતી ખરી. કોકિલાને બોલાવી લેવા એણે મોહું ફેરબ્યું તો સામે જ ચંદ્રાને જોઈ. એ પણ કોઈ બહેનપણીને શોધી જ રહી હતી. લોપા અને ચંદ્રા બંને પહેલાં જરા ચોકી ગઈ. મળવાનું કલખ્યું નહોતું બેમાંથી ઢોઈએ.

પછી ફોર્મલી હસીને અરસપરસ કેમ છો કહ્યું. વધારે કશી વાત થાય તે પહેલાં બંનેની સાથીદારો આવી ગઈ, ને હોલમાં જવા માટે બારણાં પણ એ જ ઘડીએ ખોલવાયાં. લોપાનું ધ્યાન હવે ક્યાંયે ના રહ્યું. એકચ્યુઅલી એ જરા હચમચી ગઈ હતી. ઘણા વખતે ચંદ્રાને જોઈ. સહેજ સુકાયેલી લાગી, એણે વિચાર્યું, ને સાથે દિવાકર કેમ નહોતો? બંને સાથે જ હોય. એકલાં ક્યાંયે જાય જ નહીને. જૂના કોઈ વખતની ચીડ એના મન પર અત્યારે ચઢી આવી. કે પછી દિવાકર દેખાયો નહીં? લોપાએ આમ-તેમ જોવા મોહું જરા ફેરબ્યું.

ખાસ કોઈ ઓળખીનું દેખાનું જ નથી, નહીં? કોકિલા બોલી. પણ તું ચંદ્રાને ઓળખે છે તેનો મને ખ્યાલ નહોતો.

કેવું થયું, નહીં? - એની જિંદગીમાં ?

શું થયું? લોપાએ ચમકીને પૂછ્યું. મને કશી ખબર નથી.

પડતો ખૂલવા માંડગો હતો, નાટક શરૂ થતું હતું. કોકિલા વાત કરી ના શકી. લોપાએ વિચાર્યું, શું થયું હશે?

માંદગી આવી હશે? છોકરાના અંગેજમેન્ટ ટૂટ્યા હશે? કે પછી ચંદ્રા અને દિવાકરના ડિવોર્સ થયા હશે? ના, એ અનુમાન લોપા પોતે જ માની ના શકી. એવી તો શક્યતા જ ન હતી.

ઓડિયન્સમાં હસવાનું ચાલુ થઈ ગયું હતું. લોપાના કાન સુધી એ કશું પહોંચતું નહોતું. એ વિચારોમાં મળ થઈ ગઈ હતી. કે પછી સ્મરણોમાં મહિનાઓ પછી, સતત ઘાવાયા કરવાની સ્થિતિ માંડ કંઈક સુધરી હતી. ને ત્યાં આમ ચંદ્રા મળી ગઈ. બધા ઘા ફરી જાણે ખૂલી ગયા. અંદર ને અંદર લોહી ફરી વહેવા માંડયું હોય એમ લોપાને લાગ્યું.

કોઈને કહેવાય એવી વાત નહોતી. એ છૂંધી રહી શકી હતી તે ય નવાઈ જ ને.

દિવાકર ઘરમાં સાવ નોમ્બર રહેતો હતો. જોકે ઘર જ એની પ્રાયોરિટી હતી, તે સ્પષ્ટ હતું. લોપાને પહેલેથી જ આ કેટલું ખટકતું, પણ એ કશું પણ બદલી શકે તેમ હતી?

લોપાના મનમાં કડવાશ ભરાઈ આવી. આંખોમાં ઝણાજણીયાં આવ્યાં. હજ કશું તુઝ આવી હતી હઠય પર. એમ તો ઓફેર ટૂંકો જ હતો. વધારે તો વાતો જ થતી રહેલી ને? સ્માર્ટ વાતો - વાતોની સ્માર્ટ, જડપી આપ-લે, જુદી જુદી કેટલીયે વાતો. પહેલવહેલી વાર કોમન ફેન્ડસ સુમિતા ને શિશિરને ત્યાં જમવામાં એ બે મળેલાં. એટલે કે લોપા અને દિવાકર - ચંદ્રા. કેમ છો ?, ક્યાંનાં છો ?, શું કરો છો ? - જેવી વાતો નશેય જડો સામસામે કરેલી, પણ થોડી વારે ચંદ્રા મહિલા-ગ્રૂપમાં જઈને બેઠેલી, ને લોપા એકલી પડી ગયેલી.

પછીથી દિવાકર અને લોપા વાઈનાના જ્વાસ હાથમાં લઈને પાછળના પોટિયો પર ઉભેલાં. નીચેના છોડો પર અભેદિયાનાં ફૂલ ખીચોખીય ઝીદેલાં હતાં. કેવા સરસ રંગ છે, લોપા બોલેલી, ગુલાબી અને સર્ફેન્ટ.

અમારે ત્યાં પણ બહુ જ સરસ અભેદિયા થયાં છે. એક છોડ પર સર્ફેન્ટ છે. પણ જાંબલી અને ફૂલગુલાબી ફૂલોવાળા છોડ ઘણા છે.

અરે વાહ, તમે ફૂલગુલાબી જેવો શબ્દ જાણો છો ?

અરે, ચંદ્રાએ બરાબર શિખવાડી દીધો છે. ગાર્ડિનિંગનો શોખ મને છે, પણ મેમસાહેબ કહે તેમ કરવું પડે. બંને હસેલાં. સૌથી સારી ગણાતી નર્સરી ક્યાં છે એની વાત પરથી શૈનનંબરની વેવડાફડ થયેલી. તમે શૈન કરજો ને. હું અનું નામ-સરનામું આપીશ, લોપાએ કહેલું.

આ રીતે જોન શરૂ થયેલા એકલો વાર તો દિવાકરે ચંદ્રાને જાણારેનું એ સ્વાભાવિક હતું. પણ શૈન કોલ ચાલુ રહ્યા, ને એઝો ચંદ્રાને કહેવાનું છોડી દીધું. દિવાકર સાથે વાતો કરવાની લોપાને એટલી મજા આવતી હતી. દરેક બાબત માટે દિવાકર પાસે કંઈક ને કંઈક કહેવાનું હોય જ. માહિલી ના હોય ત્યારે પણ એ જવા તો ના જ દે. સહેજ ગણ્યું મારે. ક્યારેક લોપા અને સાચ્યું માની બેસે, ક્યારેક પકડી પાડે. ને પછી એનું હસવું માય નહીં. કમાલ છો હો. ગણ્યું પણ સાચ્યું હોય તેવું મારો છો. આવે વખતે દિવાકરે અને કહેલું, ખીજ, તમે મને તમે ના કહો.

તો તું પણ મને તમે ના કહેતો. આમ બંને વચ્ચે ફેમિલિયારિટી વધતી ગયેલી.

મોટેભાગે દિવાકરની પાસે માહિલી હોય જ. અમેરિકન શોરમાર્કેટ હોય, રાજકારણ હોય, સ્પોર્ટ્સ હોય, કે પછી મૂવીની વાત હોય - દિવાકરે વાંચેલું હોય અથવા જીયેલું હોય. એની પાસે ઓપિનિયન હોય જ. કોઈક વાર જાણી જોઈને લોપા દલીલ કરે - મૂવીની બાબતમાં તો ખાસ. અમાંથી જ એક વાર એ ખરેખર ચિડાઈ ગયેલી. સિરિયસ મૂવીજ બોરિં હોય છે એવું તું કઈ રીતે કહી શકે છે? સાવ મૂરખ જેવી સ્લેપસિટક કોમેડી જ જેને ગમતી હોય એની સાથે સમય બગાડવાનો કોઈ અર્થ નથી, વગેરે વગેરે. કોણ જાણે સંસારની કઈ બાબતથી કંટાળેલી હશે એ હિવસે કે છેલ્યે એનાથી ફૈન પછાડાઈ ગયેલો.

એ કદાચ પહેલો જાડો. એ પણ સાવ અર્થ વગરનો, બીજે હિવસે લોપાને લાગેલું. એ હિવસાના ફૈનની રાહ જોતી રહેલી. પાંચ હિવસ. છ હિવસ. એ હવે ફૈન નહીં કરે તો? ને એ પહેલી વાર એણે સંતાપ અનુભવો - દિવાકરની ગેરહાજરીનો. ત્યારથી એક

બીજ રોપાયું દિવાકરને માટેની ઝંખનાનું.

દસેક દિવસ પછી એણે મન મક્કમ કરીને ફૈન જોડ્યો. કદાચ છે ને દિવાકર ઉપાડે. પણ ચંદ્રાએ જ લીધેલો. લોપાએ કારણ વિચારી રાખેલું. એણે કહ્યું, શનિવારે હું એક નાનું દિનર કરી રહી છું. તમે બંને આવશો જમવા ? સુભિતા ને શિશિરને પણ કહ્યું છે.

દિવાકર ઘેર નહોતો. એ પછી તમને ફૈન કરશે, એમ ચંદ્રાએ કહ્યું.

હાશ, દિવાકર ફૈન તો કરશે. લોપાને ધરપત થઈ.

ફૈન તો જાણે દિવાકરે કર્યો, પણ એ ઝોમ્બલ થઈ ગયેલો, અને જમવા આવવાનું નહીં ફાંચે એમ કહ્યું. લોપાએ એને મનાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, મને લંચ માટે નહીં મળે ? મારા તરફથી માઝી – લંચ, બસ ?

એક જ વાર કોમન ફેન્ડસને ત્યાં મળ્યાં પછી ત્રણેક મહિના ફૈન દ્વારા જ સંપર્ક રહ્યો હતો. લોપા મનથી દિવાકરની નજીક થઈ ગયેલી. તેથી એ દિવસે લંચ માટે મળ્યાં ત્યારે એ જરા સેલ્ફ-કોન્સિયસ હતી. દિવાકરને જોઈને એને ભેટવાનું મન થયેલું, પણ એણે રોક્યું. દિવાકરે જ્યારે કહ્યું કે બહુ સરસ લાગે છે વેસ્ટરન આઉટફિટમાં, ત્યારે લોપાને ઇન્સ્ટ્રિટિવલી લાગેલું કે દિવાકર પણ એના તરફ ખેંચાયો છે. બનેની આંખો મળેલી. એમાંથી કશાક અર્થ પસાર થયા હતા.

દિવાકરનો ગુસ્સો ઉત્તરી ગયો હતો. એ લોપા માટે એક ભેટ લેતો આવેલો. એ કુંડામાં તાજાની ખીલેલાં થેરા જંબલી રંગનાં ફૂલ હતાં. ઓહ, અઝેલિયા ? લોપા બોલી.

મને વાઢ છે, હોં, કે તને અઝેલિયા ગમે છે. સૌરી કે ફૂલગુલાબી રંગનાં ના મળ્યાં. ચણકતા લીલા કાગળમાં લેપેટેલું કુંઠું લોપાને આપતાં એણે કહ્યું. અને ગીક ભાષામાં એક શબ્દ છે – અઝાલેઓસ, એટલે કે સૂકી જમીન. એના પરથી આ ફૂલનું નામ પડ્યું. પણ સાચો ઉચ્ચાર એઝાલિયા છે, મેડમ, પડી ખબર ?

હા થઈ, તમારા જેવું હોશિયાર કોઈ હોઈ શકે કાંઈ ?

બંને હસીને હળવાં થઈ ગયાં, પણ મળવાનું ઉત્તાવળમાં જ થયું હતું. એક એક સેન્ડવિચ ખાવવાનો જ સમય મળ્યો હતો. ફરી જલદી મળીએ, દિવાકરે કહેલું. મૂવી જોવા જવું છે ?

તું નક્કી કરજે, લોપા બોલેલી.

એને થતું હતું કે જાણે ખસે જ નહીં ત્યાંથી. પણ – ચાલ, હું જાઉં, કહી દિવાકર એની ગાડી તરફ જતો રહ્યો. લોપા એને જતો જોઈ રહી.

આટલામાં જ, કેટલાંથે સંવેદન મિશ્રિત થઈ એના ચિત્તને ગૂંચવી રહ્યાં. જે થઈ રહ્યું છે તે બહુ ખરાબ કહેવાય ? જોકે કશું થયું છે જ ક્યાં ? આ એક વાર તો મળ્યાં. મનમાં જે ઝીલેગ થાય છે તેને પ્રેમ કહેવાય ? પણ ફૈન પર વાત કરતાં કરતાં પ્રેમ થઈ જતો હોશ ? ઈમ્બોરલ કહેવાય એને ? પણ કોઈને દુઃખ ન થવા દઈએ તો ? ને આ તો મૈત્રી છે. બે મિત્રો એકબીજાને ગમી ના જાય ? મૈત્રીનો વિચાર આવતાં લોપા નિશ્ચિત થઈ ગઈ. સંબંધ વધી ગયા પછી પણ લોપા આ જ લોઝિક જાતને સમજાવતી રહી.

દિવાકર શક્ય હોય ત્યારે લોપાને ત્યાં જવા માંડ્યો હતો. રાતે તો એ ભાગ્યે જ જઈ શક્યો હતો, પણ બાપોરે ઓફિસમાંથી નિકળી જતો. છતાં અઠવાડિયામાં ત્રણેક કલાકથી

વધારે મળવાનું બનતું જ નહીં. લોપા ગુસ્સે થતી, રડી પડતી, દિવાકરને પકડી રખતી, પણ એ ચાલી જ જતો. લોપા ફરી મળવાની રાહ જોતી રહેતી.

દિવાકરે એક દિવસ અણધાર્યું જ એને કહ્યું કે હેવ એ એફેર ચાલુ રાખી નહીં શકે. દરેકમાં એક સાતમી સેન્સ હોય છે, એણે કહ્યું હતું. ચંદ્રાને કંઈક આછો વહેમ પડવા માંડ્યો હોય એવું એને લાગતું હતું. કદાચ બેડરૂમમાં દિવાકરની વર્તણૂક જરા જેટલી પણ બદલાઈ હોય. લોપાની સાથે શરીર અને મનથી એ સંકળાયો હતો, ને ગમે તેટલું સાચવે-સંભાળે તો પણ પત્તીને કશું બદલાયાનો જ્યાલ આવી જ જઈ શકે. કુટુંબને એ તૂટી જતું તો જોઈ શકે તેમ જ નહોતો. હોડવાનો હોય તો તે લગ્નેતર સંબંધ જ ને ?

લોપાનો હાથ પકડીને એણે આવું બધું સમજાવું હતું. લોપા સમજતી હતી – પરિણામ શું આવી શકે તે, છતાં આ સંબંધના અંતની વાતના ચાબાખા ખાઈ એનું હદય લોહીલુણા થઈ ગયું હતું. પછીના મહિનાઓમાં એવું વજન ઉતારી ગયું, છાતી બેસી ગઈ, ઉદારીનો ભાર એને ગુંગળાવી રહ્યો. આખરે એ ત્રણેક મહિના ઠંડિયા જતી રહી. લગભગ વરસ આમ નીકળી ગયું હતું.

ઉદાસ થઈને લોપા બેસી રહી હતી, ને નાટક દરમ્યાન એના વિચાર ચાલુ રહ્યા હતા. છતાં, મળવાની – છૂટા પડવાની, પ્રેમની-ઝડપવાની બધી ક્ષણો યાદ કરવાની શક્તિ એનામાં રહી નહોતી. હોલેમાં બેઠાં બેઠાં જ એ અશક્ત થઈ ગઈ હતી.

મોટરાં ક્રોકિલા એને એના હસંબંદ નાટકમાંની જોકો યાદ કરીને હસતાં રહ્યાં. છેક લોપાને ઉતારતી વખતે ક્રોકિલા બોલી, અરે, હું ભૂલી જ ગઈ તને કહેવાનું. બનેવું એવું કે ગાડીને અક્રમાત થયેલો ને ફેસસાંમાં ધૂમાડો એટલો ભરાઈ ગયેલો કે દિવાકર બચી નહોતો શક્યો. પણ ચાલ, અત્યારે જઈએ. કાલે ફૈન કરજે. વધારે વાત કરીશું.

લોપા ત્યાં જ પથ્થરની હોય તેમ ઊભી રહી. આધાતથી એ જડ થઈ ગઈ હતી. જે મહિનાઓ દરમ્યાન એ દિવાકરના પ્રેમમાંથી મનને વાળવા મથતી રહી હતી ત્યારે દિવાકર પોતે તો ક્યારનો યે ચાલી નિકળેલો. જેને અંડ રાખવા માગતો હતો તે કુટુંબ અકલ્ય રીતે તૂટી ગયું હતું.

ઘરની અંદર જઈને આખી રાત લોપા તરફડતી રહી. હદય કલ્યાંત કરતું હતું, ને એની આંખો સૂકી હતી. સવારે એણે ક્રોકિલાને ફૈન ના કર્યો. સીધો ચંદ્રાને જ કર્યો. એ પોતાની વાત કરવા નહોતી માગતી. ને જે છૂપું રંધું હતું તેને છતું કરવા પણ નહોતી માગતી. જો શક્ય હોય તો એ ચંદ્રાને સાંત્વન આપવા માગતી હતી.

જોકે ચંદ્રા ઉપરથી સ્વસ્થ થઈ ચૂકી હતી. એની ફરજ હેવ બે દીકરાઓ તરફ હતી. ને એને સંતોષ હતો કે દિવાકરના શરીરના ઓર્ગન પહેલેથી નક્કી કર્યા પ્રમાણે દાનમાં આપવામાં આવ્યા હતા. કેટલાં જણને એ મદદ કરતો ગયો. એની બે કિડની, લીવર અને હદય પણ ટ્રાન્સપ્લાન્ટ માટે આપ્યે દેવાયું હતું.

અરે, એની આંખો તો કદાચ સૌથી વધારે કામમાં આવી હતી. આમ તો આવાં દાન ગુપ્ત જ રખાતાં હોય છે, પણ એ જ હોસ્પિટલમાં એક એમેરિકન વૃદ્ધાને જરૂર હતી, ને તાત્કાલિક ઓપરેશન કરવામાં આવેલું. લોપાએ હિંમત કરીને ચંદ્રાને એનું નામ પૂછ્યું. વાતો કરતાં કરતાં ભાવની એવી ભરતી ચંદ્રાના મન પર ચઢી હશે કે એણે સહજ ભાવે

નામ કહી દીધું. વળી કહે, આન્ટી એટલાં થેન્ક્ફુલ છે કે વારંવાર ઝોન કરતાં રહે છે, છોકરાઓ માટે કેક બનાવી આપે છે.

ચંદ્રા સાથે વાત કરીને લોપાને થોડી શાંતિ લાગી. જીવતેજુથે દિવાકર પત્નીને સુખી રાજવા માગતો હતો, ને મરણમાં એ પત્નીને ગૌરવ બક્ષતો ગયો હતો. લોપા મનોમન લજવાઈ પણ ખરી. જે પોતાનો નહોતો ને થઈ શકે તેમ નહોતો એનો કેટલો વાંક કાઢતી રહી હતી એ છેલ્લા એક વર્ષથી ! ને ચંદ્રા ? પંદરેક વર્ષનો સંસાર વિચિન્ન થઈ ગયો હતો તે છતાં કેટલો ડિનિનીથી જીવી રહી હતી.

એક સવારે બેલ સાંભળીને મિસિસ ચાન્સેલરે બારણું ખોલ્યું. સાંદ્રાં ક્રાપડાં પહેરેવી એક દેખાવડી ઈન્જિનિયન સ્ત્રી પગથિયાં પર ઊભી હતી. એ સમજી ગયાં કે કુટુંબની વ્યક્તિ હશે – પોતાને આંખોનું દાન કરનારના કુટુંબની. એમણે કંદું, આવો ને અંદર.

લોપા એ હસતી આંખોમાં જોઈ રહી હતી. જે આંખોને એ ગમી ગઈ હતી તે જ આંખો હતી ને આ ! પોતે જેની સાથે નજર પરોવી બેસી રહેતી હતી તે જ આંખો હતી ને આ ! જે છોડીને જતો રહ્યો હતો તે પ્રેમપાત્રની બચી રહેતી છેલ્લી નિશાની હતી આ. બસ, એક વાર એને ફરી જોઈ લેવી હતી.

લોપાના હાથમાં તાજાં સુંદર ઘેરા ફૂલગુલાની રંગનાં અઝેલિયા ફૂલનું રૂપેરી કાગળમાં લેપેટેલું કૂંઠું હતું. બે હાથ લંબાવીને એણે એ એમની સામે ધર્યું. આ તમારે માટે લાવી છું.

ઓહ, મને અઝેલિયા બહુ જ ગમે. થેન્ક્સ, મિસિસ ચાન્સેલરે કંદું. આવો ને અંદર. એક કૃપ ચા પીને જાઓ.

લોપા અપલક એ હસતી આંખોમાં જોઈ રહી હતી. થેન્ક્સ, પણ આજે નહીં, કહી હાથથી ગૂડબાય જણાવી એ પગથિયાં ઊતરી ગઈ. મોટરમાં બેસી જોરથી એણે આંખો મીંચી દીધી. દિવાકરને એમાં એ હંમેશ માટે બચાવી રાજવા માગતી હતી.

r

## કવિતા

(૧) ગુલાબ વાટિકા : કેશવભાઈ લાડ, ૨૦૦૮, ડાહીબહેન કે. લાડ, મુ.પો. એટું, દ+૮૪, રૂ. ૫૦/- (૨) મહેદ્દિલ ગજલ : કેશવભાઈ લાડ, ૨૦૦૮, ડાહીબહેન કે. લાડ, પો. એટું, પૃ. ૧૧+૪૧, રૂ. ૫૦/- (૩) તુલસીને ક્યારે ક્યારે દીઠા મેં કાનણી : કેશવભાઈ લાડ, ૨૦૦૮, ડાહીબહેન કે. લાડ, મુ. પો. એટું, પૃ. ૫+૭૫, રૂ. Nil. (૪) હંસનાદ : હંસા નિવેદી, ૨૦૦૮, રોહિણી નિવેદી, રી/૭/૧૦, ચિનાઈબાગ એપાર્ટમેન્ટ, અમદાવાદ-૬, ૨૪+૬૦, રૂ. ૫૦/- (૫) વિધવા : ‘સાગર’ સમોલિયા, ૨૦૦૬, સાગર, સમોલિયા જી-૮/૨૦૮૫, રણજિતનગર, જામનગર-૫, પૃ. ૩૨, રૂ. Nil.

## લઘુકથા

## સુખી હોવાનું વૃત્તાંત

રમેશ નિવેદી

ઓહિસ છૂટવાના સમયે જ દીપાનો ઝોન આવ્યો, ને એ પાછી એવી તો લપરી તે જલદી વાતનો ચેપ મૂકે જ નહીં. આજે ખાસણું મોંઢું થઈ ગયું. રિયર્ડ થવામાં એક વીક બાકી તે પેન્ડિગ કામ સાથે લઈને ઉતાવળી ઘેર આવી ગઈ. બારણામાં પગ મૂક્યો, ને ચોકી ગઈ. ડ્રોઝીગરુમ ઝક્કમાળ ! ને આખોય ઠાકર પરિવાર એકસાથે ! મને જોઈને તરત રીમા સામે આવી, એ ‘મમ્મી !’ કહેતી ભેરી પરી, ને પછી ઠાકર સામે જોતાં એણે હસી લીધું : ‘જોયુને પણ્યા ! ...હું શું કે’તી તી !? ...બોલો, મારાં ભૂલકણાં મમ્મીને તો હજુથ...’ પણ હું શું બોલું ? મારા મગજમાં તો દીપાનો ઝોન, અને... મિતેષે મને ચૂપ જોઈને તરત હસતાં હસતાં કીધું : ‘મમ્મા, તમારી ચાલીસમી મેરેજ-અનિવસરી પણ્યાને વાદ છે, ને તું તો યાર !!!’

‘અસા, તો સચાઈજ આપવા તારા પણ્યાજ ને તમે લોકોએ પાર્ટી !’ ...કહેતાં હું ખસિયાણું હસી, ને જઈને સોઝા પર બેસી પડી. પ્રો. ઠાકરે પ્રસન્ન નજરે મારી સામે જોયું, એ ઊભા થઈ ગયા : ‘જુઓ, સાંભળો બધાં, અમારા મેરેજ આડે બે દા’ડા બાકી હતા, ને ભારે ગમત થયેલી.... મનુસમામાએ મને ગંભીર બાનીને પૂછેલું : ‘લ્યા, કન્યાને તે જોઈ છે કે નહીં ?...’ મેં ના પાડી, તો એમણે કીધું : ‘છોકરી છે તો દેખાવડી, પણ જરા બે દાંત થોડા આગળ પડતા...,’ બસ, આ સાંભળતાંની સાથે જ આપણા રામ તો ભડક્યા : ‘ચારે લગનું કરનાં નથી !’ ...ને આટલું બોલીને હાડક મારી આગે સ્થિત હરત્તુ કરતા ટ્ય

ગયા, ને એ સાથે જ ખંડમાં હાસ્યનું મોજું ફરી વણ્યું. ‘પછી શું થયું ?’ મારી કોઈ ધીમેથી હસ્યું, ને એ સાથે જ ઠાકરને બદલે મેં જ કહી નાખ્યું : ‘પછી શું થાય ? બુદ્ધ મનુસમામાએ લગ્નના બીજા જ દા’ડે એમણે કરેલા ટીખળની વાત જી હસતાં...’ આટલું કહેતાં તો મને હાંછ ચઢી ગઈ. મિતેષ તરત ઊભો : ‘ચાલો, હેમા, હિતેશ, રીમા, મોના... જલ્દી, સૌ ટેબલ પાસે આવી જાઓ. ઉંડાના બોંઘાટ શમી ગયો – એકએક. પછી તો તાળીઓના ગડગડાટ સાથે કેક કરાઈ. ગ્રૂપફોટો લેવાયો. ને ખાણીપીણી પત્યા પછી સૌ વીખરાયાં, અમે એકલાં પડતાં કે તરત ઠાકરે પૂછી નાખ્યું : ‘તારી તબિયત તો ?...’ મને થોડી અસ્વસ્થ જોઈને ફરી એમણે ચિંતિત સ્વરે પૂછ્યું : ‘કેમ, કર્દ બોલી નહીં ?...’ મેં ક્ષીણ સ્વરે કહ્યું : ‘ઓહિસાં હમણાં કામનું ભારણ.... તે માંથું થોડુંક ભારેખમ....’ ને આ સાંભળીને તરત ઠાકર બામની શીરીશી લઈ આવ્યા, કપાણે હાથ મૂક્યો, આંખો મારી મીંચાઈ ગઈ. લમણામાં જાણે સેંકડો ટંકણીઓ ભોકાતી હતી, ને વળીવળીને દીપાનો ઝોન, એના શાબ્દોનો ઉજરડો : ‘લી, તું સુખી તો છે ને !...’ આ પ્રશ્ન પાછળ દીપાનો ઈશારો એના સુમનભાઈ !... હા, સાઈઠમા વરસે આજેય એ માણસ અનમોરિડ રહીને યુગાનામાં સોશિયલ-વર્ક કરતો ફરે, તે એમાં હું શું કરું ???’ ‘હવે કેમ છે તને !?’ ...બામ ઘસતાં ઘસતાં બોલાયેલા ઠાકરના શાબ્દો... અને. ‘બસ, હવે રહેવા વ્યો...’ કહીને ઠાકરના હાથને સ્વર્ણવા ઊંચાયેલો સક્રમ હાથ...., અરે ! આ હાથ તો મારો – જાણે લંબાતો... લંબાતો – દૂર...સુદૂર !!’ ને અચાનક જ ઉતાવળે મારાથી ઠાકરનો હાથ પકડાઈ ગયો – ભારે આવેગપૂર્વક !

r

કાલિદાસે મેઘદૂતમાં ઉજૈનનું વર્ણન કરતાં કહ્યું છે કે ધરતી પર આવવાનું થયું ત્યારે સ્વર્ગના નિવાસીઓએ પોતાના બાકી રહેલા પુષ્યના બદલામાં સ્વર્ગનો એક કાન્તિમાન ખંડ માગી લીધો અને તેને ધરતી પર લઈ આવ્યા. તે સ્વર્ગખંડ તે જ ઉજૈન. પણ આ પૃથ્વીમાં આવા કાન્તિમાન સ્વર્ગખંડો બીજે પણ કંપાંક કંપાંક આજે પણ અસ્તિત્વ ધરાવે છે. દસ્તિષા ઓસ્ટ્રેલિયાના છે આવેલું એડીલેડ અને એનો સૌંદર્યમંડિત પરિસર એક આવો જ સ્વર્ગખંડ છે. તેનો સાક્ષાત અનુભવ મને એડીલેડમાં પ્રવેશતા જ થઈ ગયો.

એડીલેડ તેની યુનિવર્સિટી લાયબ્રેરી, ફેસ્ટિવલ આર્ટ સેન્ટર, દેવળો કે સાર્વજનિક ઇમારતો કરતાં વધુ ભવ્યતર તેનાં વન-ઉપવનો, સમુદ્રાભિનાનાઓ, નાદી-સરોવરો અને ટેકરીઓ તથા નયનાભિરામ લેન્ડસ્કેપની સતત બદલાતી જતી દશ્યાવલીઓથી છે. આ શહેર એટલું હરિયાણું છે કે તેને હરિયાણી નગરી કહેવાને બદલે હરિયાણીમાં ઊગેલું નગર અને કહેવું વધુ ઉચિત રહેશે. અહીં આવેલાં રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પચાસેક જેટલી બુશ ડ્રેટિલ આવેલી છે. બુશ ડ્રેટિલ એટલે ગાઢ જંગલોમાં જનવિહોણી, સાંકડી કેડી પર ચાલવું – જે ઘણી વખત તો એટલી આકર્ષણ ચાંગલાવાણી હોય છે કે જરા જેટલો પગ ફસક્રો તો નીચે ખીણમાં જ ગબડી જવાય. અનેક સાહસો અને રોમાંચોથી ભરપૂર આ ડ્રેટિલ અનેક વિહેંગમ દશ્યોનો ચિરપત રજૂ કરે છે. આ વેઘૂર વૃક્ષોની શ્યામલ હરિતિમા આપણને સ્થૂળ ચેતનમાંથી ઊંચકીને સૂક્ષ્મ અને મૂળ ચૈતન્ય સુધી પહોંચાડવામાં ઉદ્દીપકની ગરજ સારે છે. જંગલમાંથી વહી આવતો પવન મનુષ્ણની આદિમત્તા અને નિર્દોષતાનો પડધો પાડે છે. અને એટલે જ મારી આંખોની બાસ્કેટમાં સાચવી રાખેલા સમુદ્રનાં શાંત, નીલાં-ભૂરાં જળ, પેલિકનની ચાંચ જેવા ગુલાબી આકાશ કે દિવ્ય પતાકા ફુલાવતી એડીલેડની ટેકરીઓ અને મનોહર લેન્ડસ્કેપના રંગબેરણી ફુંગાઓમાંથી એક ફુંગો આજે ફરીને એ હવાથી ફુલાવી, ઉડાવી રહી છું.

તે દિવસે વીકેન્ડની રજા હોવાથી અમે બધા માઉન્ટ લોફ્ટીની બોટાનિક ગાર્ડન જવાનો પ્રોગ્રામ નક્કી કર્યો હતો. પરંતુ પાર્કિંગ ન મળતાં અમે પહોંચો ગયા માઉન્ટ લોફ્ટી સમીક્ષા પર. તે દરિયાઈ સપાટીથી ૭૧૦ મીટર ઊંચે આવેલું છે. અહીંથી ફ્લીડર્સ રેન્ઝસ, એડીલેડની નયનરમ્ય ખીણો અને દરિયાભિનાનારોઓનો સમગ્ર પરિસર નિહાળી શકાય છે. પણ તેને માશવાની ખરી મજા તો સૂર્યાસ્તની સાક્ષીએ છે. જ્યારે અમે તો પહોંચ્યા હતા મધ્યાહ્ન. એટલે મારા બનેવીએ કહ્યું, “ચાલો Water gully fall (જલપ્રપાત)ના દર્શને જઈ આવીએ.” પણ વળી પાછો પ્રશ્ન થયો કારણ કે આ ધોધનાં દર્શન કરવા ૪.૮ કિ.મી.ની બુશવોક કરવી પડે તેમ હતું. છેવટે નક્કી થયું કે પ્રીતિ (મારી નાની બહેન), નીલ (નાનો ભાણેજ) અને પૂર્ણ આનંદી બા (સાસુમા) સમીક્ષા પર બેસે. આ નિર્ણય કરી, પેટમાં થોડું પેટ્રોલ પુરાવી પાર્થ (મોટો ભાણેજ), રાજેશકુમાર અને મેં ચાલવા માંડયું.

## જોવીંતી કોતરો ને જોવીંતી કંદર ભોમિયા વિના મારે ભમવાત્તા કુંગરા.

વેઘૂર વૃક્ષોને કારણે સવાર, બપોર કે સાંજના બેદ જ ટળી જતા હતા. તેનું આ નીલ સૌંદર્ય આંખોમાં આંજણે અમે તો ચાલ્યાં જતાં હતાં. પણ ત્યાં કેટલાક છોડ તેની હરિત દીવિઓથી અમારું સ્વાગત કરવા લાગ્યા. અમે તે જીલીને જરા આગળ ગયા તો જુગલી ફૂલોએ તેની મોહકતાથી અમારું ધ્યાન બેંચ્યું. પ્રકૃતિ મોહિની બનીને અમને મોહ પમાડી રહી હતી. અવનવા વૈચિચ્ય સર્જતું આ નિભિડ વન રોબર્ટ ફોસ્ટની યાદ અપાવતું હતું.

**“The woods are lovely dark and deep**

**Out I have promises to keep**

**And miles to go before I go to sleep.”**

પણ અમારે થોભવું પડે તેમ હતું. ત્રિભેટે આવને ઊભી રહી હતી. અમારી ત્રિપુઠી. કારણ કે આડેઅવળે રસ્તે ફૂટાઈ ગયા તો કોને ખબર કયાં જઈ ચડાય કે પછી કશે પહોંચાય પણ નહીં. રામ રામ ! ગોરી પ્રજાને પૂછવું કે કેમ ? અને પૂછીશું તો પ્રત્યુત્તર સાચો મળશે કે ખોટો ? સંદેહ અને આશંકા અમને ઘરી વળે તે પહેલાં જ સદ્ધભાગ્યે એક ભારતીય યુગલ દેખાયું. હાશ થઈ. તેમણે ચીંધીની કેડી પર ફરી બુશવોક કરવા લાગ્યા. વળી બધી જ ચિંતા અને ડરને ફગાવી દઈને આસપાસની પ્રકૃતિને માણસવા લાગ્યા. તરુવરો જ બસ તરુવરો. પ્રત્યેક વૃક્ષમાં વહેતી ઊજાનો અવિરામ પ્રવાહ જ તેની આ તાજગી અને લીલપનું રહસ્ય છે, તેવું તેણે અમને તેના બાહુઓ પ્રસારતાં કહી દીધું. અમે અમારી નયનકટોરીમાં તેના આ અદ્દાટ, અનાગસ અને અનાવિલ સૌંદર્યને ભરવાની મથામણ કરતા હતા. પણ એ બધાં ટુમો તો અનંતલીલાઓ સર્જી રહ્યાં હતાં. તેની જાળીઓ પર બેટલાં પક્ષીઓ ગીતો ગાઈને પોતાનું અસ્તિત્વ પ્રગટ કરવા લાગ્યાં. પંખીઓને સાંભળીને ફૂલો પર અસ્તિત્વનો ઉજાસ રેલાવા લાગ્યો અસ્તિત્વના આ ઉજાસમાં સંઘાં દ્રન્દો શમી ગયા. કારણ કે ફૂલોની પાંખીઓમાં રહેલું એકાંત અકબંધ હતું અને પંખીઓના ટહ્કામાં નીરવ પળો સચવાઈને પડી હતી. અરે, આકાશ પણ ઉત્સુક વૃક્ષોની વચ્ચેથી વિવિધ આકારોની રમણા અને ભમણા સર્જતું હતું. આ બધાં પરથી વહી આવતો પવન અમારા માટે આનંદકંદ બની રહ્યો હતો. દિક્કુંઘ થઈ ગયેલા એવા અમને ત્યારે તો કલ્યાણ પણ નહીંતી કે આ કોમલ કેટલું કરાલ બની શકે છે ! હોઈ શકે છે ! આ રૂપકિત દશ્યો કેટલાં છન્દવેશી છે ! એ તો પછીથી ખબર પડી. પણ જો પ્રથમથી ખબર હોત તો પ્રકૃતિના આ વિરોધાભાસીપણાંની કે તેની વિલક્ષણતાની અનુભૂતિ પણ ચૂકી જાતને ! તે જ તો શીખવે છે, બે તદ્દન વિરોધી તત્ત્વોનો પણ પરસ્પર સુભેળ સાધવાનું.

જોકે ફરીને ફુંગો ફુલાવવાનું મારું આ શિશુસહજ કર્મ સાવ અકારણ નથી. કારણ માત્ર એ વેઘૂર વૃક્ષો જ નથી, કારણ એ પંખીઓનો કલરવ જ નથી, કારણ એ ગમતીલો વાયરો જ નથી. કારણ ઘણું જ અદ્કેરું છે. ઊંઘું... એમ નહીં કહું. મને પેલા પેલા ધોધ પણે પહોંચી જવા દો.

કાળા-કથ્થઈ વાળની જટાઓ મધ્યે શેતકેશની લટ જેવો એ ધોધ પ્રથમ દસ્તિએ

ડારેટિંગ કરતો હોય એમ જણાયો. પરંતુ તેનું નીચે વહેતા વારિમાં થતું સર્મર્પણ જોઈ તેનો આ તનુશી અભિલં મધુરની યાદ ઝડૂત કરાવી ગઈ. તેની આ તનુતા જ તેના સૌંદર્યનો પર્યાય બની જતી હતી. જે નજાકતથી તેની ધારા ખડકો પરથી અવરોહણ કરી રહી હતી તે ન અલસ હતી. ન તોખારરૂપ હતી. માધ્યમ - માધ્યમ તેની આ ગતિ ઘાયલ કરી દે તેવી હતી. જેનો વાદી સ્વર મધ્યમ છે અને સાતેય સૂરોને સમાવીને બેઠેલો સંપૂર્ણ રાગ યમન, મોઝાટીની કોઈ સિમ્ફની સાથે અનુબંધ રચીને રેલાઈ રહ્યો હતો. મસ્તક નત થઈ ગયું, ચિત્ત સંતર્પક થઈ ગયું અને આત્મા સર્મિત થઈ ગયો.

તેની આ સૂરાવલિઓ સાંભળીને પેલાં ખળખળ સલિલ જળહળ થઈ રહ્યાં હતાં. ટ્રાર ઉલ્લેખા ખડકો પણ મંદ મંદ તોલી રચ્યા હતા. આકાશ પણ અંધુલીને ધોધની સાથે એકરૂપ થઈ ગયું હોય તેમ ન શેત હતું, ન નીલ. ન કોઈ અલગ રંગ, ન કોઈ અલગ રૂપ. તેથી જ તો જલપ્રાતાના પ્રત્યેક બુંદની સાથે તે પણ પછાતું હતું. જણાની સાધના પૃથ્વી કરતંય વધુ ગહન અને ગંભીર છે. તેથી જ તેની સુરેખતામાં કંઈકેટલીય ભંગિમાઓ ધરીને ઉભાં હતાં જળબિંદુઓ. ખડકોની સાથે ઘસ્તાંત્ર તે છોલાતાં હશે? પણ, તેઓ તો ગમતીલા પીડાનાં ફૂલો સમ મધ્યમઘટાં હતાં! એટલે જ તો આટલું લાલિત્ય હતું. જળ, ખડકો, વૃક્ષો, આકાશ, વાયુ અને તેજાનાં દ્વયોથી રચ્યાતો તેનો તનુપિંડ સાચે જ અલોકિક હતો. કેમ ન હોય? આકાશનું ગોપૂર હતું. શૂન્યતાના સંભાળ હતા. નિઃસ્તબ્ધ પ્રકૃતિનો ધ્યારચ હતો. રમણીયતાનું તીર્થ હતો (છે અને રહેશે.)

ધન્ય બની ગયેલી એવી મને એ પણ સૂર્યાં નહીં કે આ સૌંદર્યને કચકડે મઢી લઉં. એ તો પાર્થ અને બનેવીના કહેવાથી બે-ત્રણ ઝીટા પાડ્યા અને પડાવ્યા. બાકી આ જલશી તસવીરોમાં ક્યાં સમાય એમ હતી?

હું તો પાછા ફરવાનું પણ ભૂલી ગઈ હતી અને તે ય ઉપર ચઢીને, કારણ હવે તો મા. લોફટી સમીટ જવાનું હતું ને! કેટલું આકું ચાદરાણ ફરી પાછું ૪.૮ કિ.મી. - મને-કમને પાછા ફરવા માટે ચરણોને કહું ચાલો. થોડું ચાલ્યા ત્યાં તો ચરણો તો ચાલવાની ધૂનમાં હતાં પણ હંદયની ધૂન ધીરે ધીરે બજતી બજતી પછી તો હંદસ્તી હંદસ્તી ફાટવા લાગી. મંદમાંથી મધ્યમ અને પછી તાર- સપ્તકની યે બહાર જવા લાગી. બુશની એ કેડી પર ફસડાઈ જવાયું. બરાબર તે જ કણો ગોરું યુગલ આવીને ઉભાં રહી ગયું. જાણ કો' જન્મના મિત્રો આવીને ઉભાં રહી ગયા. હળવે રહીને તેમના ઓસ્ટ્રેલિયન ઇન્લિશમાં પૃથ્વા કરી. એમના કહેવાથી નીચે ઉત્તર્ય. તેમની સાથે મારો હાથ ગ્રહી ડિશોક (રેસ્ટોરન્ટ) પર લઈ ગયા. મારો ખભો થપથપાવી મને બેસાડી.

મારા માટે પાણીની બોટલ ખરીદીને લઈ આવ્યા. જાણે ભૂલા પડેલા રણમાં કોઈએ પાણીની બંખલી આપી. ના, આ મૃગજણ નહોતું. આ તો મૈત્રીજળ હતું. સામે ધોધ અને બાજુમાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહી રહ્યું હતું. હું કોને જોઉં? કોને નીરખું? કોને પરસું?

તેઓની વાતચીત પરથી જાણવા મળ્યું કે તેઓ વિયેટનામથી માઈગ્રેટ થયેલા વસાહતીના પરિવારમાંથી આવતા હતા. વિયેટનામનું એ યુદ્ધ, તેની ભીષણતા અને વેદનાપૂર્ણ સંઘર્ષોએ તેમનામાં જન્માવેલી મનુષ્યજાત પ્રત્યેની સંવેદનશીલતા પેલા ધોધની માફક અસ્થાલિત વહેતી હતી. વચ્ચે વચ્ચે 'હાવ આર યુ હિલિંગ, ઈજ ઈટ ઓ. કે.?' હવે કેમ

વાગે છે, બધું બરાબર છે ને - પૃથ્વા થતી જાય અને વાતોનો દોર ચાલુ થતો જાય. આ દોર અંતે શિક્ષણમાં જઈને પરોવાયો. મિસિસ પીટર શિક્ષણજગત સાથે સંકળાયેલા છે. સાચો શિક્ષક જગતના કોઈ પણ ખૂજે હોય, કોઈ પણ દેશ, પ્રાંત, કોમ કે ભાષાનો હોય, તે મનુષ્યને સંવેદનાનું અધ્યયન-અધ્યાપન કરતો-કરાવતો રહે છે. તે બૌદ્ધિક આંક કરતાં ઊર્મિઅંકનો ગ્રાફ વધારે ઉંચે રાખતો હોય છે. જ્ઞાનના પર્વત પરથી નિરપેક્ષ પ્રેમ અને મૈત્રીને કાજ કેવો નીચે ઉત્તરી પેલા જલપ્રાતાની માફક મૃદુ અને સંગીતમય બની જતો હોય છે.

રહો, રહો હજુ હું ક્યાં મારા તેસ્ટિનેશન - નિયત મુકામ એવા મા. લોફટી સમીટ પર પહોંચી છું. મારા આ પરબરવના / ના. શાચત (સાચી મૈત્રી શાચત હોય છે) મિત્રો વિના હું ત્યાં પહોંચી જ કઈ રીતે શરૂ? અરે, હા એક વાત કહેવાની રહી ગઈ કે મારા બનેવી કાર વેવા માટે મા. લોફટી જવા નીકળ્યા હતા. આ અડવા કલાક દરખાન મિ. પીટર અને રાજેશકુમાર વચ્ચે સતત વાર્તાલાપ થયા કરતો હતો. તેથી અમને જાણવા મળ્યું કે બનેવીલાને માર્ગ જડતો ન હતો. એટલે પીટરદંપતી જાણે સારથિ બનીને તેમની કારમાં અમને મા. લોફટી સમીટ પહોંચાડી ગયું.

નીચે ઉત્તરી મેં તેમનો આભાર માન્યો તો તેઓ એટલા ખુશ થયા અને 'નો મેન્શન' કે 'વેલ્કમ'ની ઔપચારિકતાને બદલે હુંસાણું આવિંગન આખ્યું.

ખરે જ આ બુશવોક ન કર્યું હોત, જંગલની કેવીઓમાં ફસડાઈ પડી ન હોત તો આ મૈત્રીભાવને પામી શકી હોત ખરી? રાજા રહુગણને જડભરતે ઉપદેશ આપ્યો હતો ... 'આર જંગલ જેવો છે' - આમ કહી આ સૃષ્ટિને ભવાટવિની ઉપમા આપી હતી. ગવત - જડભરત આખ્યાન) પરંતુ અરણ્યોની ભીષણતાથી ગભરવાને બદલે જવામાં આવે તો તે રોમહર્ષણ બની રહે છે. મનુષ્ય માત્ર પ્રત્યેનો મૈત્રીભાવ કૃત છે. આ આત્માનું સખ્ય જ પેલા સમીટ પર, શિખર પર પહોંચાડે છે.

## કવિતા

(૬) સરદારનું ગીત : 'સાગર' રામોદિયા, ૨૦૦૬, 'સાગર' રામોદિયા, ૩/૮/૨૦૮૫, રણજિતનગર, જામનગર, પૂ. ઉર, રૂ. Nil (૭) ક્યાં સુધી હવે? : ડૉ. નંદુભાઈ પંડ્યા, ૨૦૦૮, મનીષ પંડ્યા, 'જીવનસંગીત', સી-૧૬ ૨૭, કાળવીબીડ, ભાવનગર, ૧૨+૧૧૬, રૂ. ૮૦/- (૮) લખલૂટ લીલાશ : ડૉ. નંદુભાઈ પંડ્યા, ૨૦૦૮, મનીષ પંડ્યા, ઉપર મુજબ, પૂ. ૨૦+૧૦૮, રૂ. ૮૦/- (૯) વડલો હીચકે ઝૂલો : મુકેશ પુરોહિત, ૨૦૦૮, મીના પુરોહિત, રાજકોટ, ૧૬+૮૮, રૂ. ૭૦/- (૧૦) સુવાર્તિક ગીતમાળા : ડૉ. બેન્નામિન સુવાર્તિક, ૨૦૦૭, રેવ સેમ્બુલ એલ સુવાર્તિક, સુવાર્તિક, પ્રકાશન, વડોદરા, ૧૪+૧૪૬, રૂ. ૩૦/-

## દશ્ય ૧

નાન્દી

મંગલાચયરણ

સૂર્યધાર : સજાનો અને સનારીઓ ! નાટકની નિર્વિદ્ધ પ્રસ્તુતિ માટે, નટચમુ સાથે અમે પણ ગૌરીસુત ગણપતિને પ્રશ્નાભીએ છીએ -

દૂદ, સૂંઘથી સદાય શોભે - ગૌરીપુત્ર ગણોશ;  
આબ્યા વિદ્ધ તરત હરે છે હરહર સુત વિદ્ધનેશ.

નાટક દેવભાષામાં ન હોઈ સ્તુતિ અક્ષરમેળ વૃત્તાને બદલે માત્રામેળ વૃત્તમાં કરી છે, તો, ક્ષમ્ય લેખશો -  
અને હવે પ્રસ્તુત કરીએ છીએ - સરસવતી સ્તુતિ.

શેત વસ્ત્રમાં સદા શોભતી, વાહન રાજે હંસ  
તેજ ભરેલા શબ્દોથી કરે તિમિરનો ધંસ

તો, સકળ લોકને વંદીને વાત માંનીએ છીએ - પાંડુપુત્ર યુધિષ્ઠિરની.  
કુરુક્ષેત્રના યુદ્ધનાં છિન્નીસ છિન્નીસ વર્ષ વીતી ગયાં છે અને છતાં...  
ના, ના - પણ, આ કથા ઓછી કહેવા અમે આબ્યા છીએ ?

તમે કાંઈ સંભળ્યુ ? તમે પૃથ્વી અને પાતળ લોકથી અભિન્ન એવી સુંગધ અનુભવી ?  
અસરાઓ ઝાંઝર ઝાંઝર હોય - કિન્નરો ને ગાંધર્વો ગાય - વગાડે છે

અને શિવિપતિ ઠન્ડ સુધર્મા સભામાં - નૂત્ય - ગીત - સંગીતમાં લીન છે -

## કથાગાન

ગાંઝર જાણકે, કક્ષા રણકે મૃદુગં પર છે થાપ;  
ગાંધર્વનાં ગાન ચાલતાં ત્રિવિધ ટળતાં તાપ.

(પ્રતિહારી પ્રવેશો છે.)

પ્રતિહારી : મહારાજ ઈન્દ્રનો જય હો.

ઈન્દ્ર : શું છે, પ્રતિહારી ?

પ્રતિહારી : મહારાજ, આપની સુધર્મા સભામાં નિત્યની જેમ ચિત્રગુપ્ત અને યમરાજ પ્રવેશ માટે અનુમતિ માંગે છે.

ઈન્દ્ર : (અદશ્ય એવા ગાંધર્વો અને અસરાઓને) પ્રસ્તાવ.

ઈન્દ્રાશીલનો

અવાજ : અમારી ઉપસ્થિતિ રાજધર્મ માટે વિદ્ધકર્તા તો નહીં બને ને, સ્વામી ?

ઈન્દ્ર : હવે અમે સ્વર્ગલોકના સ્વામી. માટે દેવી, પ્રસ્તાવ. (ઈન્દ્રાશીલ પણ પ્રસ્તાવ કરે છે એટલે પ્રતિહારીને)  
જાવ અને ઝર ચિત્રગુપ્ત અને યમરાજને આદર સાથે લઈ આવો. (પ્રતિહારી જાય છે એ દરમિયાન) ભલે કહેવાય સ્વર્ગના શાસન; પણ, શાસન માત્ર મનોના ગ્રહનો આગ્રહ સેવે.

(ચિત્રગુપ્ત અને યમરાજ પ્રવેશો છે.)

બેય : મહારાજ ઈન્દ્રનો જય હો.

ઈન્દ્ર : (યમરાજને) પૃથ્વીલોકનાં શાં વૃત્તાંત છે, યમરાજ ?

યમરાજ : આપની આજ્ઞાથી કાલગ્રસ્તોને અમે સુખદુઃખથી પર કરીએ છીએ, મહારાજ.

ઈન્દ્ર : (હસ્સીને) પણ સુખદુઃખથી પર કોને થવાનું છે, કોને દેહમુક્ત થવાનું છે, એ તો ચિત્રગુપ્તનો ચોપડો નક્કી કરે ને ?

ચિત્રગુપ્ત : ચાલી આવતી પરંપરાથી, દેવાધિદેવ, અમે તો પરંપરાવશ ચાલીએ છીએ અને ધર્મનું પાલન કરીએ છીએ.

ઈન્દ્ર : તો આજે કોઈ બાબતે દ્વિધા પ્રવર્તે છે, ચિત્રગુપ્ત ?

ચિત્રગુપ્ત : મહારાજ, પાંડુપુત્રો અને દૂપતનયાનું આયુષ્ય હવે પૂર્ણ થાય છે.

ઈન્દ્ર : એમ છે તો યમરાજને આદેશ આપો કે સૌને દેહમુક્ત કરે.

યમરાજ : પણ મહારાજ, જ્યેષ પાંડુપુત્ર...

ઈન્દ્ર : (હસ્સીને) અર્થાત્ આપના વરદાનથી નિપજેલા યુધિષ્ઠિર ?

ચિત્રગુપ્ત : એમને દેહમુક્ત કરવાનો આપણો અધિકાર નથી.

ઈન્દ્ર : અર્થાત્ ?

ચિત્રગુપ્ત : અમારો ચોપડો એમ કહે છે કે, જ્યેષ પાંડુપુત્રને સંદેહ સ્વર્ગ મળશે, પ્રભુ.

ઈન્દ્ર : અહો ! એથી વિશેષ આનંદપદ શું હોઈ શકે ?

(યમરાજને) આપના વરદાનથી નિપજેલા આપના પુત્ર ધર્મરાજને સાદર સંદેહ સ્વર્ગ લઈ આવો, સ્વર્ગનું વિમાન લઈને જજો.

યમરાજ : પણ, પણ...

ઈન્દ્ર : પણ, શું ?

પ્રતિહારી : નિદેવ પ્રવેશની સંમતિ ઈચ્છે છે, મહારાજ.

ઈન્દ્ર : નિદેવ ?

પ્રતિહારી : વાયુ, અજિન અને સૂર્ય.

ઈન્દ્ર : પ્રતિહારી કહો, એમને કહો, કે પૃથ્વીલોકનો કાર્યારંભ થયો છે; એ પૂર્ણ થશે એટલે મિત્રો સાથે ગોચિ કરીશું. (ત્રણેય દેવ સાથે આવીને)

અજિન : ક્ષમા, દેવાધિદેવ.

વાયુ : અમે આપની સંમતિ વિના પ્રવેશયા છીએ.

સૂર્ય : આમ કરવું અનિવાર્ય હતું, મહારાજ.

ઈન્દ્ર : આબ્યા જ છો, તો પદારો. જોકે આપે પ્રવેશ માટે આજા લેવાની ન હોય.

વાયુ : જી, પણ....

ઇન્દ્ર : ચિત્રગુપ્ત, આપ પ્રસ્થાન કરો. અમે પછી આપને....

અજિન : અમે યુધિષ્ઠિર સંદર્ભે જ આપની સાથે વિચારવિમર્શ માટે ઉપસ્થિત થયા છીએ, મહારાજ.

ઇન્દ્ર : અર્થાત્?

સૂર્ય : અમને જ્યેષ્ઠ પાંડુપુત્રનો સદેહ સ્વર્ગપ્રવેશ અયોગ્ય લાગે છે.

ઇન્દ્ર : હે ? આ અમે શું સાંભળી રહ્યા છીએ ?

નારદ : (પ્રવેશને) નારાયણ, નારાયણ.

ઇન્દ્ર : પધારો, દેવર્ષિ.

નારદ : કટ્યાશમસ્તુ, પણ દેવાધિદેવ આપના એકચકી શાસન સામેનો આ વિષલવ તો નથી ને ?

ઇન્દ્ર : અમે મૂળીએ ગયા છીએ. આપ અમારી મૂળવશની ક્ષણે પધાર્યા અને પધારીને આપે અનુગ્રહ દાખલ્યો એથી આભારી છીએ.

નારદ : અમારું તો કર્ત્વ છે. સંઘર્ષની ક્ષણનો પ્રારંભ અને અમે ઉપસ્થિત. નારાયણ, નારાયણ.

ત્રિદેવ : દેવર્ષિ, પ્રશ્નામ.

નારદ : આયુષ્માન ભવ : - પણ અમને એ નથી સમજાતું કે યમપુત્ર સ્વયંનાં કર્ત્વોથી ધર્મરાજ કહેવાયા છે, એવા યુધિષ્ઠિરને સદેહ સ્વર્ગ મળે એમાં અચરજ શાનું છે ?

વાયુ : જાહીએ છીએ પ્રભુ, આમ છતાં....

નારદ : આપ ત્રણેય દેવના ચિત્તમાં સંશય છે ? (ત્રિદેવ ડોકું ધુણાવી હા પાડે છે)

નારદ : સંશયાત્મા વિનશ્યતિ, માટે કરી, સંશય મુક્ત થાવ. અને જો દેવાધિદેવ આજ્ઞા આપે તો, પૃથ્વીલોક ઉપર જઈ યુધિષ્ઠિરને મળી, એની સાથે સંવાદ કરો અને આપના સંશય કહો, શું કહો છો ? દેવાધિદેવ ?

ઇન્દ્ર : કોઈ પણ સમસ્યાનો સંદેહ એ આપની પ્રત્યુત્પન્નમતિને આભારી છે, દેવર્ષિ.

નારદ : આ મતિ પણ દેવોની જ કૃપા છે. તો ત્રિદેવ પૃથ્વીલોક ઉપર તત્કષણ પ્રસ્થાન કરે તેવી આજ્ઞા કરો, કારણ પાંડુપુત્રોનો અંતકાળ આવે એ પહેલાં ત્રણેય દેવને સંશયમુક્ત થતું અનિવાર્ય છે.

(કથાગાન)

કોઈ નથી અપવાદ નિયમમાં

કોઈ નથી અપવાદ,

યમના ચુસ્તચુસ્ત નિયમમાં

કોઈ નથી અપવાદ,

નિયમમાં કોઈ નથી અપવાદ.

(અંધકાર)

## દશબ્દ-૨

સૂત્રધાર : કુરુક્ષેત્ર યુદ્ધ પૂરું થયે છત્ત્રીસ વર્ષ થયાં છે. છેલ્લાં છત્ત્રીસ-છત્ત્રીસ વર્ષથી જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિર રાજસિંહાસને બિરાજે છે.

બિરાજે છે સિંહાસને

અને પોઢે છે પુષ્પશૈયામાં

સુખનાં જ ઓદ્ધણ છે ને સુખનાં જ પોઢણ છે,

પણ અદ્ભર દિવસના યુદ્ધને અંતે પ્રાપ્ત થયેલ જ્ય, ધર્મરાજ યુધિષ્ઠિરને

સામ્રાજ્ય આપી શકે છે, શાંતિ નહિ. એ છેલ્લાં છત્ત્રીસ-છત્ત્રીસ વર્ષથી

કાયાને શૈયામાં લંબાવે છે, પણ એમનાં નેત્રોને નિદાનો સુખદ્વારી રૂપર્થી

મળતો નથી. એ અનિદ્ર નયનોએ જગ્યા કરે છે. આજે પણ એ શૈયામાં

પોઢેલા છે, પણ નિદાનાં નથી અને એવામાં જ, અને એવામાં જ અને

એવામાં જ... એ જુઓ છે : સ્વખન -

(કથાગાન)

ત્રમ ત્રમ કરતાં અંધારાથી રાત ભ્યાનક ભાસે,

બારી, બારણાં, ભર્તી ઉપરથી શૂન્ય છલકતું ભાસે

રાત ભ્યાનક ભાસે.

તારાઝોનાં ટોળાં સાથે ચંદ્ર ત્યજ્ઞે નભને

કયાં સંતાયો, કયાં સંતાયો, કોઈ કહેને અમનો...?

સૂસવાતા વાયુ ને તશ્ખા, સૂર્ય દીસે આકાશે

રાતે સૂર્ય ભ્યાનક ભાસે.

સૂત્રધાર : (નભમંડપથી અવાજ આવે) જાગ, યુધિષ્ઠિર જાગ.

(આકાશભાષિત) જાગ, જ્યેષ્ઠ પાંડુ, જાગ.

યુધિષ્ઠિર : (શૈયામાંથી બેઠા થઈને) કોણ ?

ત્રિદેવ : એ તો અમે.

યુધિષ્ઠિર : અર્થાત્?

સૂર્ય : શત સહસ્ર કિરણોનો સ્વામી.

યુધિષ્ઠિર : સદાય સાત અશ્વ જોડેલા રથ પર આરુદ થઈને પ્રભાતે આવો, આજે મધ્યરાતે ? પ્રભુ સવિતાનારાયણ, આપ મધ્યરાત્રિએ ?

સૂર્ય : અમારી ગતિ તં અવળી કરી, યુધિષ્ઠિર.

યુધિષ્ઠિર : કશ્મા. પણ, એવું તે શું થયું કે આપે પૃથ્વી ઉપર મધ્યરાત્રિએ આ ખંડમાં આવવું પડ્યું ?

સૂર્ય : સંશય, પુત્ર, સંશય. અમારા પુત્ર કર્ણને આયુધ રહિત અવસ્થામાં રથચક્રને

ભૌયમાંથી બહાર કાઢતી વખતે અર્જુને હજ્યો અને તું મુંગો રહ્યો ? તું તો સત્યાશ્રાયી, સત્યાગ્રહી. એકાધિક જયને પરહરીને તું સત્ય પક્ષે રહે, તું ધર્મ પક્ષે રહે, તું કેમ આવી ક્ષણે અધર્મ ભર્યી ગયો ? તું ધર્મરાજ નથી. તારું સૂત્ર

તો એ હોય કે, ‘મારા જેવા અનેકોનો ક્ષય થાવ, પણ સત્યનો જ્ય થાવ.’ અમે ક્યારેય તને ક્ષમા ન આપી શકીએ. અમે ક્યારેય તને સદેહ સ્વર્ગનો અવિકારી ન લેખી શકીએ, ક્યારેય નહીં.

(ક્ષણાર્થમાં પ્રસ્થાન કરે છે, અલોપ થાય છે.)

યુવિષ્ટિર : પણ, આપ મને સાંભળો તો ખરાં. સવિતાનારાયણ, મને સાંભળો. હું જીએજ પાંડુપુત્ર આપને વિનંતી કરું છું, થોભી જાવ. ગયા, મને સાંભળ્યા વિના ગયા. હું, દુર્દૈવ કોને કહે છે ?

વાયુ : સાંભળ, જીએજ પુત્ર સાંભળ.

યુવિષ્ટિર : કોણ ?

વાયુ : જેણે આ જન્મ, પલાંડી વાળી નથી, જે ક્યારેય થંભ્યો નથી, અને જે મનોવેગી છે તે અમે.

યુવિષ્ટિર : વાયુદેવ પ્રશ્નામ. આપ તો અમારા બલાઘ્યના જનક છો. હું સદેહ સ્વર્ગ આવું એમાં આપનો તો વિરોધ જ ન હોય ને ?

વાયુ : છત્રીસ વર્ષથી વત્સ; તું શાસન કરી રહ્યો છે તે દેખાઈ આવે છે. આ રાજકૌશલ તારામાં પૂર્વે નહોતું.

યુવિષ્ટિર : આપ મને અભિનંદન આપી રહ્યા છો કે કટાક્ષ કરી રહ્યા છો ?

વાયુ : હે પાંડુપુત્ર ! તમે ચારેય પાંડુપુત્રોએ, દેહે સશક્ત પણ ભોટપણાંની સીમા સુધી જતાં ભોળપણના ભંડાર બલાઘ્યને, ભીમને તમે સૌએ સોગઈ જ લેખ્યો છે. એ જીવંત પર્વત તમારું ચલવ્યું ચાલ્યો છે, તમારું થંભાબ્યો થંભ્યો છે. તમારી જ ઉશ્કેરણીથી કંઈ કેટલાય નિયમ એણે તોડ્યા છે. એનું દુપદતનયાને સતત ચાહવું અને મા કુંતા તરફ તથા તારા ભાણી, યુવિષ્ટિર, તારા ભાણી સેન્ધાધીન થવું કેવું નીવજણું છે ? વ્યવહારમાં ભૂંડો કેવળ ભીમ જ થયો છે, મારો પુત્ર, ભીમ. તમને સૌને એણે ચાલ્યાં છે, પણ તમે કોઈએ અને ક્યારેય ચાલ્યો નથી. જ્યારે જ્યારે તાત્ત્વિક કટોકટીમાં તમે મુકાયાં ત્યારે ત્યારે તમારું કિયાપદ વૃક્ષોદર જ બન્યો છે, મારો વૃક્ષોદર. (અટકીનો) યુવિષ્ટિર, સદેહ સ્વર્ગ તું આવે અને ભીમને સદેહ સ્વર્ગ નહીં ? એ હું સાંખી શકતો નથી. હોઠ સાજા હોય તો ઉત્તર આજા હોય એની મને જાણ છે માટે અલભુ. અમે પ્રસ્થાન કરીએ છીએ.

યુવિષ્ટિર : પણ મને....

વાયુ : અલભુ, શાંતમું પાપમું, (પ્રસ્થાન).

યુવિષ્ટિર : તમે પણ મને નહીં સાંભળો ? તમે તો મારા પ્રિય બલાઘ્યના પિતા. તમે પણ મને અન્યાય કરશો ?

(અભિનદેવનો ખડખડાટ હસવાનો અવાજ)

યુવિષ્ટિર : આ કોણ અહૃદાસ્ય કરી રહ્યું છે ? કોણ અહૃદાસ્યથી કટાક્ષ કરીને અમને કુટિલ ટેરવી રહ્યું છે ? કોણ છે એ ? કોણ છે આપ ? અમને દર્શનનો લાભ કેમ નથી આપતા ? કોણ છે ?

અભિન : અસત્યોને બાળી ભર્સ કરતો હું...

યુવિષ્ટિર : પવિત્ર અભિનદેવ ? પ્રશ્નામ.

અભિન : હું તને કદાચ ઉદ્દ લાગીશ, પણ આપું બ્રહ્માંડ જાણે છે કે હું આકરો હું અને એટલો નિર્દ્દ હું. તું મને પ્રશ્નામ કહીશ તો પણ હું તારું કલ્યાણ નહીં વાંચ્યી શકું, વત્સ.

યુવિષ્ટિર : આપનો કોધ ક્યારેય અસ્વાભાવિક લેખાયો નથી, પ્રભો.

અભિન : દંભીઓને કોધ નથી હોતો. જે હૈયે પવિત્ર છે, એ તપે છે.

યુવિષ્ટિર : આ હું કયાં નથી જાણતો ? પણ મેં આપનો કયો એવો અપરાધ કર્યો કે આપ મારા પર કોવિત છે ?

અભિન : સ્મરણ છે, યુવિષ્ટિર તને સ્મરણ છે ?

યુવિષ્ટિર : શેનું ?

અભિન : દુપદે કામેણિ યજ્ઞ કર્યો હતો. અને એ વેરની જવાળાઓમાંથી જન્મી હતી મારી પુત્રી યાશસેની – દ્રૌપદી.

યુવિષ્ટિર : જાણું હું ને. અને એની જવાળાઓમાંથી અમે અસ્પૃશ્ય રહ્યાં નથી. જો આપની પુત્રીના આહુમના કારણે અમે પાંડવોએ શું ગુમાવ્યું છે, એની આપને શું જાણ જ નથી ? અમે છત્ર જેવા ભીષપિતામહ ગુમાવ્યા, ગુરુ દ્રોષ ખોયા, અમારા સો-સો પિતરાઈ ભાઈઓ ગુમાવ્યા. આ બધું કોના કારણે ? અભિનદેવ, દુઃશાસનની છાતીમાંથી ખોજે-ખોજે લોહી બલાઘ્યે કેમ પીધું ? કોને માટે ? કોને કારણે એણે ...એણે ગદાયુદ્ધના નિયમો વિરુદ્ધ જઈ ઉરુભંગ કર્યો ? કોને કારણે ?

અભિન : વસ્તુ સમજને તમે મારી દીકરીને વેણી છે. એને ધૂતના દાવમાં તમે મૂકી છે. મારી દીકરીની અવમાનના કરનાર તને, તને હું સદેહ સ્વર્ગે કઈ રીતે જોઈ શકું ? કઈ રીતે ? તે મારી પુત્રીને અન્યાય કર્યો હતો અને કરી રહ્યો છે. (અભિનદેવ પ્રસ્થાન કરે છે.)

યુવિષ્ટિર : તમે તમારો સંશય કહીને ચાલ્યા, પણ મને સાંભળો તો ખરા. આક્ષેપ કરીને આમ ચાલ્યા જવાનું ? આ અન્યાય છે, અન્યાય.

(કથાગાન)

માનવ સાથે દેવો રમશો, રમશો આટાપાટા ?

જોઈ શકે અમ આંખો પર કોણ બંધતું પાટા ?

માનવ સાથે દેવો રમશો, રમશો આટાપાટા

આટા... પાટા...

(અંધકાર)

અક્ત-૧

દશ્ય-૨

સૂત્રધાર : કંઈ કેટલાં જપતપ કરો, દેહને કંઈ કેટલાં કષ આપો ત્યારે દેવ સાક્ષાત્ દર્શન આપે અને અતિશય આનંદનું કારણ બને; પણ, જ્યેષ પાંડુપુત્ર માટે દેવોનું પ્રકટ થવું હુંખદાયક બન્યું છે.

દેવોએ પ્રકટ થઈ કંચું : ‘અમે તારાથી પ્રસન્ન નથી’ આ જાળોને ધર્મરાજનું ચિત્ત ગ્લાનિયુક્ત છે.

સદેઢે સ્વર્ગ પ્રાપ્તિ અંગોની મળતી જાણકારી હુંખદાયક બનશે એની કોને જાણ હોય ?

છમ લીલું છમ

વૃક્ષ હોય

ને

ફળદાયી ના હોય ?

હોય, એવું હોય –

છયાદાર ધ્યાનની નીચે

શીતળતા ના હોય ?

હોય, એવું હોય

પુષ્પ સુંધરી

ને સુગંધ

કંટક થઈ ભોકાય

એવું હોય ? ના હોય.

જ્યેષ પાંડુપુત્રે આ કલ્યાણ પણ નહોંતું

કે પુષ્પ કાંચ જેમ ભોકાય – એથી,

મૂઝાયેલા મૂઝાયેલા યુધિષ્ઠિરે પ્રથમ વાર

પિતા યમરાજનું આઙ્ગવાન કર્યું.

યુધિષ્ઠિર : આચારશુદ્ધ પુષ્પયાત્મા માટે

ધર્મરાજ છે

દુરાચારી, પાપાચારી માટે

કઠોર યમરાજ છે

ઓવા

વિવર્સાન અને સંજ્ઞાના પુત્ર

હે પિતા

પધારો.

(મૌન)

મારી મા હુતાના

નિમંત્રણથી

મને વર રૂપે પ્રદાન કરનાર

યમ એથી નિયમબદ્ધ

હે પિતા,

પધારો.

ધર્મભીરુ આ પુત્ર તમારો

દર્શન જંબે આજ,

હે યમરાજ !

(આકાશવાણી)

અવાજ : વત્સ.

યુધિષ્ઠિર : કોણ ?

અવાજ : યમ એથી નિયમબદ્ધ

એમ વચ્ચનબદ્ધ

તારા પિતા –

યમરાજ... નથી – તારે માટે ધર્મરાજ

યુધિષ્ઠિર : પ્રશ્નામ, પિતાશ્રી –

અવાજ : કલ્યાણમસ્તુ –

જીવનપર્યત મેં ચીયેલા માર્ગ ચાલેલા હે જ્યેષ પાંડુપુત્ર ! તારાં સત્ત કર્મને કારણે તું ધર્મરાજ કહેવાયો છે – આ પૃથ્વી પર એકાધિક સંગ્રહોની કટોકટીની કાણોમાં પણ તે મને, તારી સ્થિર મતિને કારણે સહયોગીત થવા નોતર્યો નથી, તો આજ પહેલી વાર આમ મૂઝાયેલો કેમ લાગે છે ?

યુધિષ્ઠિર : આપ અપ્રગટ કેમ છો, પિતા ? મને આપના દર્શનનો અવિકારી કેમ નથી લેખતા ?

અવાજ : (હસ્તીને) હું તારી સાથે ને સાથે જ હતો, પુત્ર !

યુધિષ્ઠિર : હું ? એ કંઈ રીતે ?

યમ અંગહાસ્ય કરે છે – હાસ્ય સમેટે છે અને પ્રકટ થઈને)

વિદ્ધુર : (મૃદુ અવાજે) પુત્ર –

યુધિષ્ઠિર : કોણ ? આ....પ ?

વિદ્ધુર : માંડવ ઋણિના શાપે કરીને હું યમ, પૃથ્વી ઉપર વિદ્ધુર રૂપે જન્મ્યો. દેવલોકે યમ કિંવા ધર્મ, પૃથ્વીલોકે વિદ્ધુર – કહે, કેમ મૂઝાયો છે ?

યુધિષ્ઠિર : આપે તો મને ધર્મને અનુસરતાં, ધર્મચયરણ કરતાં નરી આંદે જોયો છે. તો અન્ય દેવોને સદેઢે-સ્વર્ગ મારા આવવા સામે કેમ વિરોધ છે ? (અટકીને)

મારે મન દેવોની પ્રસન્નતા વિશેષ ઈચ્છાનીય છે, મારે સ્વર્ગ નથી આવતું.

વિદ્ધુર : અમે તો દેવાધિદેવ ઈન્દ્ર કહે એમ આજી અનુસાર વર્તનારા, દેવલોકે પણ દાસ જ, વત્સ.

યુવિષ્ટર : (નિઃશાસ સાથે) હં....

વિદ્ધુર : (સામેદ) પૃથ્વીલોક પર દાસીપુત્ર, દેવલોક દાસ.

યુવિષ્ટર : તો ?

વિદ્ધુર : દેવાધિદેવ ઈન્દ્ર ત્રણેય દેવને તારી પાસે પૃથ્વીલોક પર સંવાદ માટે મોકલ્યા હતા -

યુવિષ્ટર : સંવાદ તો અરસપરસ હોય ને ? દેવોએ પોતાની વાત કહી, પણ, મને વાત કરવાનો અવસર ન આપો - આ અન્યાય નથી ?

વિદ્ધુર : દાસને સ્વામીનો ન્યાય-અન્યાય વિચારવાનો ન હોય, વત્સ. દેવોએ પૃથ્વી પરથી પાછા જઈ મહારાજા ઈન્દ્રને જે કંધું હોય તે પ્રમાણે શાચિપતિ નિર્ણય કરશે - મને એ કહેશે તેમ મારે કરવાનું રહેશે.

યુવિષ્ટર : તો, હું શું કરું ?

વિદ્ધુર : ઉત્તરી શકે તો અંદર ઉત્તર. અકળ અંધકાર અડાબીડ હોય, વત્સ. પણ, લોચન મીંચિશા તો બધું ઉકલશે. તમને પાંદુપુરોને માના ઉદરના રખીત અંધકારની ઓળખ જ નહીં હોવાથી, આ અંધકાર અજાણ્યો લાગશે. આમ છતાં પાછા પગે ચાવી નાંખ - જવાય એટલે દૂર-સુદૂર (અટકીને) હવે અમે જઈએ.

યુવિષ્ટર : (કષાણ્દ રોકાઈને) મને પ્રશ્નરહિત કરો, કુશાગ્ર વડીલ !

વિદ્ધુર : બોલ, શું પૂછીવું છે ?

યુવિષ્ટર : મનં તો અતણ પાતાળ છે. હું જઈ જઈને ઊંડાં જળમાં કેટલે જઈશ ? અને જઈશ તોય વીતેલી પળનાં બિંબ હાથવગાં થશે ખરાં ? જળ નિસ્તરંગ તો હોતાં નથી એટલે પડેલાં બિંબ પાણીમાં વીખાઈ નહીં ગયાં હોય ?

વિદ્ધુર : તારે કહેવું છે તે અસંદિંધ કહે, વત્સ - હું તારે માટે દેવ નથી. મારી જેમ તું પણ પુરુનો વંશજ છે.

યુવિષ્ટર : વીંખાયેલા બિંબ મારી વીતેલી ક્ષણોને યથાતથ પ્રગટ કરી શકે ખરાં ?

વિદ્ધુર : ક્ષણ વીતે છે, તૂટીને શીર્ફવિશીર્ષ નથી થતી - તર્કનો આયુધ તરીકે ઉપયોગ ન કર. વત્સ, અતીતની મંજૂષમાં તમામ ક્ષણ સચવાય છે, મંજૂષ ખોલ અને ખપની છે તે ક્ષણોની સંમુખ થા. એ નિમિત્તે તને તું જો. આ અહોભાગ્ય લેખાય, વત્સ.

(વિદ્ધુર જાય છે એટલે યુવિષ્ટર અવધવમાં ઉભા છે અને)

કથગાન : ઊંડાં ઊંડાં જળમાં પળનાં

બિંબ પડેલાં શોધે;

નિજનો મારગ મેળવવાને

નિજને એ અવરોધે -

સ્થિર મતિનો જાતક નિજને

હળવેથી સંબોધે -

યુવિષ્ટર : (હળવાશથી) હસ્તિનાપુર નરેશ....

(અને દશ્ય પૂરું થાય છે)

(કમશા)

## આસ્વાદ

## કવિ રમેશ પારેખની કાવ્યરચના

### ‘નદીએ હબસણ ન્હાય’

લાભશંકર દાકર

કવિ રમેશ પારેખની કાવ્યરચના ‘નદીએ હબસણ ન્હાય’ એક સઞ્ચાર શિલ્પ, કંઠું કે શાઢશિલ્પ જેવી લાગે છે. આવી સરંચના અપૂર્વ સૌદર્યનો ભાવબોધ કરાવે છે. કાવ્ય, રચાયું છે, ૨૧-૮-૧૯૮૮ના રોજ તે કવિના ‘વિતાન સુદ બીજ’ સંગ્રહમાં છે. રમેશના ‘જ અક્ષરનું નામ’ નામના સર્વસંગ્રહમાં આ રચના પૃષ્ઠ ૪૦૬ ઉપર છે.

સાંભળો અને શાઢપત્રયક્ષ જુઓ રચનાના પ્રારંભમાં ઉપસતા હબસણના ચલત ચિત્રશિલ્પને.

નદીએ હબસણ બેવડો પવન પહેરી ન્હાય;

સ્તન ચોળે પેડૂ ઘસે, સાબુ કાળો થાય.

હબસણ શું પહેરીને ન્હાય છે ? બેવડો પવન પહેરીને. પવનનું વિશેષજ્ઞ અપૂર્વ છે. બેવડો પવન એટલે કેવો ? ગુજરાતમાં દેશી દારુને ‘બેવડો’ કહે છે. શું તે બેવડો ગટગાયવીને નહાવા બેઠી છે ? પવન તો પારદર્શક હોય. તે બેવડો કે ત્રેવડો હોય તોય કરી આપારદર્શક ન હોય. હા, તે સર્વથા નિર્વસન નહાઈ રહી છે. હા, તેણે બેવડો પીધો પણ હોય. એમ ન હોય તો વ જોનારન તો મદનો અનુમબ કરાવી રહી છે અને મદનને જગાડી રહી છે. હાસ્તો, નદીએ બેસીને હબસણ ઓપન સ્કાય નહાઈ રહી છે. તે સ્તન ચોળે છે, પેડૂ ઘસે છે. હબસણના કણા વર્જનો પ્રભાવ સાબુ પર પડે છે ? દૂરથી દશ્યગમ્ય હબસણને વર્જની રહેનાર કહે છે : ‘સાબુ કાળો થાય.’ ના, વર્જન કરનાર દ્રષ્ટ એમ નથી કહેતો કે મારી દસ્તિ ‘કાળી થાય.’ હા, ભાવક તો એવું અવશ્ય સીલ કરે છે કે હબસણના શારીરની પ્રેક્ષ્ય રૂપલીલાથી પ્રભાવિત થઈ છે, દ્રષ્ટાની દસ્તિ. હાસ્તો, આ ભાવક એવી નિખાલસ કેદ્ધિયત આપે કે દ્રષ્ટાના શાઢવર્જનની ભાવકની મનોમય અંતરદસ્તિ પ્રભાવિત થઈ છે.

સમુચ્ચિત ડિસ્ટન્સથી દ્રષ્ટ હબસણને જોઈ રવ્યો છે અને વર્જની રવ્યો છે. હા, સાંભળો અને નેત્રપત્રયક્ષ જુઓ હબસણનાં રૂપને.

નિતંબ પર અંજન પડ્ચાં, તેમાં ચમચીક જળ

જળને તગ તગ તાકતા આખા નભના સણ.

હાસ્તો, છે અને અવશ્ય છે, પ્રેક્ષકની દસ્તિમાં મુવી કેમેરા. તે ફંટથી જ જુઓ છે, એક જ સ્પોટથી, એવું નથી. તે નહાતી હબસણને એનસર્કલ પણ કરે છે. એમ એવા એનસર્કલિંગમાં કેમેરા કલોઝ અપ પ્રત્યક્ષ કરે છે : ‘નિતંબ પર અંજન પડ્ચાં.’

હા, ગાલમાં અંજન (ડિમ્પલ) જોયાં પણ છે અને તેનાં વર્જન પણ આ ભાવકે વાંચ્યાં છે. પણ નિતંબ પરનાં અંજન આ પૂર્વે કંઈ વર્જનમાં ય પ્રત્યક્ષ નથી જોયાં. હા, કેમેરામેનને પ્રોપર ડિસ્ટન્સ તો મળ્યું છે અને કેમેરાની જૂમ કરવાની ય યંત્રતત્ત્વતા હોવાથી તે નિતંબ પરનાં અંજનને બ્યુ-ટિ-કુ-લી પ્રત્યક્ષ કરે છે. નિતંબ પર અંજન પડ્ચાં છે અને ‘તેમાં ચમચીક

પરબ્ર માર્ચ, 2010

જળ' છે. તે જળને 'તગ તગ તકતા આખા નભના સળાને ય છબિકારે પ્રત્યક્ષ કર્યા છે. ના આવું અપૂર્વ સુંદર વર્ણન તેની સર્વ સામગ્રીની રૂપલીલા સમેતનું આ પૂર્વે આ ભાવકે કદી જોયું ય નથી અને વાંચ્યું ય નથી. હા, કેમેરાની દસ્તિ નભને ય, એના સળ સાથે નિતંબના ખંજના ખાડમાં પ્રત્યક્ષ કરે છે !

હબસણ સહજ એવી અનાયાસતાથી દશ્ય જગતના કેન્દ્રમાં આવી જાય છે. ના, નભ સીધું અને સ્વતંત્ર જોવાયું નથી. તે ય નિતંબના ખંજનની સાપેક્ષતામાં દશ્ય બનીને ડિલાયું છે. હા, રચના ચુસ્ત, ઘન, કોમ્પેક્ટ એવી ત્રેવથી જાણે સં-રચાઈ રહી છે.

જોઈએ કેમેરાદસ્તિ અને એના સર્જકની ભાવદસ્તિ હવે વર્ણનીયના રૂપને કેવું પ્રત્યક્ષ કરે છે.

### કુંગર ઝૂક્યા છાતીએ લઈ મર્દાણુ લાખ અના હાડેહાડથી સખલન ઢાળના થાય.

સર્જક કવિએ કુંગરનું વર્ણન કર્યું છે. હા, 'કુંગર ઝૂક્યા છાતીએ.' આ વર્ણનમાં વર્ણનીય તો હબસણનાં સ્તનો છે. તે કુંગર જેવા ઉનત છે. હા, તેના ભારથી (સ્તનો) ઝૂક્યાં છે.

આ બે પંક્તિમાં સર્જક કવિ એકસાથે હબસણના દેહને પણ પ્રત્યક્ષ કરે છે અને સમાંતર 'મર્દાણુ' લાખને પણ સંકેતે છે. હા, હબસણ ફીમેલ છે. પ્રેક્ષક પુરુષ છે. તેની મર્દાણુ લાખ, ડિઝાર ઓફ સેક્સ, ઉત્કટ કામેષણા નિરંકુશ ભાવથી વર્ણવાઈ છે. હાસ્તો, ઉત્કટ કામેચાને કારણે કુંગરના 'હાડેહાડથી સખલન ઢાળના થાય.'

સર્જક કવિ કુંગરનું વર્ણન કરી રહ્યા છે. કુંગર ઝૂક્યા છાતીએ એવા વર્ણન-કથનમાં હબસણનાં સ્તનોનો ય વર્ણનસંકેત અનુભવાય છે ? તે, સ્તનો કુંગર જેવા ઉનત છે. વળી તે નિજ ગૌરવથી ઝૂક્યા છે... હા, કવિ કુંગર અને સ્તનોને જાણે યુગપદ વર્ણવી રહ્યા છે. કવિ લેશમાર છનિહિબિશન વિના મર્દાણુ લાખને પણ પ્રત્યક્ષ કરે છે. સખલન ઢાળના થાય એવા સંકેતમાં ભાવક કુંગરના ઢાળમાંથી વહેતા નદ-જરણને ય જોઈ, કલ્યી શકે. હાસ્તો, પ્રકૃતિના વર્ણન-સંકેતમાં ટેબુઝ શા માટે ? માણસને સંસ્કૃતિ રોકે, અટકાવે. એ શિષ્ટતાના આવરણમાં ઢંકાયેલી હોય તો ય પોપચું ઉધાડીને ઉનનયાના પણ ન થાય. હાસ્તો વર્ણન તો નિર્વસન નહાતી હબસણનું છે અને એને નિર્નિમણ અનસર્કિંગ કરી જોતા પુરુષ દસ્તાનું છે.

આવો, વર્ણનીયના વર્ણનને સાંભળીએ, જોઈએ.

### બિલોરી ઉન્માદમાત્ર તરફડતું જળ ચૂપ ચંપાયું રૂવે રૂવે સીસમ સરખું રૂપ.

આમ તો બિલોરી શબ્દ છે. પણ કવિની વાણી શ્રવણીય પ્રભાવકતા ધારણ કરે છે. ઉન્માદને, કહે કે વિશેષને એ બિલોરી વિશેષણા પ્રત્યક્ષ કરે છે. કોણ આવા ઉન્માદમાં છે ? તરફડતું જળ. કેમ ? તે ચંપાયું છે. કોનાથી ? હબસણના સીસમ સરખા રૂપથી તે જળ રૂવે રૂવે ચંપાયું છે. હા, શ્રાવ્ય અમિયક્ષિત પ્રભાવક છે. જળ સાથે કોઈ આન્સભાવથી તદ્વપ, તન્મય છે ? છેસ્તો. કોણ ? કેમેરામાંથી તાકી રહેલો પ્રેક્ષક. હાસ્તો, કાવ્યકળા તો અર્ધસંકેત કરે. તે પૂર્વી સંકેત રૂપે ભાવકની ચેતનામાં વંજિત થાય.

આ સંરચનામાં પ્રકૃતિનો પ્રભાવ વર્ણવાયો છે. ઉદ્વિપન અને આવંબન- વિભાવ તો

છે, ન્યૂડ થઈ નદીના જળમાં નહાતી હબસણ. એનાથી પ્રભાવિત થયો છે પુરુષ દસ્તા. તે દસ્તાનો નિજ અનુભવ ટેન્જિબલ, હા સ્પર્શિય ઉત્કટતાનો છે. તેનું રૂવે રૂવે ચંપાયું છે.

ના, પણ આ શુંગાર નથી; કેમ જે કેમેરામાંથી તકતી દસ્તિ પુરુષની છે. જે પુરુષ વિશે હબસણ લેશ માત્ર સભાન નથી. હા, હબસણ રતિ, કામનો ઉદ્વિપનવિભાવ બને છે. પણ ના, તે આવંબન વિભાવ બનતી નથી. પરસ્પર, પરસ્પરથી સર્વથા અલગ, મિન છે. તન્મય થઈને રૂપમુખ બનીને તકતી પુરુષની દસ્તિ એમ સમીપ નથી. બે વચ્ચે ડિસ્ટન્સ છે, દૂરતા છે. હાસ્તો, દસ્તા પુરુષનો હું (આઈ) પણ એમ સીધો સંકેતાયો નથી. ને સર્વથા અદશ્ય અદશ્ય છે.

સાંભળો, જુઓ, કહું કે ટેન્જિબલી અનુભવો હવે પછી પ્રત્યક્ષ થતું રૂપ.

સૂરજને છુંદો મૂકી તડકો એકલ પંડ

નાગોછમ તૂટી પડ્યો હબસણ પર શતખંડ.

તડકો વર્ણવાયો છે. તે તૂટી પડ્યો છે. કામાસક્ત અનવરુદ્ધ આકમણનું આ વર્ણન છે : 'તૂટી પડ્યો.' હા, તડકો તૂટી પડ્યો છે. તે તેના મૂળ પ્રભવ સ્થાનને, સૂર્યને, છુંદો મૂકી, તૂટી પડ્યો છે. તેથી સર્વથા એકલપંડ. અને વળી નેચરલી, નાગોછમ.

ઉત્કટ કામોદેક અને સંયોગમુખની અસુદ્ધ કામના અહીં સીધી ગતિમાન રૂપમાં વર્ણવાઈ છે. તડકાનાં વિશેષણો તેની ઉત્કટ ડિઝાયને સેન્સ્યુઅસ રૂપમાં પ્રત્યક્ષ કરે છે. હા, તે નાગોછમ, શતખંડ, નદીમાં નજન નહાતી હબસણ પર તૂટી પડ્યો છે. હા, શીતખંડ, દુકડા દુકડા થઈને તૂટી પડ્યો છે. 'તૂટી પડવું' પ્રયોગ અહીં આ વિશેષ સંદર્ભના અર્થભાવને પ્રત્યક્ષ કરે છે; વળી શરીર સીધું શરીરથી ભોગ્ય છે. તેવું ભોજન (મનપૂર્વક, પણ) શરીરથી ભોગ્ય છે. શત ખંડ તૂટી પડવાનું પ્રયોજન વંજનાથી સંકેતાય છે. તે નિર્વસન હબસણના આગળપાછળના, ઉપરનીચેના ઉદ્વિપક, પરમ પ્રેરક એવાં અંગાંગો ભોગ્ય છે. તડકો (કહો કે સર્વાંગથી) તૂટી પડીને હબસણના સર્વાંગે ભોગવી રહ્યો છે.

કહો, ગમે તેવા પ્રોપર ડિસ્ટન્સથી તાકી રહેલા, હબસણની દસ્તિમર્યાદાથી દૂર, છાંબ, અદશ્ય એવા તાકનારા પુરુષનો રતિકામ આમ તડકાના નામથી વર્ણવાયો છે, તે સેલ્ફ પ્રોજેક્શનનથી ? છે.

હા, આ આદેખન દસ્તાની અંગત દસ્તિથી જેટલું થયું છે તેટલું જ તે બિનંગત દસ્તિથી થયું છે. સાંભળો પણીની પંક્તિઓ :

હબસણ કહેણ વીજળી સળકે જોબનબેર

જવ બની લડખું બને, નજરુંમાં અંધર.

હાસ્તો, અદશ્ય કથક હબસણના રૂપના પ્રભાવને પ્રત્યક્ષ કરી રહ્યો છે. તે હબસણને 'કહુણ વીજળી' કહે છે. તેનો પ્રભાવ વિદ્યુત સમાન છે. હા, કહુણ વીજળીના વિશેષમાં પ્રયોજાયેલા બે 'ઈ' તેની પ્રભાવકતાનો શ્રવણીય સાક્ષાત્કાર કરાયે છે. હાસ્તો, કાલ્ય તે સર્વથા ઓડિબલ ઘટના છે. હા, બલે તે વિદ્યુતનું વિશેષણ હોય, પણ વણ્યમાન તો છે, હબસણ. હા, તેનો, હબસણનો પંચેન્દ્રિયમ્ય પ્રભાવ પ્રેક્ષક, દસ્તા જીવી રહ્યો છે. હા, વિદ્યુત જેવાં પ્રભાવક હબસણનાં અંગાંગો છે. તેની પ્રત્યક્ષ થતી યંત્રતંત્રધર એવી હ્યાતીની અસરો વર્ણવાઈ રહી છે. યંત્ર એટલે શરીર. તંત્ર એટલે

શરીરનાં કિયાકારક અંગો. કહુણ વિશેષજ્ઞ આ રૂપાંગનાની માંસપેશીઓને, તેના પ્રભાવક આ અને તે સમુદ્ધયોને સંકેતે છે. તે તો કહુણ વીજળી સમા, જોબનભેર, સળકે છે. હા, તેનો પ્રભાવ તોના પર પડે છે? અદશ્ય દ્રષ્ટા પર અને તેનાથી પ્રેરિત આ મારા-તમારા જેવા ભા-વ-ક પર. હાસ્તો, દ્રષ્ટા (જોનાર, વર્ષણ કરનાર) અને તેના પ્રભાવસાતત્ત્વમાં જે અનુસર, અનુચર છે તે ભાવકની સ્થિતિ ય પ્રભાવિત એવા અદશ્ય દ્રષ્ટાએ વર્ણવી છે. જીવ બની ભડથું બને, નજરુંમાં અધીર.

હા, ગમે તેવી અતિશયોક્તિથી વર્ણવાયેલી ઘટના એમ સત્ત્યથી દૂર નથી.

ઉત્કટમાં ઉત્કટ ઈચ્છા આમ તો પ્રાણીશશ્શા છે. હા, તે જીવ માત્રનું પાયાનું સત્ત્ય છે. પણ બીજી પ્રબળ ઈચ્છા તે કામેષણા, ડિયાપર ઔફ સેક્સ, છે. મહર્ષિઓને ય, તપશ્વર્યા ત્યજને, આગ આગ ભડથું થઈ જતા નથી વર્ણવાયા આપણા પ્રાચીન કથાસરિતસાગરમાં?

કામેષણા સહજ એવી શરીર-પ્રાણ સાથે અંતર્નિહિત આવતી અને યોગ્ય બળે જાગતી પ્રબળ એપ્ષણા છે. કુદરતે તેને સહજ એવી પાયાની એપ્ષણા રૂપે મૂકી છે. હાસ્તો, કુદરત તો જીવનસાતત્ત્વની પ્રેરક છે. ના, કુદરતને, ધ નેચરને કોઈ માનવીય સંસ્કૃતિની ફિલાણી-ફીકણી દ્વારાનિકતામાં લેશમાત્ર રસ નથી. જીવજાતિનું સાતત્ય જ, ધ નેચરનું, મૂળ ફક્શન છે. બ્રહ્મચર્ય (celibacy)-ની ચર્યા તે તો માત્ર અને માત્ર રમૂજપ્રેરક કિસ્સાઓ હોય.

સર્જક કવિ રમેશ પારેખની આ સજીવ ચલતું શિલ્પ જેવી ડાયનેમિક સંરચના કોઈ મૂલ્યની છીએ રાખ્યા વગર, સીધા બેઝિક હુમન વાસ્તવના ઉપાદાનને કાવ્યપ્રત્યક્ષતાનો ઘાટ આપવામાં તલ્લીન છે. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ એ તો માત્ર ભાવના છે. અને તે ઉપરછલી છે. હા, એવીયે ભાવના, કોઈ ભાવકને સેવકી પડે તે હારયજનક નથી? તે ય પાછી શીખ તો પોતાને જ પ્રથમ વ્યક્તિ એકવચનમાં અપાઈ છે. હાસ્તો, આંતરનિરીક્ષણો આવા ભાવકને જે દર્શન કરાવતા હશે તે તો સર્વથા વિપરીત જ હશે ને? હુમન કલ્યારે આપી આપીને દંબને, જૂઠને જન્મ આપ્યો છે.

દુંબી ઠાડ દુંબી રિલેટેડ. આ રિલેશનના સાતત્ત્વમાં સમાજ પણ રચાય. તેના નિયમો પણ હોય. જે સમયાન્તરે બદલાતા પણ રહે. સંસ્કૃતિના નામે હવડ, ખાલોચિયાં રચાય તો કોઈને ગાવું પડે : ઝટ ઠહોળી નાખો રે મનજળા થંબ થયેલાં.

આ રચના અનાવશ્યક છોછ, ટેબુઝ કોરાણે મૂકીને મનુષ્યના ઠેનેટ, નેચરલ ભાવસાત્ત્વને સંકેતે છે. હા, આ રચનામાં હબસણાનું શરીર જેટલું વર્ણવાયું છે, તેટલું જ પુરુષનું ‘મન’ સંકેતાયું છે. છતાં આ રચનાનું સત્ત્ય અનોખું છે. તેમાં પુરુષની દિલ્લિનું કમજૂન (ગતિ) છે પણ દ્વિલિકલ આકમજૂન, બળાત્કાર નથી. એમાં દિલ્લિની ગમે તેલી સંનિકટતા હોવા છતાં, દ્વિલિકલ દૂરતા છે. ના, નથી હબસણના તન પર આકમજૂન થયું કે નથી તેના મનને લેશ માત્ર ક્ષુદ્ધતાનો અનુભવ થયો. ના, એક ક્ષણ માટે પણ નગન નહાતી હબસણ અન્યની, પુરુષની દિલ્લિ પરતે સભાન થઈ નથી. કામુક દ્રષ્ટાની દિલ્લિને કામુક કહી શકાય, છતાં આ ક્ષણો, તે અનાકમક હોવાથી, ભાવક એમ કહેવાનું પરસંદ કરે કે દ્રષ્ટાની દિલ્લિ રૂપમુગ્ધ છે. હા, કોઈ પુરુષિત વેલને, તેના રૂપસૌદ્ધયને કોઈ કેમેરાની દિલ્લિથી દૂરથી, સંનિકટ જઈ, એનસર્કલ કરતાં કરતાં નિરાખી રહે તેમ અહીં અજબ નૈકટ્ય અને ગજબ દૂરનાં સર્જાઈ છે. હા, ઘટના ઘટી છે, તે ઓપનસ્કાય ઘટી છે. હા, ઓપનસ્કાય ઘટના એમ કોઈની પણ

નજરે પડે. હબસણ ઓપનસ્કાય એવી દિલ્લિસૃષ્ટિની સંમોહક સામગ્રી છે. દ્રષ્ટાના દિલ્લિક્ષેપમાં તે સહજ એવા સ્નેહસક્ત ભાવથી કિલાય છે. ના, એમ નૈતિકતાનો પ્રશ્ન ઓપનસ્કાય ઘટનાઓમાં સંઘળણી નથી. તેવા પ્રશ્નો તો બંધ એવાં સાંસ્કૃતિક ઘરોમાં જાગે. નૈતિકતા તે સાંસ્કૃતિક સર્જન છે. પ્રકૃતિમાં તેવું એથિક્સનું મૂલ્ય જ નથી. હા, આમ આ ક્ષણોમાં હું જે કંઈ કાંતી રહ્યો છું તે મારી ચેતનામાં જાગે છે તેથી કંતાય છે. સાંભળો હવે સર્જક કવિએ રચેલા આ અપૂર્વ કાવ્યનો અંત.

**હબસી બનવાની કરે પડાપડી સહુ કોય**

**રમેશ કર જોડી કહે : બાપુ એમ જ હોય.**

હા, ‘સહુ કોય’ એવા કથનમાં તો વ્યાપક સત્ત્યનો સંકેત છે. હબસી એટલે નર હબસી, હા, પુરુષ હબસી. કાવ્યરચનાના કેન્દ્રમાં, કહો કે કેમેરાની દિલ્લિસૃષ્ટિમાં સતત ફીક્સમાં હબસણ છે. યેસ, ધ વુમન. કહો કે અ યંગ બ્લેક વુમન. પુરુષની દિલ્લિએ તે ભોગ્ય છે. અન્યથા સ્ત્રીની દિલ્લિએ પુરુષ ભોગ્ય છે. સહજ એવી કામકીડામાં પરસ્પર ભોગ્ય અને ભોક્તા બનનારા ખેયર છે. હા, એ પરમ સુખદાયક કીડાના નર-નારી ખેયરસ્ય છે. ભારતીય પ્રાચીનોએ ઉપસ્થ-યોનિના સુખને સર્વોચ્ચ કર્યું છે. સંસ્કૃતિ તો ઘણી, ઘણી જ ગૌણ છે. પ્રભાવક તો પ્રકૃતિ છે. તેણે, પ્રકૃતિએ, male અને female-ને સર્વોચ્ચ સુખની કીડાના ખેયરસ્ય બનાવ્યા છે. કેન્દ્રમાં, દિલ્લિપત પર, નિર્વસન હબસણ પ્રત્યક્ષ થયા કરી છે, તેથી ‘સહુ કોય’ પુરુષો ‘હબસી’ બનવાની કરે પડાપડી. કાવ્યાન્તે સિંગેચર કરીને કવિ રમેશ (પારેખ) કર જોડી કહે : બાપુ એમ જ હોય. હા, ન અન્યથા હોય. પ્રકૃતિના સત્ત્યની પડ્છે સાંસ્કૃતિક સત્ત્ય તો ઘણું જ દુર્બલ, રંક અને આપંગ હોય. કવિ રમેશો કાવ્યની અંતિમ પંક્તિના અંતિમ શબ્દ પર ફૂદીનું ચિહ્ન મૂકીને કાવ્યના અંત પણી નોટ્સ મૂકી છે, આ શબ્દોમાં : ‘કાવિશ્રી કાલિદાસને સપ્રેમ અર્પણા.’

કાલિદાસ સ્ત્રી-પુરુષના સંનિકટ સ્નેહના કવિ છે તેથી અર્પણના અધિકારી છે. પણ ‘કાલિ’ એટલે બ્લેક; અને ‘દાસ’ એટલે સેવક. હા, હબસણ કાલિ (ધ બ્લેક વુમન) છે અને તે આ કાવ્યમાં પરમ સેવ્ય, ભોગ્ય રૂપમાં ધરાવવામાં આવી છે. હા, અર્પણ કવિએ હસીને કર્યું છે.

આ આખી રચના રમેશ પારેખે દોહરામાં રચી છે આ માત્રામેળ છંદ છે. ૨૪ માત્રાના રૂપમાં, ૧૭મી માત્રાએ યત્તિ(વિરામ) છે.

**દાદા દાદા દાલદા, દાદા દાદા દાલ.**

[ડિસેમ્બર : ૨૦૦૮]

I

### ભૂલસુધાર (ફેબ્રુઆરી ૨૦૧૦)

1. પૃ. 52 પર પ્રથમ લીટીમાં ‘૧૦મી જાન્યુઆરી’ની જ્યા એ ‘૨૪ જાન્યુઆરી’ વાંચવું.
2. પૃ. 58 પર પ્રથમ લીટીમાં ‘ઈ.સ. ૧૯૮૦’ને બદલો ‘ઈ.સ. ૧૯૮૧’ વાંચવું અને બીજી લીટીમાં ‘૧૯૮૧’ને બદલો ‘૧૯૮૧૬’ વાંચવું.
3. પૃ. 39 પર ‘ગોરખ આયો!’ના કવિ ‘રાજેન્દ્ર શાહ’ને બદલો ‘રાજેન્દ્ર શુક્લ’ વાંચવું.

## ભારતીય સાહિત્ય

### ત્રણા કાવ્યો

મીરાં તારળેકર;  
અનુવાદક : કાજલ ઓળા વૈધ

શ્રી મીરાં તારળેકર જી. એસ. એસ. મહાવિદ્યાલયમાં (નેલગાંવ) મરાઠીનાં પ્રોફેસર છે. લગભગ પંદરથી વધુ પુરસ્કાર અને આઠથી વધુ કાવ્યસંગ્રહો સાથે ‘સાંભળ હે દ્રૌપદી !’ એમનો આગવો કાવ્યસંગ્રહ છે. લગભગ ૫૦ કવિતાઓ દ્રૌપદીને સંબોધિને આજની નારીના હૃદયમાંથી નીકળતા સંવેદનને વ્યક્ત કરે છે. ૨૦૦૫માં લખાયેલી આ કવિતાઓ મરાઠી ભાષાની ઉત્તમ કવિતાઓમાં ગણાય છે.

#### (૧) મન વહેચી શકીશ સપ્રમાણ

....ને શરૂ થયો પછી તો,  
જગતથી તફન રેગળો પરીક્યા સરખો  
અંઘો સંસાર...  
કુતી માતાએ સોગંદ લીધા  
કલું, પાંચેયને એક રાખજે  
કાયા-વાચ્યા-મન  
સમાન ભાગો વહેચી આપજે  
કાયા આપીશ તું,  
વાચા પણ  
ને મન ?  
વહેચી શકીશ સપ્રમાણ ?  
શું કરીશ તું ?  
કેમ નિભાવીશ વચન ?  
ન્હોય આ દામ્પત્ય  
આ તો આત્મસર્પણનું છળ  
તારા મનના મત્સ્યવેધને હજ કયાં વળી છે કળ  
તારા મનની માછલીની અકલંઘ સળવળ  
સૌંદર્યએ ધ્વંસ કર્યો  
સ્વખન હતું, કે સત્ય ?  
કે પછી  
પૂર્વજનમનો સંકેત કોઈ  
મૃત્યુદંડ સરખી આ શિક્ષા  
તું જ કયાં સમજે છે...

ગીલ્લી છે એકલી  
સ્વયંને ત્યજીને  
અવાર્દ્ર  
કળાતી નથી વિધાતાની રમત  
વિસ્તરેલી આ ગુંચવણાની જાળ.

#### (૨) વધ થયો તારો

એક અમાનુષી સન્નાટો  
પ્રસરી રહી છે તારી ચોતરદ્ર  
જ્યાં જુઓ ત્યાં પિશાચ-પ્રેતનો વિસ્તાર  
રક્તના સુકાયેલા ડાધા  
જોઈ રહી છે પાંચાલી  
રક્તની ઉખાધારાઓ રેલાઈ તારા સમસ્ત અંગ પર  
કેમ થયો નહીં તને વિજ્યનો આનંદ ?  
શું ધગધગતું હતું હૃદયમાં ?  
કહે મને, કુકત એટલું જ...  
અને એ જ રાત્રે સખી, વધ થયો તારો  
ગાઢ નિદ્રાધીન  
તારા પુત્રોને ચિત્રણાંની ફેલદીને  
અચ્છત્યામાંએ પૂરો કર્યો પ્રતિશોધ  
દ્રોષ વધનો  
અંત....  
અંત થયો એ કાણો  
તારી આશાના કૂણા કિરણનો  
સુખનું અંતિમ અવલંબન પણ પૂરું થયું  
નજર સામે સરકી ગયું એમનું બાળપણ  
છાતીએ વળગીને ધારેલું ધાવકા  
તેં પૂછ્યું કયાં ગયાં ?  
મારા પાંચના એ દસ ચરણ  
પોક તારી  
આકાશને ધૂજાતી ગઈ  
આકાશ થઈ ગયું મટમેલું – કાળું  
સ્તરદ્વારાં બાલાંડ  
કાશાર્થમાં પીગળી ગયું  
દેવો પણ માથાં નીચાં ઘાલીને બેસી રખા

નજર કેમ મેળવે ?  
 એ પણ લજીજત....  
 ઘનઘોર જુંગલોને વીધિને  
 અજિન કેમ પ્રસર્યો શોક તારો  
 વૃક્ષો ઉભાં સૂકાયાં  
 કડડાટ કરતાં તૂટ્યાં  
 સૂકા પણ્ણો ઉડતાં રહ્યાં  
 આકાશમાં પક્ષીઓના ચિત્કાર  
 અરણ્યનાં પંખીઓ કણ્ણ શોધે તને, સખી  
 ઉભાં ઉભાં થરથરે જુંગલો  
 હિસ્ક ભયથી ત્રસ્ત  
 ઉધારી ચંગુ  
 પીડાથી પ્રાણ પંખી થઈને ઉડી ગયાં  
 શોકનો શ્યામ પ્રવાહ ધસમસે  
 ભરોવરોમાં ઉભરાયો  
 તારી માછલી સખી  
 તારા સુધી પહોંચવા  
 કંઈ આવીને અફળપત્રી  
 જુંગલે ચીસ પાડી હવાને કબું  
 શોધ, શોધ જઈને પ્રિય સખીને  
 ક્યાંય અટકીશ નહીં, ક્ષણ માટે પણ  
 પદચાપ ન થાય, જોજે !  
 જુંગલની જૂઈ લઈ જા થોડી  
 રેશમમાં પરોવીને  
 સણસણતો આવ્યો પવન  
 દેવનું આ કેવું ક્ષત-વિકષત ચિત્ર  
 અદ્દંધ  
 સમશાનવત્ત શાંતિ વિસ્તરે  
 ફૂલો સંધળાં ચોતરફ વેરાયાં  
 પુત્રોના છિન્-વિચિન્ન શબ્દો પર  
 હવાની લહેર માના પાલવની જોમ ફેલાઈ ગઈ હળવેથી  
 ને પછી  
 અશ્વ લૂછતી વળી ગઈ પાછી  
 સખી, હજ કાશ પહેલાં તો સ્વન્ન જોયું

પુત્રવિવાહની ધામધૂમનું  
 પરંતુ કાળની થપાટે વિખેરી નાખ્યું  
 નિયતિએ તને જ કેમ આપી  
 દુઃખની આ વજનદાર ગાંસડી  
 કે પછી, તું એટલે જ સ્વયં કાળે ચીતરેલા  
 અપ્રતિમ ચિત્રની કલાકૃતિ છે  
 જગત સમક્ષ  
 સત્રી-આત્મનો આદર્શ પ્રસ્થાપિત કરી તને  
 પણ કોણ સમજે ? કઈ રીતે ?  
 વેદનાના કઠોર રંગ કેમ પૂર્યા કાળે ?  
 આને કોઈ ક્યારેય લૂછશો ખરું ?

### (૩) બંધનમુક્ત

સખી,  
 સાંભળીને તારી કથા ?  
 લૂછી નાખ હવે  
 આંખોનાં આ જળ.  
 એવું ન માન  
 કે તારું કોઈ નથી  
 અરે !  
 દરેક કાળજામાં ખુંચે છે  
 તારી પીડાની બટકી ગયેલી કહાની.  
 જો સખી  
 ક્ષિતિજને પેલે પાર વિસ્તરી છે  
 તારી બંધનમુક્ત પ્રતિષ્ઠબિ  
 શ્રદ્ધા રાખજે  
 હવે આવો અન્યાય કોઈ સહેશો નહીં  
 તારી પીડામાંથી જન્મ લેશે  
 વારંવાર  
 ગૂંઠાંસીની  
 તદ્દન નવી તેજોમય કથા.

## અભ્યાસ

### શાંતદલપદમાં પોઢેલો : કવિશ્રી નહાનાલાલને સ્મૃતિવંદના (૧૮૭૭-૧૯૪૬) | નરોત્તમ પલાશ

૧૮૦૦થી આરંબાયેલા અર્વાચીનયુગમાં ગુજરાતી ભાષાના ઉત્કર્ષ અર્થે સભાન પ્રયત્નો આરંભાયા તેનાં ઐતિહાસિક પ્રમાણો ઉપલબ્ધ છે. વડોદરાનરેશ શ્રીમાન બંડેરાવ ગાયકવાડની સહાયથી કવિશ્રી દલપત્રરામ, ‘ગુજરાતી’ની સ્થિતિ સુધારવા યત્નશીલ બન્યા. સૂરતમાં દુર્ગારામ મહેતાજીએ ‘માનવ ધર્મ સભા’ સ્થાપી અને તેના વિચાર-પ્રચાર માટે ગુજરાતી ભાષાનું જોડાણ શરૂ કર્યું. ભોળાનાથે ગુજરાતી ભાષામાં ‘પ્રાર્થના-માળા’ આપી અને શ્રીમનું નૃસિંહચાર્યજીએ ‘મહાકાલ’ દ્વારા ગુજરાતી ભાષાને તત્ત્વચર્ચા માટે પ્રયોજી. જૂનાગઢની આજુબાજુ નથુરામ શર્માં અને સ્વામી સહજાનંદ ગાંધીને પલોટી રહ્યા, બચાબર આવા સમયમાં કવિશ્રી નહાનાલાલ, ગુજરાતી ભાષાના આકાશમાં પૂર્ણચંદ્ર રૂપમાં ઊળી નીકલ્યા ! ૧૮૭૭ની સોળમી માર્યે અમદાવાદમાં જન્મ, સ્વભાવે તોકાની અને અભ્યાસમાં બેધાન નહાનાલાલની ૧૮૮૮માં માણેકબા સાથે સગાઈ થઈ, આ સમયે માણેકબાની ઉંમર માત્ર ત્રણ વરસની ! ૧૮૮૭માં ઘરેથી ભાગીને નહાનાલાલ વડતાલ આવ્યા, ૧૮૮૮માં ફરી ભાગ્ય અને ૧૮૯૮માં પંદર વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી ! ૧૮૯૮માં મોરબી મુકામે ગુરુવર્ય કાશીરામ દવે પાસે સાહિત્ય અને ઈતિહાસના સંસ્કાર પામી સ્વસ્થ થયા. હસતો ચહેરો, પણ ગુરુસે થાય તો ધરતીકંપ સર્જે એવા નહાનાલાલના હારે ૧૯૮૮માં ‘વસંતોત્સવ’ રચાયું ! કવિ તરીકે નહાનાલાલનો, ગુજરાતી ભાષાનો અને સાથે સાથે ડેલનશૈલીનો આ ભાગ્યોદ્ય હતો. ૧૯૦૧માં ઈતિહાસ લઈને નહાનાલાલ એમ.એ. થયા તથા સાદરાની સ્કોટ કોલેજમાં જોડાયા. ૧૯૦૪માં રાજકુમાર કોલેજ, રાજકોટમાં આવ્યા, ૧૯૦૮માં સિલોનનો પ્રવાસ કર્યો, ૧૯૧૧માં રાજકોટ સંસ્થાનમાં ન્યાયાધીશ તરીકે અને નાયબ દીવાન તરીકે નિયુક્ત થયા. ૧૯૧૪માં કાશીરાનો પ્રવાસ, ૧૯૧૬થી પુનઃ રાજકુમાર કોલેજમાં, ૧૯૧૮માં કાઠિયાવાડ કેળવણી ખાતાના ઉપરી અને રવીન્દ્રનાથ ટાગોર આવ્યા તેની સાથે ચૌરાઝ્ઞનો પ્રવાસ, ૧૯૨૧માં અસહકારની ચણવળમાં જોડાઈને સરકારી નોકરીનો ત્યાગ કર્યો અને શેષ જિંદગી માત્ર કવિ તરીકે ગુજરાતી ભાષાને અર્પણ કરી.

કવિ જીવતો હોય અને ઠેર ઠેર તેની જન્મજયંતી ઊજવવામાં આવે તેનું વિરલ માન ગુજરાતીમાં એક માત્ર નહાનાલાલને પ્રાપ્ત થયેલું છે. ૧૯૨૭માં નહાનાલાલને પચાસ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે મુંબઈ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, ડાકોર, રાજકોટ અને પોરંદર જેવાં સ્થળોએ તેમનો સુવાર્ણ મહોત્સવ ઊજવવામાં આવ્યો. ૧૯૩૭માં નહાનાલાલને સાઈ વર્ષ પૂરાં થયાં તો ખૂબ ઉલ્લાસભેર આખા ગુજરાતે તેમની ઘણ્યુર્તિ ઊજવી ! ૧૯૪૨માં દલપત્રવંશની એકસો અગિયાર વર્ષની અખંડ સાહિત્યોપાસનાની ઊજવણી થઈ ! ગાંધીજી જેવા મહારથી સાથે મતભેદ પડ્યા હોવા થતાંએ ‘કવિશ્રી’,

‘કવિસમાટ’ અને ‘મહાકવિ’ જેવાં બિરુદ્ધોથી જેમને વધાવ્યા તે નહાનાલાલ, ગુજરાતી ભાષાની સૌથી વિરાટ માંઠેની એક પ્રતિમા, ૧૯૪૬ની નવમી જાન્યુઆરીએ પોતાની તેજપાંખો પસારી, ક્ષર મૂરીને અક્ષરધામમાં વિરસી ગઈ !

### શાંતદલપદમાં પોઢેલો

નહાનાલાલનો સાહિત્ય-રચિ શાંતદલમાં વિકસેલો છે. સો ઉપરંતુના એમના ગ્રંથોમાં કવિતા, નાટક, નવલકથા, લઘુનવલ, નવલિકા, ચરિત્ર, વિવેચન, ઈતિહાસ, ભૂગોળ અને અનુવાદાદિનું વૈવિધ્ય છે. નહાનાલાલ સ્વભાવથી કવિ છે, તે ‘ગુજરાતની ભૂગોળ’ લખે તો પણ તેમાં કવિતાનો પદ્ધત્પરાગ ઉડતો અનુભવાય ! એમનું સાહિત્ય-પુદ્ધગલ ભાવનાથી બંધાયેલું છે અને એમાં કરોડરજીજુના સ્થાને ઈતિહાસ રહેલો છે. અર્થ શતાબ્દીના અનુભવ બોલ્યાં નહાનાલાલ ઉચ્ચારે છે : ‘મહારા તો એર્ધી સદીના જીવનશ્રમ ભારતનો ઈતિહાસ અને ભારતની કવિતા જીવવાના હતા.’ ઈતિહાસમાં કવિતાનું દર્શન અને કવિતામાં ઈતિહાસની રંગતીલા નહાનાલાલની સર્જન સૃષ્ટિનું રહેસ્ય છે.

કવિ તરીકે નહાનાલાલનો પર્યાય મુશ્ખલતા છે. આવી અને આટલી લલિત પદ્ધતિલી નહાનાલાલની વિશેષતા છે, તેમ પ્રશ્નયની સુકુમારતા એમનું જીવાતુભૂત તત્ત્વ છે. એમની કવિતા દાખ્યતની રસમસ્તિનો આલેખ છે તેમ એમનાં નાટકો પ્રેમનું સ્કૂલ વિવેચન છે. કવિતા અને નાટકને આપણે સંયુક્તપણે દાખ્યતનું મહિમાગાન કરી શકીએ. નહાનાલાલ ભલે એક માત્ર નવલકથા ‘સારથિ’ આપી પણ એનો વિશ્વફિલક, ભાષા અને દર્શન – નહાનાલાલ પદ્ધીના કેટલા નવલકથાકારોનું માર્ગદર્શન કરે છે તે તેનાં દેખાંજોખાં હજુ મંડાણા નથી. નહાનાલાલ જે સમયમાં છલ્યા તે જીમય જુઝો, બ-બે વિશ્વયુદ્ધનો જે સમય મનુષ્યના ઈતિહાસનો સૌથી વધુ રહેસ્યમય, પરિવર્તનશીલ અને દગાખોર સમય છે. ‘સારથિ’ને આ દાખ્યાએ તપાસતંત્ર જાણશે કે હવાઈ લાગતી આ નવલકથા, બ-બે વિશ્વયુદ્ધનાં, ૧૯૧૪થી ૧૯૭૮ વર્ષેના પરચીસ વર્ષને તપાસે છે. નહાનાલાલ જેવા સંવેદનશીલ ચિત્તનપરક ઈતિહાસવિદ્ને આ સમય હલાલી મૂકે તે સહજ છે. નહાનાલાલનું જે દર્શન છે અને નહાનાલાલ પોતે ‘ઈતિહાસની અમૃતાશરી’ તરીકે ‘સારથિ’માં મૂકવા યત્નશીલ બન્યા છે. કહો કે આ કાળજીબની મીમાંસા ‘સારથિ’નું ફિલક છે. બે વિશ્વયુદ્ધો વર્ષે જે જે બન્યું તેને ઓશિયા અને યુરોપ ખંચેના પૂર્વ ઈતિહાસની પાર્થેભૂમાં મૂરીને ભાવિનાં એંધાણ પારખે છે. નહાનાલાલ શ્રદ્ધાળું કૃષ્ણભક્ત છે, ભગવદ ગીતાનો અનુવાદ પણ એમણે આપ્યો છે. ‘સારથિ’ એમને આત્મસાત્ર છે. ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ બધા જ રથની દોરી આ ‘કૃષ્ણાનમધારી ‘સારથિ’માં છે ! નહાનાલાલ ભાજે છે કે બ્રિટન મહારથી (અર્જુન) બને અને ભારત સારથિ બને તો વિશ્વસંસ્કૃતિનો ઉદ્ય નિશ્ચિત છે. અલ્ય વાર્તાતત્ત્વ આ નવલકથાની મર્યાદ છે તો નહાનાલાલના કલ્યાનોથી ચક્ષુએ વાંચેલી – સંસ્કૃતિસમન્વયની આ આદર્શ અને પ્રેરક નવલકથા તેનું જમા પાસું છે.

૧૯૧૮માં જેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ તે ‘ઉષા’, એલચીના દાશા જેવી નહાનાલાલની સુગુંગિત લઘુનવલ છે. નહાનાલાલ કહે છે : ‘આ વાર્તા માત્ર રેખાચિત્ર છે, ધનિસૂચન છે, તર્જની નિર્દેશ છે પણ વ્યંજના અને ધનિ રસમીમાંસાના ચતુર મીમાંસકોને કાજે કાંઈ ઓછાં છે ?’ (પ્રસ્તાવના) ડમણાં ડમણાં ચર્ચાતા લઘુનવલોનાં લક્ષણોથી અજ્ઞાત

‘ઉષા’, એક જ situationમાં એક જ પ્રમેય ઉપર વણતી કથા, પાત્રોની અન્ય સામાજિક વિગતોનો અભાવ, લાગણીનાં કેન્દ્રોનું વિઘટન અને આ બધા જ દ્વારા શક્ય તેટલો હૂર રખાતો ‘સામાજિક વાસ્તવ’ – આપણી સર્વપ્રથમ કાલ્યમય લઘુનવલ છે. ગુજરાતી ગવને નહાનાલાવે જે ભાવમયતા પ્રદાન કરી તેનો સર્વોત્તમ નમૂનો ‘ઉષા’નું ગવને છે.

નહાનાલાવ જેને ‘નવવિકા’ તરીકે ઓળખાવે છે તે ‘પાંખડીઓ’ (૧૯૭૦) એના ઉર્મિરસિત આણાં કથાનકો અને નીતરતા ગવના કારણે ભારે સુવાસિત છે. કવિના જીવનના અનેક કરુણ-મધુર પ્રસંગો અહીં પાંખડી રૂપે વેરાંનું છે. ગુજરાતી ભાષાની તરલતા અને કમનીયતાનાં દર્શન અહીં છે. નહાનાલાવ જાણે નરસીંહ, મીરાં, દ્વારામનો નિયોડ છે !

‘કવીશ્વર દલપતરામ’, ‘આપણાં સાક્ષરરત્નો’ અને ‘ચિત્ર-દર્શનો’ નહાનાલાલની અનોખી ચિત્રન-ચિત્રશક્લા છે. કવિપિતા દલપતરામ, સયાજીરાવ, દ્વારાનંદ, ગાંધીજી અને મીરાં, પ્રેમાનંદ, દ્વારામ, નર્મદ, ગોવર્ધનરામ, કાન્ત, કલાપી જેવા સર્જકોની મિતાકશી જીવનજરામર નહાનાલાલની રસભરપૂર શૈલીમાં જબોળાઈને અવનવા સ્વાદ-સુર્ગધ્યુક્ત બની છે. ભવ્યતાના પૂજક નહાનાલાલના હાથે કોઈ વસ્તુ અલ્ય રહેતી નથી. નહાનાલાલનાં ચિત્રિતોની ખૂબી એ છે કે તે સંસ્કૃતિના સમગ્ર સંદર્ભની વર્ચે ગુંથાઈને મોતી માફક ઝગમજી ઉઠે છે.

‘સાહિત્યમંથન’ અને ‘જગત-કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન’ નહાનાલાવ દ્વારા થયેલી સીધી જ સાહિત્યવિવેચના છે. સાહિત્યપદાર્થની ઊડી સૂજ અને કવિ, કવિતા કે છંદને સમજવા માટે નહાનાલાવ કેટલા મર્મગામી છે તેનાં તૃપ્તિકર દર્શન અહીં છે. ‘સરસ્વતીચંદ્રનું નહાનાલાવે કરેલું વિવેચન તો આપણા વિવેચનસાહિત્યનું એક મીઠું સંભારણું છે. કવિકુલગુરુ કાલિદાસને રવીન્દ્રનાથ મળ્યા તેનો ઈતિહાસ જાણે કે ઘરાંગણે મનીખી ગોવર્ધનરામને નહાનાલાવ મળ્યા એમાં દોહરાઈ છે !

‘ઉદ્ભોધન’, ‘સંબોધન’, ‘સંસારમંથન’ અને ‘અર્ધશતાબ્દીના અનુભવ બોલ’ જેવાં વ્યાખ્યાનો, નહાનાલાલના વ્યક્તિત્વને એક નવું જ પરિમાણ બસ્તે છે. વ્યાખ્યાન માટે નહાનાલાવે યોજેલી કે ઉદ્ગારેલી ગંધશૈલી ગુજરાતી ભાષાનો રોમાંચ છે. ધર્મવિચાર, ઈતિહાસનાં લક્ષણો કે સમાજહિતચિંતન – વગેરે સૌમાં નહાનાલાલની આર્પદણી અને અનોખી રજૂઆત એક અવનવ આલોક રચે છે ! સાંભળનારનાં હેયાં ભરી દેવાની ક્ષમતા આ વ્યાખ્યાનોમાં છે.

‘ગુજરાતની ભૂગોળા’ નહાનાલાલનું એક અનોયું નજરાણું છે. મહાસુદર્શનના આરા ભાજતો કવિ, બાળકો માટે સાવ સરળ ભાષામાં ભૂગોળ લખે તે હકીકત જ નહાનાલાલના વિચક્ષણ વ્યક્તિત્વની ધોતક છે. ‘બે હાથની વર્ચે શરીર, એમ મહી અને સાબરમતીની વર્ચે ખંભાત શહેર છે.’ / ‘કાળમીઠનો એ કાળો ખડક ખરેખર, કાળકાના સિંહસનને યોગ છે.’ / ‘માધવપુરથી દક્ષિણાદે પ્રાચી સુધીનો કંઠાળ, વાદળિયા દિયાની ચુંદીને મૂકેલી જાણે લીલી કોર હોય એવો હરિયાળો છે.’ – નહાનાલાવે જાણે ભૂગોળની કવિતા રચી છે.

ભગવદ્ ગીતા, મેઘદૂત, ખોડશા-ગ્રંથો, શિક્ષાપત્રી અને ઉપનિષત્પંચક નહાનાલાલના અનુવાદો છે. ગીતાની નાનકડી પ્રસ્તાવના, ‘મેઘદૂત’ માટે ‘રસમૂર્તિના સૌંદર્ય-મંદિરે મારી

કૂલપાંખડી’, ‘શકુન્તલાનું સંભારણું’ એક વધુ પાંખડી છે. ‘શિક્ષાપત્રી’માં કુટુમ્બધર્મની ઋજુતા અને ‘ખોડશા-ગ્રંથો’માં મધુરાભક્તિ તરફનો પક્ષપાત - નહાનાલાવ જાણે રસના, સૌંદર્યના, શાનના અને ધર્મના પૂજારી છે. નહાનાલાવ ભારતની આ ભવ્યતાની આરતી ઉત્તરતા જાણે થાક્તા જ નથી ! ઈતિહાસ કહે છે કે નહાનાલાલનો ઉદ્ય થયો એ મહાત્મિયાને ચાર પૈસાની ગુજરાતી ભાષા, ચાર લાખની સુવર્ણ-મુદ્રિકામાં ફેરવાઈ ગઈ !

## સંસ્કૃતિવિમર્શ સંદર્ભે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય | પ્રવીષ દરજી

: ૧ :

‘સંસ્કૃતિ’ શબ્દ સદા સદા માટે બહુપાર્થી રહ્યો છે. તેને વ્યાખ્યાવિત કરવાનું કામ દુધ્કર છે. સમાજ બદલાય છે, પરિસ્થિતિઓમાં પરિવર્તન આવે છે, વિભિન્ન વસ્તુઓ પ્રત્યેના વિભાવો કે દિશ્કિઓણ બદલાય છે એટલે સંસ્કૃતિમાં નવા નવા અર્થો ઉમેરતા જાય છે. તેનાં અર્ધઘટનો પણ એમ બદલાય છે. કહો કે મનુષ્યોત્તના સાથેનું તેનું સતત અને તીવ્ર અનુસંધાન રહ્યું છે. ક્યારેક આ સંશામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે એવું પણ લાગે કે કોઈ નિભિડ અરણું વર્ચે આવિને જાણે ઊભા ન હોઈએ ! વૃક્ષો, વનચાજી, તરુશ્રેષ્ઠોઓ, પગથીઓ, રસ્તાઓ એ સર્વની ગીયતામાંથી બહાર નિકળવું કે માર્જ ખોળવો મુશ્કેલ જણાય. પરંપરાઓ, રૂઢિઓ, બદલાતી ભાષા કે ભાષારૂપો, આપણી રૂચિ અને તેમાં આવતા બદલાવ, રીતરસમો, પ્રણાલીઓ, સામાજિક, ધાર્મિક માળખાં, કળા-વિજ્ઞાનની શોધો, શાસકીય અભિગમો, સત્તા અને તેની ખેંચતાણ, બે વિરોધી બળો કે ભાવનાઓ વર્ચેના સંધર્ષો, વિવિધ માનવજ્યો, તેમની વિભિન્ન પ્રકારની જીવનપદ્ધતિઓ, વિભિન્ન વ્યાવસાયિક જૂથો, સંસ્થાઓ, તેમના ઉપક્રમો, માનવે કરેલી શોધો, શાસ્ત્રો, તેમણે દર્શાવિલાં મૂલ્યો કે માર્ગો, ધર્મને નિભિતે આવિર્ભાવ પામેલી વિવિધ વિચારધારાઓ, ઈશ્વર, સમય, મૃત્યુ, અસ્તિત્વ જેવા સદા રહસ્યમય લાગ્યાં કરતાં તત્ત્વો અને તદન્વયે થયેલો વિમર્શ, શિક્ષણ, શાન, શાનની વિવિધ શાખાઓ અને તેમની ઉપલબ્ધિઓ, માણસની આ સર્વ વર્ચે શાશ્વત મૂલ્યોને સમજવા-પામવાની નિજ મથુરમણ, સાધના, સભ્ય સમાજની કે લોકપગથારે રહી જીવનારા ઘણાંની આ સર્વને સમયે શબ્દમાં મૂકવા મારેની પ્રબળ ઈશ્વરા, તે સંદર્ભે ચાલી આવતી સાહિત્યિક પરંપરાઓ, ઉત્તમ કૃતિઓ કે ઈતર કળાઓનું પ્રાગટ્ય, તેમાંથી જન્મેલા વાદો, માન્યતાઓ, માનંદો, આત્મા, ચિત્ત કે ડેહ સુધીની ચિંતનલીલાઓ, તેનું નિદિધ્યાસન – આવું આવું સંખ્યાતીત વાદ કરતા જ રહીએ અને છતાં બીજું ઘણું ઉમેરવાનું રહે એ સંઘળાના પિંડરૂપ સંસ્કૃતિ છે. આપણો કેવા હતા, કેવા છીએ તેના સંકેતો તો તેમાંથી મળી જ રહે પણ કેવા હોઈશું તેની રેખાઓ પણ તેમાંથી અવશ્ય જોળી શકાય. ભાષા અને સંસ્કૃતિ પરસ્પરને જે રીતે ગુંથતાં અને ઉકેલતાં રહ્યાં છે એ રીતે ઉભયનો પ્રાણપ્રદ સંબંધ છે. કોઈ પણ યુગનાં ભાષા-સાહિત્ય સંદર્ભે એ રીતે અભ્યાસીઓ સંસ્કૃતિ સુધી પોતાની તપાસ વિસ્તારી શકે. તેમ સંસ્કૃતિવિમર્શ સંદર્ભે કોઈ પણ ગાળાના સાહિત્યનું પણ નિરીક્ષણ-પરીક્ષણ થઈ શકે. ભાષા દ્વારા પ્રકટ થતી કૃતિ માત્ર ‘કૃતિ’ નથી હોતી. અનેક વસ્તુઓનો

સમવાય હોય છે. કહો કે એવી વિભિત્ત કૃતિના ગર્ભમાં અનેક ઓગળેલી, સંકેતો પ્રકટ કરતી કૃતિઓ પણ નિહિત હોય છે. તેથી સંસ્કૃતિના વ્યાપક પરિયોક્ષ્ય વચ્ચે મૂકીને કૃતિને જોવાનો અભિગમ કૃતિના નવા – અર્થ-દર્શન સમક્ષ મૂકી આપવામાં અનેકશ: ઉપકારક બની શકે તેમ છે. આજના આ સંદર્ભે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની તપાસ અનિવાર્ય બની છે, એવી તપાસ એટલી જ રસપ્રદ પણ બને તેમ છે. પ્રાંતીય ભાષા-વિચારના તાર ભારતીય સાહિત્ય કે ભારતીય સંસ્કૃતિ સાથે, તેના આગવાપણાને ટકાવીને, અનુસંધિત થતા જોવાય.

: ૨ :

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કાલખંડ સંદર્ભે એકથી વધુ મત રહ્યા છે. ભોગીલાલ સાંડેસરા ઈ. ૧૪૫૦થી ૧૮૫૦ સુધીનો ચાર શતાબ્દી સુધીનો જે સમય છે તેને વાસ્તવિક અર્થમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના યુગ તરીકે ઓળખાવે છે, તો અનંતરાય રચણ હેમયંડ (૧૦૮૮-૧૭૨)થી દયારામ (૧૭૭૭-૧૮૫૩) સુધીના સમયને મધ્યકાલીન સાહિત્યનો યુગ લેખે છે. અલભત, સમય અહીં ચર્ચાનો મુક્તી નથી. પણ મહત્વાનું હેમયંદી દયારામ સુધીના સમયપટ ઉપર ગુજરાતી સાહિત્ય કેવે કેવે રૂપે રચાતું રહ્યું, કેવી કેવી ધારાઓમાં એ પ્રકટતું રહ્યું, કેવાં કેવાં સ્વરૂપ (forms) કે પ્રકાર (genre)માં તે આગળ વધ્યું, તેવાં સ્વરૂપોની અનિવાર્યતા શામાંથી ઊભી થઈ, તે કાળનું Poetics કયું હતું અને સૌથી વધુ મહત્વાનું તો એવા સાહિત્યના જન્મની ભોંય કેવી હતી – કઈ હતી તે છે. તે સમયના આ સાહિત્યની ભાષાનું લક્ષ કે લક્ષ્ય શાં હતાં, કયા સ્તરેથી એ ભાષા ઊઠી રહી છે એ સધાર્યું પણ ધ્યાનમાં લેવા જેવું છે. આપણે જોઈ શકીએ છીએ કે પાણિની જેવા અઠગ વ્યાકરણની ભાષાગઠનની યુક્તિ-પ્રયુક્તિઓને ભેટીને, ગીર્વાણગિરા જેવાં વિશેષજ્ઞોને ઓંંગિને સંસ્કૃત ભાષા પોતાની રીતે, પેલા લોકને, તેના વિભિન્ન સમયના ભાષક અને એના જીવનસત્ત્વ સંસ્કારસત્ત્વને લઈને વિના રોકટોક પવટા લેતી લેતી આગળ વધી અને પ્રાકૃત, અપભંશ, શૌરસેની અપભંશ કે મારુ-ગુર્જર જેવા પડાવો પાર કરી, સત્તરમા શતકમાં, પ્રેમાનંદ સુધીમાં તે અર્વાચીન સમયને પરિચિત એવો, તેનો ચહેરો પ્રકટ કરે છે. ભાષા અને મનુષ્યચેતના પરસ્પરાશ્રિત રહી કેવાં કેવાં રૂપ ધારણ કરે છે, તે જાણવા કદાચ આ મધ્યયુગીન સાહિત્ય ઘણીબધી સામગ્રી સંપડાવી આપી શકે તેમ છે.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમય સમથળ રહ્યો નથી. અનેક ચઢાવ-ઉત્તરાનો એ કાળ છે. સાથે કંઈક અંશે એકથી વધુ સંસ્કૃતિના મુકાબલાનો ને સંઘર્ષનો પણ આ સમય છે. પ્રજા ઘાંધી થઈ જાય, હતીરીં બની જાય, કાચબાની જેમ સંકોચાઈ રહેવાનો જ લગભગ વિકલ્પ રહે તેવી રીતનું ત્યારનું જનજીવન હતું. એક તરફ તેની પાસે પોતાની પરંપરાઓ હતી, પ્રાચીન સાહિત્ય અને તેનું ભાવનાત્મક વિચ હતું, શ્રદ્ધાસ્થાનો હતાં, તો બીજી તરફ એ સર્વના પ્રણાશનો ઓથાર પણ હતો. અસ્તિત્વના ને નિજ ઓળખના પ્રશ્નો પણ હતા. લૂંટફાટ, ચોરી, ધાડ, વિધર્માંઓનાં આકમણો, પડોશી પ્રદેશોનો ને તેમના શાસનનો રંજાડ અને મુસ્લિમ શાસન, એ શાસન દરમ્યાન પ્રજાને તેમની કંઈરતાનો થતો અનુભવ, ધર્માન્તર, આ બધા પણ શારી નામે, બેબસ કરી મૂકે તેવા પ્રશ્નો પણ હતા. દુર્ભાગ્ય તો એ હતું કે આનો કશો અંત પણ દેખાતો નોટો. પ્રજાચેતના સામે પોતાની સંસ્કૃતિના

રક્ષણનો, સાથે પોતાને એ વિપરીત બળો વચ્ચે ટકાવી રાખવાનો કે ટકી રહેવાનો મુક્તો પણ રહ્યો હતો. બે સંસ્કૃતિઓના મુકાબલામાં બનતું આવ્યું છે તેમ, એક તરફ પ્રજા પોતાના સંરક્ષણ માટે કાં તો મુકાબલા માટે એકનિત થાય, પ્રતીકાર કરે અને એમ ન થાય તો સમન્વયનો કશો માર્ગ શોધી, કેટલાક કડવા ઘૂંટ ગળે ઉતારી દે. આત્મખોજ કરે, અન્યનું કશુંક સારું હોય તો અપનાવે, સમરસ થવાના પ્રયત્નો કરે.

મધ્યકાલીન ગુજરાતી ડાલ્યા માણસો સામે, કવિઓ સામે, આવું એક અસ્થિર, સંઘર્ષમય સાંસ્કૃતિક વાતાવરણ હતું. તેનો મુખ્ય હેતુ પ્રજાને નિજ-સ્થ કરવાની, ટકાવી રાખવાની, તેનાં સમાજ-સંસ્કૃત સાથે જોડી રાખવાની અને એ વચ્ચે ઘડી એક સુખનો અનુભવ કરાવી આપવાનો હતો. મધ્યકાલનું આખુંય સાહિત્ય એમની કૃતિગત વિશેષતાઓ સાથે મુખ્યત્વે પ્રજાજાગરણ, પ્રજાબોધ, સંસ્કાર-સંસ્કૃતિ-ધર્મ-જીવનબોધ તરફ મોં રાખીને જાયનું છે. આ દેશમાં ગોસાઈ મહારાજ તુલસીદાસજી અને સ્વામી રામદાસ જેવા રામભક્તિનો માર્ગ અપનાવી હિન્દુ સમાજને ટકાવી, કંઈક આકમકતા તરફ દોરે છે તો અન્ય સંતોષે આત્મદોષથી આત્મશોધ સુધીની માત્રા વડે પ્રજાના ચાસને નિયમિત રાખવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં પણ પ્રસંગોપાત્ર એવા ભારતીય વિચારકંપના પ્રભાવો જીવાતા રહ્યા છે. પ્રજાનું મુખ બને તેવો કવિ, આવા સંતો, ધર્મપુરુષો – ગુરુઓ – કથાકારો – ભજનિકોએ સર્વ પ્રજાસંસ્કાર – સંસ્કૃતિને પ્રરક્ષવા એમ શદ્દ તરફ વળે છે. અને એમ અનેક ધારા રૂપે મધ્યકાલીન સાહિત્ય મળતું શરૂ થાય છે. ગુજરાતી ભાષા-સાહિત્યનો આ સમય ઘણીબધી રીતે સંસ્કાર-સંસ્કૃતિની રીતે પણ વિમર્શાયોગ બની રહ્યો છે. મુનશી જેવા જીવનનું કચ્ચયાયુંનું તારણ કાઢી દુઃસહ અનુભવ કરતા જીવાય છે તો આનંદશક્ર દ્વિવ જેવા તત્કાલીન પ્રજાનો માત્ર ‘ધર્મની નાડી’માં જ ધબકાર બચ્યાનું કહે છે તો અન્યો ‘આનંદ’ અને ‘સંસારના રંગરાગ’નાં પણ દર્શન કરે છે. ગોવર્ધનરામ જેવાનું તારણ ખાસ ધ્યાન જેચે તેવું છે : ‘આ કવિઓ વિના ગુજરાતનું લોકજીવન રણ જેવું વેરાન અને શુષ્ણ બની જાત, ગુજરાત હફ્યની સચેનતા ખોઈ બેદું હોત. ગુજરાતી ભાષાને એમણે ઘરી, પળોટી, કેળવી, તેને ભાવક્ષમ, અર્થવાહી અને મધુર બનાવી એ સેવા તો જુદી.’

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નિતાંતપાણે, મેથ્યુ આર્નોફદના શબ્દોને સહેજ બિન્ન રીતે યાદ કરીને કહીએ તો, સંસ્કાર, સંસ્કૃત, પ્રજાચેતના, તેમના મર્મ-ધર્મ કહો કે, સમસ્ત જીવન પ્રવેશી ગયું હતું. ભાષા-ચેતના અને પ્રજાચેતનાનો આવો યુગપ્રદ આવિર્ભાવ કદાચ બીજે ભાગ્યે જ જોવા મળશે.

: ૩ :

સંસ્કૃતિવિમર્શ સંદર્ભે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સમગ્ર રૂપે તપાસ કરવાનું અહીં ભૂમિકારૂપ આ લેખમાં શક્ય ન બને તે સ્વાભાવિક છે. વળી એ ગાળામાં જે રીતે અનેક ધારાઓ – પ્રવાહો જોવા મળે છે તેનો પણ અહીં વિગતે પરિચય આપી શકાય નહિ. વિભિન્ન લેખકોના સમગ્ર અર્પણનો કે બધા જ ગૌણ કવિ-લેખકોનો પણ અહીં ખ્યાલ આપવો શક્ય નથી. અહીં સંસ્કૃતિવિમર્શ સંદર્ભ થોડાક સંકેતો પ્રસાર્ય છે, થોડુંક આચ્યમન કરાવવાનો આશય રહ્યો છે. આ સમયમાં લખનારાઓની સામે, અગાઉ ઉલ્લેખયું છે એમ આપદ ધર્મ રૂપે એમનો સમાજ રહ્યો છે, એ સમાજ સાથે સંકળાયેલી અનેક બાબતો પણ.

એ રીતે Social commitment સાથે તેઓ લગે છે, પણ એ Commitment પાછળ તેમનું Conviction હું એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એવા Convictionને વિવિધ સ્વરૂપે, વિવિધ ભાષાસત્રોમાં અભિવ્યક્ત કરવાની તેઓની સતત મથામણ દેખાય છે. એક તરફ એ બાબત તેને સંસ્કૃતિક – સામાજિક ક્ષેત્રનો કડખેડ બનાવે છે તો બીજી તરફ ભાષાનાં – વેખનનાં કેટલાંક સ્ફૂહશીય રૂપો પણ તેની પાસેથી મળે છે. પેંબું Conviction તેને વિભિન્ન સાહિત્યસ્વરૂપો પાસે પણ દોરી જાય છે. પોતાની રીતે કે સમાજનું એસ્થેટિક લઈને એ આગળ વધ્યો છે તેનાં દણ્ણાંતો પણ મેજર કવિઓમાંથી મળે. સુંદર ઘાટઘૂઠવાળી રચનાઓ પણ એકાધિક મળી આવે. પણ સમગ્ર રૂપે જે તારણ નીકળી આવતું જણાય છે તો Literature is Symptomatic of the State of its society એવી સમજનું જો.

‘સિદ્ધ-હૈમ પ્રાકૃત વ્યાકરણ’માં હેમચંદે ટંકેલા સંખ્યાબંધ દુહાઓ ઉપર નજર નાખતાં જગ્યાશે કે ગુજરાતીની આરંભકાળની એ પ્રસાદીમાં લોકસંસ્કૃતિનાં અનેક વાનાં પ્રકટયાં છે. વીરત્વની સાથે નારીચેતનાનાં ત્યાં લિલાયેલાં રૂપ પણ નોંધ લેવા યોગ્ય છે. રસ-મર્મયુક્ત અને સરળ દુહાઓની એ રીત આગળ ઉપર જતાં લોકસાહિત્યની વિશિષ્ટ સંપર્દા બની રહે છે. નરસિંહ પૂર્વના જૈન સાહિત્યમાં મળતા રાસ-ફાગુઓ વગેરેમાં કૃતિઉપસ્થમ વૈરાગ્ય કે આત્મબોધનો લગભગ હોય છે. બારમાસી-વિરહકાલ્યોમાં પણ અંતે ધર્મભિમુખતા જ હોય છે. કૃતિમાં આત્મબાનની સાથે સાથે સ્થળ-નગર અર્થાત્ ભૂ-ભાગનાં વર્ણનો આધ્યાત્મિક અને ભૌગોલિક પરંપરાઓને પ્રત્યક્ષણ કરી આપે છે. યુદ્ધનાં વર્ણનો અને તે પાછળનું ભારતીય મન પણ ચોક્કસ સંદર્ભે રચનાના એક બીજા ખૂલ્લા તરફ દોરી જતાં જણાય. ‘વસંતવિલાસ’ જેવી રસભરપૂર કૃતિનો અણાત, જૈનેતર કવિ, એક બીજે છેઠેથી વસંતના પરિસર વચ્ચે સૌ પ્રેમીઓને રસોત્સવ માટે નિમંત્રી રહે છે. આનંદ-ઉત્સવપ્રિય, કામ જેવા પુરુષાર્થને સત્કારનારું ઉત્કટ મન આપણી રસાનાંદ પરંપરાને ઘાટી કરી આપે છે. તો વસંતનું પંખી-પ્રકૃતિ સમેતનું સમગ્ર ચિત્રણ નાયક-નાયિકાને માટે ઉદ્ઘાપનરૂપ બનવા ઉપરાંત પ્રકૃતિ અને પર્યાવરણના મહિમાને પણ પરોક્ષ રૂપે દ્રબ્દે છે. ‘પૃથ્વીચંદ ચચિત્ર’ જેવી મહત્વની ગંધીકૃતિ ધર્મકથા બની જતી હોવા છતાં પૂર્વભવને આ ભવ સાથે જોડતું કોતુકરસિક કથાવસ્તુ, નગરવાર્ણન અને પ્રકૃતિના વર્ણનને લઈને જન્મ – પુનર્જન્મ, પ્રકૃતિ સાથેનો માનવીનો અભિન્ન સંબંધ વગેરે માન્યતાવો સાથે ભાવકને જોડી આપે છે.

: ૪ :

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે મહત્વનો સોત છે – ધર્મ, ધર્મની વિભિન્ન વિચારધારાઓ. તેને આગળ વધારનાર ધર્મગુરુઓ, સંપ્રદાયો, સંતો, ભજનિકો. જૈન પરંપરાની સાથે હોવે આવે છે ભક્તિપ્રશાલી. ભાગવત, વૈષ્ણવ ધર્મનો પ્રભાવ, વલ્લભાચાર્યનો જીવન પ્રત્યેનો અભિનવ દાસ્તિકોણ, સ્વામીનારાયણ સંપ્રદાય, શિવશક્તિ પૂજા, વેદાન્ત જે તેનો શાનમાર્ગ, વિવિધ કોમોમાંથી આવી રહેલા સંતો અને તેમની સરળ, હૃદયગાંધી વાણી, તેમની એકેશ્વરવાદીની સમન્વયાત્મક ભૂમિકા – કહો કે ગુજરાતના પ્રજાછીવનમાં ભક્તિના શાંત-સહજ વિવર્તો જગવે તેવી લહર ઉપર લહરો આવતી રહી. આહેસા-તપ-દાન-ક્ષમા જેવા સર્વધર્મમાન્ય એવા સંસ્કારોમાં વલ્લભાચાર્ય હોવે ઉમેરે છે

ઉત્સવપરંપરા, આનંદના ઓઘ, તો સ્વમીનારાયણ પંથના સ્થાપક સહજાનાંદ તેમાં ઉમેરી રહે છે. સાત્ત્વિક જીવનપદ્ધતિ અને આચારશુદ્ધિ; અને પેલા અનેક વર્ગમાંથી આવેલા નિર્મણ સંતો તેમના સાઢીપૂર્ણ, નિખાલસ અને અહમહિમિકાથી મુક્ત એવા વ્યક્તિત્વથી સહજતા ને સરળતાનો જાહુ વિસ્તારી રહે છે. આ સર્વની સાથે ચામાયણ-મહાભારત-ભાગવત ઉપરાંત પુરાણોનો પ્રભાવ તો હતો જ. મધ્યકાળ ઘણીબધી રીતે ભારતીય રસ-રહસ્યોથી અહીં બર્યો બર્યો બની રહે છે. ગુજરાતી પ્રજાના આંતરચૈતન્યનાં એ બધાં ધારક- બળો છે તો એ સમયના કવિઓ માટે એ સૌ અખૂટ સોત છે. ગોવર્ધનરામને યાદ કરીને કહીએ તો, ‘દરેક ગામે પોતાનો આછોપાતળો પણ કવિ નિપાતાબો. જેણે નાનકડો સ્થાનિક દીવડો બની લોકોનાં હૈયાને લીલાં રાખ્યાં. આ સૌએ વિષમ પરિસ્થિતિમાં સમાજને એક ડગલું આગળ લઈ જવાનું કામ કર્યું. નૈતિક બળ અને આચાસન આપ્યાં.’

પ્રેમલક્ષ્માભક્તિના કવિઓની જાહુ પેલા સંતોની વાણી જેવો જ પ્રભાવક રહ્યો. કૃષ્ણ-રાધા-ગોપી, તેમનો પ્રેમ, એ નિમિત્તે નાયક-નાયિકાની મનઃસ્થિતિ, ઈશ્વર અને ભક્ત વચ્ચેનો નાતો, પ્રારબ્ધ, કર્મ, આત્મબોધ, શ્રદ્ધા જેવાં તત્ત્વો અનેક સંસ્કાર-સંસ્કૃતિની લડીરો રૂપે કાવ્યમાં આવિર્ભાવ પામે છે. નરસિંહ – મીરાં – મુક્તાનાં – પ્રેમાનાં – બ્રહ્માનાં – દ્યારામ – દાસીજીવણ – રાજે જેવા સંખ્યાબંધ પ્રમુખ-ગૌણ કવિઓએ ગુજરાતનાં સ્વી-પુરુષને રાધા-કૃષ્ણ સમક્ષ ને એમ જીવનની લીલા સમક્ષ ખડાં કરી દીધાં. શુષ્ણ થતા જીવનનું નવા રૂપે પલ્લવન થતું જણાય છે. મૂળ નામ સાથેના છેદાઈ રહેલા સંબંધને પુનઃ સ્થાપિત કરી આપવાનું કાર્ય આ અને આવા અનેક સંત કવિઓ કરી આપે છે. નરસિંહે ભક્તિશ્રૂંગારનાં અને જ્ઞાનવૈરાયણનાં તેનાં પદોમાં એ સમયની ગુજરાતી કવિતાની દોચદ્વારા દર્શાવી છે. એનાં પદો અનેક રીતે મૌંદી જણાસ બન્યાં છે. તેનાં પ્રભાતિયાં-પદોના જૂલે ગુજરાત સતત જૂલતું રહ્યું છે. પ્રેમરસ’ની સાથે ‘તત્ત્વ’ને ગતી કવિતા અનેક વાર ઉપનિષદ્ધની ને અદ્વિતીત તત્ત્વદર્શનની સમીપ પહોંચે છે. તુલસીદાસજીની જેમ તેણે પણ જન્મ જનમ અવતાર માગીને ઈશ્વર સાથે ધરતી અને જીવનના મહિમાનો ઉત્કટપણે સ્વીકાર કર્યો છે. આધ્યાત્મિક રીતે દેહદશા ટળી ને ગોપી થવાનું કહેતો નરસિંહ પુરુષ પુરુષાર્થ લીન થયું જે સાખી રૂપે ગીત ગાવત તૈયાર થયો એવું કહે છે – ત્યાં ઈશ્વર-ભક્ત ઉપરાંત નારી-પુરુષ-જેન્ડરનો જ્યાલ બદલાય ત્યારે ભક્તિમાં પણ કેવાં સુખદ પરિણામો મળી રહે તે પણ અનુભવાય છે. આત્માતત્ત્વ ચીન્યો નહિની તેની વાત પણ આપણી તત્ત્વપરંપરા સાથેના અનુસંધાનની જ છે. મીરાં એ રસ્તે જ આગળ કૃષ્ણપેમની કવિતા રચે છે. તેણીએ કૃષ્ણને એક મનુષ્યની જેમ આપણી સામે ખડો કરી દીધો છે. તેનાં પદોમાં સમર્પણભાવની પરાકોટિ છે. એકએકથી ચિદ્યાત્માં પદો આપી તે ‘લોક’ હદ્ય સુધી પહોંચી છે. તેનામાં ઊંઘી આવેલા સમાજનું ચિત્ર તે કાળના અનેક વિષયરંગો જીવિને આચ્યુતું છે. દ્યારામ જેવા કવિઓ સાંપ્રદાયિકતાની સાથે નિર્મણ ભક્તિરસની ગરબીઓ દ્વારા પ્રેમલક્ષ્માભક્તિ ધારામાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. નરસિંહની જેમ તેણે પણ પૃથ્વી પ્રેમને પોતાની રીતે ‘પ્રજ વહાલું રે, વૈનું નહિ આવું, મને ન ગમે ચતુર્બૂજ થાવું’ એમ ગાયું છે. નાટ્યતત્ત્વસભર તેની ગરબીઓ ગુજરાતના નારીસંસ્કાર જીવનનું ઘરેણું બની છે. તેની ગરબીઓમાં કૃષ્ણ-ગોપીભક્તિ સાથે સમાજ પણ બિન્ન રૂપે, આવ્યો છે. જશોદાનું વાત્સલ્યભર્યુ માતૃત્વ તે

કાળની અનેક માત્રાઓને સ્પર્શી ગયું હોય. ‘અડ્ઝટવર્જિન’નું પ્રકૃતિવર્જન રાધાકૃષ્ણના વિરહની પડ્છે આસ્વાદ પરિવેશ રચી રહે છે. સુમાર વિનાનું તેનું લયવૈવિધ્ય નવસંગીત – નવલયના સંદર્ભ ચકાસવા જેવું છે. ગરબી સ્વરૂપને નૂતન રૂપે પ્રોજવામાં તેની subjectivityનો જ તકાજો હોય ને ?

: ૫ :

શાનમાર્ગી ધારામાં અનેક – બુટિયો, ભાગદાસ, પ્રીતમ, ધીરો, નિરંત જેવા – કવિઓનું – સ્મરણ થાય પણ અખાનું એ ધારામાં કંઈક વધુ મહત્વનું પ્રદાન રહ્યું છે. આપણો પ્રમુખ વેદાની કવિ એ જ. અંગત જીવનાનુભવોથી અને સમાજ સાથેના કેટવાક કટુ પ્રસંગોથી તે ત્રસ્ત હતો જ પણ સાથે તેનામાં પરમ તત્ત્વની ઓળખ માટે અંદરનો ધ્યાન થતો. આ બંને પર્યતે તેને વેદાન્ત તરફ વાળે છે. ‘અનુભવબિન્હુ’ અને ‘અંગીતા’માં તેની શોધનું શમન છે તો તેનો અભિનવ આનંદ પણ છે. છઘામાં તેનું સમાજચિકિત્સક તરીકેનું રૂપ ઉપરસ્યું છે. ‘ભાષાને શું વળ્ગે ભૂર’ કહેનાર અખાએ અહીં ભાષાને અનેક સ્તરેથી યોજી છે. ધર્મ, તદ્જન્ય અભાનતા વિચારજડતા, બાધ્યાચાર વગેરે ઉપર તેણે અહીં ઉગ્રતાથી કટાક્ષ કર્યા છે. છઘાનું સ્વરૂપ તેને આ માટે કંઈક વધુ અનુકૂળ પણ પડ્યું છે. સરળ, તળપદી, ધારદાર ભાષામાં સમાજની અનેક બદ્દીઓ, સંદર્ભ પ્રકટ્યાં છે. વેદાન્તનો તાર તેને આપણી મૂળ સંસ્કૃતિ સાથે જોડે છે તો તેની છઘામાંની પ્રખારકતા ઉગ્ર ચિકિત્સક તરીકેની, Turning point માટેની મથામજા કરતા કવિ તરીકેની ઓળખ આપી રહે છે. સમાજ સાથે પ્રગાઢ રૂપે સંકળાયેલી તેની છઘાની ભાષા અભ્યાસ માટે નવી દિશા સૂચ્યે છે. વેદાની રહીને અખાએ ભક્તિનો, તેના ભીના હદ્યનો પણ પરિચય કરાયો છે. તેની વેદાની કવિતામાં ભાર વર્તાતો નથી. તેની લોકોક્રિતઓમાં આપણા સમાજના પરંપરાગત ઘણા ઘ્યાલોનું બળકટ પ્રતિબિંબ છિલાયું છે. શિવ અને શક્તિના ભક્તિપ્રવાહમાં ભાવણ જેવાનું સ્મરણ કરી શકાય. એમ તો શામળનું ‘શિવપુરાણ’, વલ્લભના ગરબા, ભાગદાસની ગરબીઓ વગેરેનું પણ પ્રદાન રહ્યું છે. ભાવણે તેના આ પ્રકારના ‘શિવભીલીસંવાદ’ અથવા ‘સ્પતશતી’ જેવા અનુવાદમાં આ પરંપરાને આગળ જરૂર લંબાવી છે. પણ તેના કાદમ્બરીના અનુવાદમાં તેમજ રામના બાળપુરણનાં પદીમાં ગુજરાતનાં તે કાળનાં કેટલાંક સંવેદનોને નિજ રીતે પ્રકટ કર્યા છે જે સંસ્કૃતિવિમર્શ સંદર્ભ યાદ કરવાં જેવાં છે.

વૃત્તાંતકાલ્યોમાં સંસાર – પ્રકૃતિ – તેના વિશિષ્ટ સંદર્ભો – વિવિધ ભાવોને જાગ્રત કરવાનું કંઈક વિશેષ રૂપે અનુકૂળ પડે તેમ છે. ભાષા તેવા કવિઓમાં મહત્વની હોય તો પણ ભાવજગત જે રીતે આકારિત થાય છે તેનું એક જુદું મૂલ્ય રહ્યું છે. કટાક્ષ સંસ્કૃતિવિમર્શનો મુદ્રો આવાં વૃત્તાંતકાલ્યોના સંદર્ભ વધુ સારી રીતે ઉદ્ઘાટિત થઈ શકે. પ્રેમાનંદ જેવા મધ્યકાલીન સાહિત્યના વિશેષ નોંધ માર્ગી લેતા આખ્યાનકારનાં આખ્યાનો ચાસ-ભવાઈ કરતાં પણ વધુ નજીકથી જીવનદર્શન, ધર્મનીતિ, સંસ્કારદર્શન પણે મૂકી આપી શકે તેમ છે. પ્રેમાનંદ એક પ્રમુખ કવિનું તૌશલ પણ દાખવતો હોઈ ત્યાં વૃત્તાંતકથા વધુ અસરકારક બની આવિભાવ્ય પામે છે. ‘નણાખ્યાન’, ‘રણયજ્ઞ’, ‘સુદામાચરિત’, ‘ઓખાહરણ’, ‘મામેરુ’ વગેરે અનેક આખ્યાનો ગુજરાતના સંસ્કાર-સંસ્કૃતિને કળામય રીતે

પ્રકટાવે છે. જે ‘ગુજરાતીતા’થી અને વિવેચકોએ સતત નવાજ્યો છે એ ‘ગુજરાતીતા’ એક રીતે તો ગુજરાતનું સમગ્ર સંસ્કાર-જીવન, તેની રીતભાતો, પ્રણાલીઓ – પરંપરાઓને જ રૂપાન્તરે પ્રકટ કરે છે. પૌરાણિક કથાવાત્તનો તાર આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે એ ખરું, પણ પણી પાત્રોથી માંડી નિરૂપણ સુધીનાં અનેક વાનાંમાં તે કાળના મનુષ્યને ઘડી જીવતરમાં ઘડી એક સુખ મળે અને મૂળ સંસ્કાર સાથે તેનું અનુસંધાન થઈ રહે તે તેનું ઉદ્દિષ્ટ રહ્યું છે.

ઓખાની સાથે ગુજરાતની અનેક કન્યાઓની ઈચ્છાઓ જાગ્રત થતી રહી હોય ! રુક્મિણીની કૃષણના સમયસરના આગમનની ઉત્સુકતા અનેક કન્યાઓની ત્યારે ઉત્સુકતા બનતી આવી રહો ! ‘મામેરુ’નાં વડસાસુએ લખાવેલી પહેરામણી, નરસિંહની બાપ તરીકેની વિવશતા, સુદામાની વહેલ, સુદામાપત્તીનો અનુ લાવવા માટેનો તકાજો, કુન્તા – અભિમન્યુનો રખાપ્રસંગ, નળાખ્યાનમાં દમયંતી-સ્વયંવર વગેરે અનેક અનેક પ્રસંગો આપણા સંસ્કારકોષેને જાગ્રત કરીને ભારતીયતાના મૂળ સુધી લઈ જાય છે. ક્યારેક વિધિવિધાનોનાં રહસ્યોને પણ તે ઉદ્ઘાટિત કરી આપે છે. પ્રેમાનંદ સિવાયના અનેક ગૌણ કવિઓની આખ્યાનકૃતિઓનો, રાસ-પ્રબંધ વગેરે કથાધારિત કૃતિઓનો, સામાજિક સંદર્ભ અભ્યાસ કરી શકાય તેમ છે. નાકર, વિષ્ણુદાસ, વિચનાથ જાની વગેરે તે સંદર્ભો તરત યાદ આવે. સમાજનાં અનેક સ્તરો, તેમના વ્યવહાર અહીં નજર સામે આવી રહે છે.

પ્રેમાનંદ આખ્યાનને પારિમાર્જિત કરીને જિવાતા જીવની લગોલગ, માનવની સામે રહીને, માનવ અને તેના સમાજના અનેક કથારસોને વહેવડાવ્યા. ને એમ કંઈક ઉચ્ચ વર્ગની રૂપને સંતોષી, તો તેની સામે શામળ જેવા પદ્યવાત્કારે વાર્તાના માધ્યમ વડે તેની ફરતેના સમાજ-સંસારને જીવ્યો – એક ‘વાણિયાના કવિ’ તરીકે Popular cultureના સ્તરે રહીને. તેણે પહેલીવાર નારીના ચયપણ, બહુમુખી, સાહસોત્સુક વ્યક્તિત્વને વ્યાપક રૂપે આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું. ‘નર-નારીની ચાતુરી’, ‘ચિરિત્ર’, તેમનું ‘શૂરપણું અને શાશપત’ તેમજ ‘પરાકમ’ બધું આજના નારીવાદી વિવેચકોને પણ અમુક અંશો ઉત્તેજે એ રીતે પ્રકટ કર્યું. ‘જનમનરંજન’ની સાથે તેનો ઉદ્દેશ ‘અદ્ભુત’ ને ‘જનમાબાનું’ વર્જન પણ કરવાનો રહ્યો હતો. ‘મધનમોહના’ના આ વાર્તાકારે લોકપગથારે આવીને સાદી ભાષા-કરી-વાત-વિવેક-શિક્ષા કથાં છે. સંસ્કૃતિજીવન અભ્યાસમાં નીચ્યાલા વર્ગ માટેનું સાહિત્ય કેવું ઉપકારક બની શકે તે એની આ સાહસ-ચમત્કારભરપૂર વાતાંશો વાંચતાં સમજાય. વર્ગબેદ, વર્ગસંદર્ભ વચ્ચે આવી કૃતિઓ પેલા ‘જનમનરંજન’નું મોઢું કામ કરવાની સાથે તેવાઓની જીવનશ્રદ્ધા અને જીવનરસને પણ ટકાવી રાખે છે. પ્રેમાનંદ – શામળ જેવાની સાહિત્યસૂચિ વિવિધ પ્રકારના સંદર્ભોનો એ રીતે સોત બની છે. નય ઠિઠાસવાદીઓનો કૃતિવિભાવ અહીં જીવમાં લઈ શકાય.

આ સિવાયના મધ્યકાલીન અનેક સર્જકો અને તેમની કૃતિઓને સંસ્કૃતિ અંતર્ગત તપારી શકાય તેવી થોકબંધ સામગ્રી મળી શકે તેમ છે. પદ્માભાનો ‘કાન્છડદેપ્રબંધ’ ઐતિહાસિક તથાધારિત છે. ‘રણમલ્લ છંદ’ની જેમ આ કૃતિ અહીં હિન્દુમુસ્લિમ રાજ વચ્ચેનું વેર-ખરટાગ અને યુદ્ધમાં તેની પરિણાતિ તેમજ હિન્દુ રાજનો બહાદુરીભર્યો મુકાબલો – રાજપૂત જાતિને, તેમની વીરતાને, ધર્માભિમાન અને સ્વદેશભક્તિને અનેકશાં પ્રકટ કરી

આપે છે. વિરમદેવનું કપાયેલું તાસકમાંનું મસ્તક એકતરફી પ્રેમ કરતી પિરોજાની સામે અવળું ફરી જાય – એ કવિકલ્પના હોવા છતાં છેવટે તો મુસ્લિમ શાસકો સામેનો હિન્દુ રોષ જ પ્રકટ કરી રહે છે. ધીરાની રચનાઓનું લોકોને રહેલું આકર્ષણ કે વસ્તા જેવાની લોકલોકી માટેની પ્રતિક્ષિયાઓ તેમજ ભોજ ઉપરાંત કબીરપંથી અન્ય કવિઓ કે એવા અનેકોનેકે મધ્યકાળના સાહિત્યમાં તે કાળની પ્રજાના ખમીરને નાનાવિધ રૂપે ટકાવી રાખ્યું છે. સાહિત્ય સિવાયની ઠીર કળાઓમાં પણ એનો પ્રસાર થયેલો જોઈ શકાય.

મુખ્યત્વે ધર્મનો આશરો લઈને આગળ વધતા આખા યુગના આ સાહિત્યમાં એમ જીવનની અનેક ધારાઓ સમયે સમયે ઓછેવતે અંગે લિલાતી રહી છે. કદાચ આવા કવિ-સંતો-ધર્મચાર્યોએ જ હિન્દુ સમાજને અન્ય સંસ્કૃતિઓ સામે સથિત્યારો આપી, તેમનાં ધર્મ, સંસ્કાર અને આત્મા ઉપર અન્ય કોઈની હકૂમત સ્થપાવા દીધી નથી. પરલબ્બનું ભાથું તો અહીં બંધાવી આપવાનું ઉદ્દિષ્ટ હતું જ પણ તે સાથે આ કવિઓએ તેઓને જીવનના પ્રકૃતિશી મન:પ્રકૃતિ સુધીના પર્યાવરણ વચ્ચે ધબક્તા રાખ્યા છે. સંભવ છે કે આ દિવસનો અભ્યાસ સર્જકના ઉત્તરદાયિત્વ કે કાર્યનો નવો નક્શો પ્રસ્તુત કરી રહે. મધ્યકાલીન સાહિત્ય ખુદ આજે આપડી સંસ્કૃતિનો એક હિસ્સો બની ચૂક્યું છે ત્યારે એક બીજી રીતે પણ આપણે અને આજાનું આપણાં સાહિત્ય તે કાળના માનવસંધર્ષ – સંસ્કૃતિસંઘર્ષમાંથી તેમજ વિભિન્ન સાહિત્યસ્વરૂપો અને કેટલીક સંસ્કૃત કૃતિઓમાંથી ઘણું અંકે કરી શકે તેમ છે. મીરાં, દ્યારામનાં પદ્ધ-ગરબી-લય, પ્રેમાનંદની આખ્યાનરીતિ, અખાના છાયા, નરસિંહનાં પદો ને તેનો જૂલણા વગરે જરા જુદે રૂપે આપણે ત્યાં વિનિયોગ પામી રહ્યાં છે, એ વડે નવી સંવેદનાઓને કેટલાક સર્જકો અભિવ્યક્ત કરી રહ્યા છે – એ બાબતને શું કહીશું? શબ્દ-સંસ્કૃતિની નોળવેલ આવનાર સમયધારાને પણ પુષ્ટ કરવામાં ઉપકારક નીવડી શકે છે એવા કોઈ સત્ય રૂપે જ તેની નોંધ લઈશું ને?

ડ મ. સ. યુનિ., ગુજરાતી વિભાગ, વડોદરાના ઉપકમે યુ.જી.સી. ડી.આર.એસ. અન્વયે રાખીય પરિસંવાદમાં ૧૨-૧૨-૦૮ના રોજ આપેલું વ્યાખ્યાન.

### કવિતા

(૪૩) અક્ષરા : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : સંઘ.  
યોસેફ મેકવાન, ૨૦૦૮, નોશનલ બુક ટ્રસ્ટ, ન્યૂ હિલ્ડી,  
૨૨+૨૨૮, રૂ. ૮૫/- (૪૩૪) મધ્યમ પૃથ્વીર ધૂલિ : પ્રવીણ  
ગઢવી, ૨૦૦૮, ગુજર્ઝ ગ્રંથરતન કાયર્લય, અમદાવાદ,  
૧૦૧૧૪, રૂ. ૮૦/- (૪૩૫) તેજલિસોટ્ય ન્રાડ : કિશોરસિંહ  
સોલકી, ૨૦૦૮, ઈમેજ પબ્લિકેશન, મુંબઈ-અમદાવાદ, ૬૦,  
રૂ. ૫૦/-

### દર્શય-શ્રાવ્ય

### કેમ મકનજી ક્યાં ચાલ્યા ?

પ્રયોગ : ૨-૩-૦૮; એચ. કે. આદ્ર્સ પ્રેક્શાગાર]

પ્રા. જનક હ. દવે

ઘણુંખરું આજના દિવસ સુધી અમૃક લેખક એવા તોરમાં જીવે છે કે, “એ એકમાઝે નાટકનો સર્જક છે. તેનાં લાખાણના એક તસુ ભાગને બદલવાનો કે તેમાં ઘટતો ફેરફાર કરવાનો – પ્રેક્શકો સાથે પ્રબણ પ્રત્યાયના વિવિધ પાસાઓને પ્રસરાવનાર દિગ્દર્શકને કોઈ હક નથી. આવા અહેમના ગઢમાં પુરાઈ રહેલાઓએ જ રંગભૂમિની કુસેવા કરી છે. કારણ કે આવા મદમોહીયોનાં નાટકોને પછી કોઈ સ્પર્શશર્તું નથી હોતું.

યુરોપમાં પણ પેલા ‘જ્યુક ઓફ સેક્સે મેનેન્જન’ના પ્રવેશ સાથે દિગ્દર્શકની અનિવાર્યતા ઊભી થઈ. ભવેને પછી ‘પ્રકૃતિવાદ’ સાથે નાટ્યનિર્માણ આરંભાંનું હોય, પણ નાટ્યકારને અભિપ્રેત અર્થ અને વિભાવનાને તાદેશ સાક્ષાત્કાર કરવાનાર દિગ્દર્શક-સર્જક તરીકે પ્રસ્થાપિત થયો. આ પરંપરા આજ લગભગ ચાલુ જ છે.

ગુજરાતમાં અધ્યતન નાટકો લખનારાઓમાં મોખરેનું સ્થાન ધરાવનાર અગ્રગણ્ય કવિ કરતાં પણ વિશેરે કરી, ઉત્તમોત્તમ નાટ્યકાર તરીકેનું બિરુદ્ધ ધરાવનાર સર્વશ્રી સિતાંશુ યશશેન્દ્રની અન્ય કૃતિઓ કરતાં “કેમ મકનજી ક્યાં ચાલ્યા ?” કૃતિ આગવી-અનોખી છે.

૧૨૮૧. પાયક મકનજીને તેના જીવનની કથાને સાગરને ન ભેટનારી નદી જેવો સર્જ, નાટકની પાએ સર્જનહારનો સાચો બંદો બનાવ્યો છે. શરૂથી અન્ત પર્યાત સહદ્યોની મકનજી તરફ વહેતી રહે છે.

પહેલાં દર્શાવ્યા પ્રમાણે દિગ્દર્શક ઉપર્યુક્ત નાટકનું પુનઃ સર્જન કરે છે. નાટકના શ્રી પી. એસ. ચારીએ લેખકની વિભાવના અને તેના અર્થઘટનને ક્યાંય આંચ ધી નથી.

નરાસેહીથી લઈને સાહિત્યના અનેકનેક વહેણથી પૂર્ણત્યા લીંજાયેલ કવિ-નાટ્યકાર યશશેન્દ્ર કૃષણ-સુદામાનું દર્શન નરદમ માનવચ્છતાર દ્વારા કરાયું છે. નાટકનું વસ્તુવિધાન અને તેનો કમિક વિકાસ સાધવા લેખકે લોકનાટ્યનો આશરો લીધો છે. નાયક, છોકરો અને સમૂહનાં ગાન-નર્તન સાથે નાટકને રેસપ્રદ રીતે ઉદ્ઘાટિત કર્યું છે. વેશ રમવાની વાત દ્વારા પ્રેક્શકો સાથેનો સીધો સંપર્ક શરૂ થઈ જાય છે અને એ છેક સુધી પ્રેક્શકો પરનો કબજો જ્ઞાવી રાખે છે. કલાકારોને નાટકપણું ભજવાનું છે – કેવા પ્રકારનું નાટક અને કેવું તેનું પાત્રની પ્રસ્તાવના સાથે આપણી સમક્ષ ‘મકનજી’ નામધારીના જીવનનો ખેલ શરૂ થાય છે. કહો કે તેની કપરા ચઢાણવાળી યાત્રા. આ યાત્રિક મકનજી મૂળસંગ સત્તાણી (પણ સત્તાણીન) જીવન સાથે જોડાયેલ ઘટ સાથે ઘડાયેલ સુખદુઃખનાં સોપાનો સર કરવા મથે છે.

‘બન્દી શો’ની માફક આ નાટકમાં રંગનિર્દેશો વિપુલ પ્રમાણમાં છે, પણ તેની ખૂબી એ છે કે એ ‘નટ’ કે ‘નટો’નું ભાષાકર્મ – કિયાકર્મ બની રહે છે.

હુકમચંદ શેઠે મકનજી પાસેથી નાણાં પાછા મેળવવાના બહાને ઘરવખરીનાં પોટલાં બહાર ફેંકાવ્યાં ત્યાંથી જ નાટ્યાત્મક પરિસ્થિતિમાં મંડાણ થાય છે. નાટકના અન્ત પર્યાત્ત આ પોટલા જ અજભગજબનાં પ્રતીકો અને નાટકની ગતિવિધિના સંકેતો બની રહે છે. અજાણે અને ઓચિન્પાનો સંસાર શરૂ થઈ જાય છે મકનજીનો. હુકમચંદની ઉપજારેલી વાતે પૈસા ચૂકવી દેવાની ધમકી, તોડ કાઢવાની વાત ઘરમાં (ભાબી) બૈરી છોકરી રહે અને ઓરડાનાં તાળાની ‘ચાવી બે’. આ બે ચાવીઓ તો નાટકનાં રહસ્યપૂર્ણ પ્રતીકો છે – ‘એક ચાવી તારી ને બીજી બળિયાને હથ.’

બાળવયના મિત્ર ‘અમથાભાઈ’ની શોધ અને એ શોધના આટાપાટામાં અટવાયેલ મકનજી. પત્ની અમથાભાઈ નામને એક ગપ ગણે છે. અન્ય લોકો પણ ગપ ગણે છે. પણ મકનજીને મન તો એ એકાત્મકુપ છે. પત્ની દ્રાઘ, ચોખા, લોટ, મીઠું લઈ આવવા મકનજીને શેરને ત્યાં મોકલે છે. અહીંથી નાટક રહસ્યપૂર્ણ વળાંક લે છે. દીકરીએ ‘લટકણિયાનું ‘આસમાની મોતી’ લાવવા બાપને લટકણિયું આયું. એ પણ નાટકમાં બહોળા પ્રમાણમાં ફેલાયેલા પ્રતીકો પૈકીનું એક અગત્યનું અંગ બની રહે છે. આ સર્વમાં પોટલી અને પોટલીમાંના ‘પૌંચા’ – ‘તાંદુલ’ તો હાઈ છે આ નાટકનું.

સ્ત્રી મકનજીથી કંઠયો ગઈ છે. દીકરીને લટકણિયું આસમાની મોતી સાથે અનીહાલ જોઈએ. કરજ કરીને પણ હુકમચંદના દાદાનું ઘર મેળવવા ‘પત્ની આગ્રહ કરે છે – તાણું બે ચાવી. એક ચાવી શેડિયા પાસે તેનો ગર્ભિત અર્થ મકનજી સમજે છે પણ પત્નીને સમજાવવી મુશ્કેલ છે. નાટકારે પહેલા અંકને અંતે મકનજીનાં મુખે એકોકિત્ત દ્વારા, ‘દીકરીનું એરેંગ હમણાં ડેમ ન મળો ? ભૂખ ભાંગવા સૂકો રોટલો ડેમ ન મળો ? આવા કેટકેટલા પ્રશ્નો મનજી માનેલ અને જીવનના આધારરૂપ મિત્ર અમથાભાઈને પૂછી પોતાને જે પ્રાપ્ત કરવું છે એ માટે તેની તરફ પોતે આવી રહ્યો છે એવું ‘અહ્યાત’ મિત્રને સંબોધી ફરી રજાપાટ શરૂ કરી દે છે. ચિહ્નીના સરનામે પોળ, પોળને ઘરે ઘરે શોધે છે અમથાભાઈનું ઘર.

બીજા અંકમાં ‘ઉરફે’ નામધારી કહેવાતા લોકનેતાનું આગમન મતદારોને મળવાને બહાને. વાણી-વચનોથી થાકેલાઓ, દરિદ્રનારાયણો દૂર ભાગે છે. પણ નેતાઓ તો પહોંચેલી માયા, મતદારોને ભોળવવામાં વાર શી ! શાતિ, જાતિ, મંડળો, વ્યક્તિઓને હજારો રૂપિયે ખરીદી લીધા. લોકોમાં પરિચિત બનેલ મકનજી પોતાની વિરુદ્ધ હોવાને જ્યાબે તે મળતિયાઓને મકનજીની પાછળ પડવા કહે છે. કારણ કે વાંજણી કલ્યાન અને રેતીમાંથી તેલ કાઢવાનાં સ્વનાં સેવનારને હાથો, પ્યાહું બનાવવાનો છે.

બાગાંશી, કક્કાના અક્ષરો દ્વારા નેતાઓનું નામકરણ, મતનો પ્રચાર વર્ષોથી થતી લોકોન્નિત, વિકાસ, વૃદ્ધિની ઠંગારી વાતો. આ દ્વારા લેખકે રાજકારણ, અપરાધીકરણના અટપટા નેતાઓના ભેલોને અહીં પ્રયોજ્યા છે. ઉરફે હરીફ ઉમેદવાર ગોરધનને સામ, દામ, દંડ, ભેદથી મહાત્મ કરવાના પેંતરા, ખડ્યંત્ર રચી મેદાને પડે છે ઉરફે મકનજીને એ (ઉરફે) ગામ નાથમથીના મંદિરે અમથાભાઈને મળવાનું કહેણ મોકલાવે છે. મકનજીનો સામાન રેમાં શું વગેરે. અને બિસ્તર આદિમાં કપડાં ભેગી સો સોની નોટોની થખી અને પોટલામાં સોનાની લગડીઓ અને ઉપર પાથરવાના ‘પૌંચા’ એટલે કે મકનજીનાં ‘તાંદુલ’. મકનજીનાં પત્નીએ

અમથાભાઈને મળવા કરેલ અર્જન્ન તારની વિગત. અને કરસન અને ભીમાને પોતાનો ઝોટો એટલે કે અમથાભાઈનો ઝોટો છે એવું સમજાવી મકનજીને દેખાડવાનો, પણ આપવાનો નહીં તેવા સૂચન સાથે ચમચાઓને રવાના કરે છે.

બીજી તરફ ગોરધનની રાજરમત ઉરફેને પાડવા આકાશપાતળ એક કરી, ખૂનામરકી, મારામારી કરીને પણ ઉરફેને હરાવવાની ગંધી રાજરમત રમાઈ રહી છે. દુશ્મન ઉમેદવારનાં વાહનો પર ઘાંસ લઈ જવાની યોજના. પૂછુતાછ કરતાં આવા સંજોગોમાં ભટકતા ભટકતા મકનજીનું ગોરધનના માણસોને મળવું. મારામારી વચ્ચે તેનું સંતાવું ને બચવું. પોતાના હાથે જ ખતમ થયેલાઓને શહીદ ગણી તેઓના નિવાંંજલી પત્રો પણ તૈયાર. આપરાધીકરણ અને રાજકારણ સોણે કણાએ ખીંચું અહીં ચુંટણીના મેદાનમાં.

આગળના તથક્કે ચિહ્ની સાથે મકનજીનો પ્રવેશ. ઉરફેને – અર્થત્ત અમથાભાઈને જીવનનો આધાર, ભેરૂ ગણી ભેટે છે. ઉરફે તો ઓળઘોળ થઈ જાય છે તેના પર. વહાલનો વરસાદ વરસાવે છે મકનજી પર, પણ તેમાંથી દાડાનાર ઓસિડ વરસે છે, એ ભલોભોળો મકનજી નથી સમજોતો ઉરફે તો રાજરમત મુજબ પાસાઓ નાખે રાખે છે. ઉરફે : ભાબીએ મિથાન કે કંઈક...? મકનજીની તાંદુલ ન આપવાની આનાકાની. પોટલું આપવાની તૈયારી પણ આ તો ઉરફેનો રાજકારણી ફાંસલો, ફસાબ્યો મકનજીને તેમાં. પોટલું, ટ્રેકને ખુલ્લાં કરાયાં. નોટો અને લગડીઓ સોનાની. આ સઘણું મતદારોને વહેચવાનું છે. ‘આમાં મારું કંઈ નથી, હું કશું નથી જાણતો મને મુક્ત કરો, જવા દો.’’ પણ હવે મકનજી આ ફસામણીમાંથી મુક્ત થઈ શકે તેમ નથી. બાજુના ઓરડે નજર મકનજી ઉરફેને ઉઘાડા પાડવાં, રોખ, પ્રકોપ પ્રગટ કરે છે. પણ હવે સંકાજામાંથી છૂટી શકે તેમ નથી. ઉરફે અને તેના માણસો, ‘‘ઉરફે એટલે ‘અમથાભાઈ’ છે એવું સ્વીકારવા જોરજુલમ કરે છે. મકનજી ઉરફેની અસલિયત જાણી જતાં ઉરફેને અમથાભાઈ તરીકે સ્વીકારવાની ના પાડે છે. ઉરફેને અમથાભાઈ તરીકે ‘હા’ પડાવવાનાં આકમણ સાથે, નાટ્યાત્મક પરાકાણાએ બીજો અંક પૂરો થાય છે.

મકનજીને યાત્રાનો આખરી પડાવ નજીકમાં હોવાની શ્રદ્ધા છે. એટલે ફરી સાચા એક આત્મીય જીવનના આધાર સમ અમથાભાઈને શોધ ચાલુ રાખે છે. એવામાં એક વુદ્ધ રસ્તામાં મળે છે, એનો ભત્રીજો નાટકંપનીમાં જોડાયેલ છે, તેની શોધમાં નીકળ્યો છે. બંને કંપનીનું સરનામું શોધે છે. નાટી રાધિકાનું ગાન. કામ નામની ચર્ચા. દિંગદર્શક મકનજીને ઉરફેના મિત્ર તરીકે ઓળખે છે. મકનજા મનમાં તો અમથાભાઈને મળવાની અધીરાઈ છે. વાવડ મહ્યા છે કે અમથાભાઈ કચ્છના રણની પેલે પાર, ક્યાંક સ્લિંધ, રાજસ્થાનમાં ‘સુંદરગઢ’ નામના ગામમાં છે. રાધિકા, ‘‘પ્રેમ પદારથની ઘવાયેલાનું ગીત ગાય છે. છેલ્લી પંક્તિ – પિયુછ મારો પાપી સાવ ખાલી. પિયાલી મને આપી.’’ મકનજીના જીવનનો ઘાલો ખાલીખમ છે. મનમાં દીકરીના આસમાની મોતીની વાત ઘોળાયા કરે છે. જીવનની નિરર્થકતા, કયાંય જવાનો અર્થ નથી જોતો મકનજી. ઘરની ચાવી ફરી એક અદું પ્રતીક બને છે. અનંતકાળના ઘરમાં વસવા એ આખરી ઘરની ચાવીરૂપ ગોળીઓ ગળવા... ત્યાં તો દિંગદર્શક અટકાવે છે. સ્વાનિલ મકનજીને ‘‘જાગવાનું સાચી સવારનું સ્વાનું જોવું છે. કાળી રાતમાં ઘેરાયેલાને આકાશમાં રાતું પરોઢ નિરખવું છે.’’ સુંદરગઢના વાવડ મકનજીને મળ્યા છે. પણ એ ક્યાં !

પાકિસ્તાનમાં કે ભારતમાં ? – સત્યની શોધ કરતાં દાવલપીર જેવા મકનને સરહદના સીમાડા કયાં નડવાના ?

“મકનના ઘરેથી લાવેલા ‘તાંદુલ’ નાથમદીમાં લોહીભીનાં થઈ વીખરાઈ ગયા.” લાકડીમાં પગરખાં લટકાવી ગીત ગણગણતા મકનજી મંજીલ તરફ પ્રયાણ કરે છે, બાલસખા અમથાભાઈને મળવા. અંતરનો અવાજ તેને તાંદુલ ખાઈ જઈને પાછો ફરવા કહે છે. આંધી ને તોઝન તપતું રણ તપતો મકનજી. પણ અમથામાઈને એક વખત જોવા, જાંખી કરવાની જિજીવિષા તેને છોડતી નથી. મકનજી અવાજને દૂબી જવા આથમી જવાનું કહી, પોતે આગળ ધપવાનો મક્કમ નિરધાર કરે છે. થાકેલા ત્રસ્ત, લથડતા, તરસથી ત્રસ્ત મકનજીને આગળ જતાં ગોવણ મળે છે. રણા વાવ, કોડો બંધાવી વગેરે વાર્તાવાપ. ચાલતાં ચાલતાં પહોંચ્યા મકનજી પોતાને ગામ શેઠ સેવકલાલ, સુમન તેની આગતાસ્વાગતા કરવા અધીરા બન્યા છે. મકનજી ‘ઘર’ જોતાં ભૂતકાળમાં સરી જાય છે. મકનજી મૂળના ઘરનું વાળન કરતાં, એ સ્થાને જુએ છે એક ‘હેવેલી !’ આ કોની હેવેલી ! વહુ (બહાર આવી) આ તો તમારી હેવેલી. અરબસ્તાન જઈ કરોડો રૂલી, તાર કરી ગુરુવારે સાંજે તમારો માણસ મોકલી હેવેલી ખરીદેલી તે ભૂલી ગયા ? મકનજી શૂન્યમનસ્ક. મકનજીને બ્રમિત અવસ્થામાં જોઈ વહુ એમ્બ્યુલન્સ મગાવવા કોન કરવા જાય છે. દીકરી : મારા માટે શું લાભ્યા ? મકનજી : હું સાવ ખાલી હાથે આવ્યો હું. દીકરી : નારે, તમેતો ‘લટકણિયું’ બસરાથી આણી મારા રૂમાં મોકલી દીધું છે – કેટકલાં એરિંગ, બંગડીઓ, મોતી. મકનજી : બસરાનાં મોતી, એરીંગ ! વળી પાછો અવાજ – અંતરાત્મા તેને ઢંઢોળે છે. – અવાજ : પોતાના હકના ‘તાંદુલ’, કોઈ અઝીણિયા ખ્યાલ માટે રાખી મૂકવાને બદલે જે જાતે જ ખાય છે, એ જ ઘડીએ થાય છે ઈતિહાસના ચ્યામ્પકાર, ભગવાનના નહીં હોં મકનજી ! ‘નરદમ માણસના ચ્યામ્પકાર.’ મકનજી : ઉરકે સાહેબે કર્યું હશે બદલા રૂપે, આ કામ. મકન : હું અરબસ્તાનમાં વેપાર કરી રણ્યો એવું લોકો માને છે. દિંગદર્શક : અમથાભાઈએ ના કર્યું હોય, પ્રત્યક્ષ મળ્યા વગર ? મકન : “હે તમે બને બે નહીં પણ એક જ છો.” આ બને ચાવી મારે હાથ. ને હું મારા અમથાભાઈ તારે હાથ.

નાયક દ્વારા, “હજુ એનું નામ મકનજી” ગાનનું પુનરાવર્તન લેખકે મકનજીની લાંબી ખેપનો થાક ઉતારી હેવેલીમાં ત્રણેને ઉત્તમ કીમતી પહેરવેશમાં ઉદ્ઘાનમાં ચાંબિસ્કિટ ખાતા દેખાડ્યા છે. અને નાટ્યાન્તે મકનજીને પ્રેક્ષકોનું અભિવાદન કરતા રંગમંચ મધ્યે રાખી, મકનજીની કારૂણિકાને સુખાન્ત નાટ્યસ્વરૂપ આણ્યું લેખકે.

ભવાઈના નાયક, દિંગદર્શક અને અન્ય સમૂહ – કોરસરૂપ પાત્રો દ્વારા નાટકનાં દશ્યોનું દશ્યાત્મક સંકલન લયસંવાહિતા અને ગતિક્રિયા સાથે, રસપ્રદ નાટ્યાત્મક પરિસ્થિતિ સર્જનાર તેમજ ઉત્સુકતા અને ઉત્તેજના પેદા કરનાર બની રહે છે.

સન્નિવેશ = (દશ્યબંધની કોઈ ભાંજગડ નહીં)  $4 \times$  તની ફેમો જડ રંગમંચ પર ખોડેલી નહીં, પણ હરતી-ફરતી, એ દ્વારા નગર, પોળ, ઘર, સ્થળ, સ્થાન અને ધંધારોજગારની બજારો અને તેમાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલાઓની મૂક અભિનયનયુક્ત શારીરિક ક્રિયાઓ દ્વારા ઊભું થતું વાતાવરણ નાટકને દશ્યાત્મક અને અર્થપૂર્ણ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ ફેમોને ઊચ્ચકારની ગતિ દ્વારા અપાતા અલગ

આકારો ફરતા રંગમંચની અવેજી પૂરી પાડે છે. સંગીત – ગીતો આ નાટકનાં પ્રાણરૂપ છે. નાટકને અવિરત જીવંત રાખનાર ચાસ છે, તેના વગર કેવળ કથાવસ્તુવાળું નાટક ફીસસું બિનાસરકારક બની રહેવાની ભીતિ અસ્થાને નથી. લેખકની ગીતરચનાઓમાં “અભિધા, લક્ષ્ણા અને વંજના સમન્વિત રીતે રાસ રે છે અને એ જ નાટકને ધબકતું રાખે છે.” નટ, ગાયક, દિંગદર્શક શ્રી નિમેષ દેસાઈની બંદીશ, તેની તરફે કેવળ શ્રાવ્ય સ્વરૂપે ન રહેતાં, પ્રેક્ષકોના હંદને સ્પર્શી જાય છે. ‘નામોના પાડનાર’ ગીતનું પુનરાવર્તન તેમજ જે તે દશ્યોને ઉપસાવનાર ગીતો વખતે લોકો જૂમી ઊઠવા સાથે ખુદ ગાવા પણ માંડેવા. વ્યવસાયી રંગભૂમિમાં ગીતોની બોલબાલા હતી એવા સંજોગો નવી રંગભૂમિમાં પણ સર્જવાનાં ચિલો દેખાય છે, શ્રી યશચન્દ્રની ગીતરચનાઓ પદી.

આ નાટક સમૂહગત રીતે રજુ થત્યાં પાત્રોવાળું બની રહેતું હોઈ વક્તિગત પાત્રોને વિશીષ્ટ ગણનારૂપ દર્શાવવામાં સમગ્ર નાટકને અન્યાય થાય તેમ છે. પ્રત્યેક નાનાં-મોટાં પાત્રોએ પોતાના ભાવોની અભિવ્યક્તિ સુપેરે નિભાવી છે.

જગતમાં આજ પર્યન્ત સત્યની શોધ કરનાર અને એ દ્વારા સમાચિના તારણથાર બનનારાઓને – અસત્યનાં અનિષ્ટ તત્ત્વોએ મહાત કર્યા છે – મોતને ઘાટ ઉત્તાર્યા છે. જિસસ, સોકેટીસ, અભાહમ લિંકન, મહાત્મા ગાંધી કે અન્ય મહાન વિભૂતિઓને ધર્મ, સુરાજ્ય સમાજને નવો માર્ગ સત્યનો પથ બતાવવા જતાં શા હાલ થયા છે આજ પર્યન્ત એ સૌને સુવિદિત છે.

મકનજી સત્યમંદિત, સાચુકલા, સહદ્યી, હિલોજાન મિત્ર ‘અમથાભાઈ’ની શોધમાં બરબાદી નોતરે છે – પોતાની અને પરિવારની. આખરે કોઈ ‘અપ્રત્યક્ષ બળ’ તેને ઉગારી દે છે.

સામાન્ય રીતે આપણો પ્રેક્ષકવર્ગ કેવળ મનોરંજનીય નાટકો જોવા ટેવાયેલ છે. પ્રસ્તુત થયેલું નાટક પણ ભારોભાર મનોરંજન પૂરું પાડે છે. પણ હસાવવા સાથે આઘાત પહોંચાડનાર આંતરપ્રવાહ જો પ્રેક્ષકોને ન સ્પર્શો તો નાટક ફારસરૂપ બની જવાની ભીતિ રહે.

વ્યવસાયી રંગભૂમિના કલાકારોએ, દિંગદર્શકોએ આ નાટકને ધંધાદરી પ્રસ્તુતિની એરેણ પર ચાડાવી. તેમાં રહેવા હીરને પારખવા પ્રયત્ન કરવો જોઈએ. આ નાટક આજનું, આવતીકાલનું અને પણીના કાળનું બની રહે તેમ છે. જો ભજવનારામાં દસ્તિ, પ્રતિબદ્ધતા સાથે આંતરસૂઝ કેળવાયેલી હોય તો સફળતા અચૂક તેને આવી વરશે. આ નાટકના દિંગદર્શક શ્રી ચારીએ આવા ગુણો સાથે પોતાની જાતને પુરવાર કરી છે. અભિનંદન, અભિનંદન, અભિનંદન.

‘ત્રિવેણી’ (વડોદરાસ્થિત સંસ્થા) દ્વારા આજ પર્યન્તના અનેક સફળ નિર્માણોની હોળણમાં આ નાટકે પણ પોતાનું યોગ્ય સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. સંગીત નાટક અકાદમીનો સાથ અને પર્ફોર્મિંગ આર્ટ સેન્ટરના નાટ્ય, સંગીત, નૃત્ય વિભાગના સહકારથી આ નાટક લોકલોગ બની શક્યું છે.

પદ્મશ્રીનું બિરુદ્ધ પામનાર સાક્ષર શ્રી ભોળાભાઈ પટેલનું સંમાન નાટકની રજૂઆત દ્વારા કરી સંસ્થાએ એક નવો ચીલો ચાર્ટર્યો છે.

આવું આંદોલન જગાડવાની અત્યારે જરૂર પડી છે. કારણ કે દિવસે દિવસે ગુજરાતી માધ્યમની શાળાઓ ઘટ્ટી જાય છે અને અંગેજ માધ્યમની વધતી જાય છે. આમેય આપણા વિદ્યાર્થીઓનું ગુજરાતી નબળું જ રહ્યું છે, તેની ફરિયાદો ચાલુ છે, ને તે વધતી જાય છે. અંગેજ માધ્યમથી ગુજરાતી ઘણું જ નબળું પડી ગયું છે. તેના દાખલા ઘેર ઘેર જોવા મળે છે. જો આમ જ ચાચ્યા કરે તો ગુજરાતી ભાષા ખતમ થઈ જાય અથવા મિશ્રભાષા બને તેના અણસારા દેખાઈ રહ્યા છે.

દેશમાં અંગેજ શિક્ષણ શરૂ થયું ત્યારથી જ અંગેજ શબ્દોનો પ્રવેશ શરૂ થઈ ગયો હતો. કેટલાક ભાષાપ્રેમીઓને આ ગમતું નહોંતું, તેનું પણ આંદોલન ચાલેલું છે અને ગુજરાતી બોલતી-લખતી વખતે ગુજરાતી શબ્દો જ વાપરવા, ફેશન ખાતર અંગેજ શબ્દો ન વાપરવા, જેનો પર્યાય ન હોય તેટા જ અંગેજ શબ્દો સ્વીકારવા, આવો આગ્રહ ભાષાપ્રેમીઓ રાખતા હતા. પણ તેનાથી ગુજરાતીનું રક્ષણ થયું નહીં ને અંગેજ શબ્દોનો પ્રવેશ ચાલુ જ રહ્યો.

અંગેજ શબ્દોની સૂર્ગ પ્રત્યે કટાક્ષો થતા રહ્યા. સૌથી મોટો કટાક્ષ રમણભાઈ નીલકંઠ ‘ભર્દભર્દ’ લખીને કર્યો.

અંગેજ ભાષાના પ્રભાવમાંથી ગુજરાતીને ભચાવવાના પ્રયત્નો સતત ચાલતા રહ્યા છે, પરંતુ તેનું પરિણામ દેખાતું નથી. ગુજરાતી ભયજનક સ્થિતિમાં મૂકાઈ છે ને તેના લીધી ‘ગુજરાતી ભચાવો’ આંદોલન જગાડવું પડ્યું છે. તથા ‘માતૃભાષા-વંદના યાત્રા’ તથા ‘વાંચે ગુજરાત’ તેને ભચાવવાના પ્રયત્ન રૂપે છે.

હવે વાસ્તવિક સ્થિતિ જોઈએ અને માણસના અંકુશમાં ન હોય તેનાં પરિવર્તનનાં કુદરતી પરિબળો પણ જોઈશું.

પ્રેમાંદે ગુજરાતી ભાષાનો વિકાસ કરવા અને તેની સમૃદ્ધિ વધારવા પાંડી નહીં પહેરવાની પ્રતિક્ષા લીધી હતી. નર્મદ પણ ગુજરાતીની સમૃદ્ધિ વધારવા ઝૂલ્યો હતો અને ઉમાશકર જોખીએ પણ ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ વાણું કાચ્ય રચી માતૃભાષાનું ગૌરવ વધાર્યું હતું. બીજા અનેક લેખકોએ ગુજરાતીનું ગૌરવ વધારવા ઘણા ઘણા પ્રયત્નો કર્યા છે. ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સ્વ. મગનભાઈ દેસાઈએ શિક્ષણમાં ‘ગુજરાતી માધ્યમ’નું આંદોલન ચલાયું હતું. તે આગળ જતાં ‘પછાત’માં ખાયું અને ‘મગનમાધ્યમ’ તરીકે કટાક્ષનો વિષય બન્યું.

ગુજરાતી માધ્યમના કારણે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ નબળા અંગેજને કારણે રાખ્યે સ્વર્ધમાં પાછા પડે છે તેવી ફરિયાદો થવા માંડી અને વધતી જ ગઈ. આ એક વાસ્તવિકતા હતી અને તેમાં સર્ચાઈ હતી એટલે ‘ગુજરાતી માધ્યમ’નો આગ્રહ છોડી દેવામાં આવ્યો. અંગેજ માધ્યમનો સ્વૈચ્છિક સ્વીકાર કરવામાં આવ્યો. ત્યારથી અંગેજ માધ્યમની શાળાઓ વધતી ચાલી છે અને ગુજરાતી ભયમાં મૂકાઈ છે.

હવે સવાલ એ આવે છે કે ગુજરાતીને અંગેજના આ ‘આકમણ’માંથી બચાવી શકાશે? સ્પષ્ટ જવાબ છે, ના. અહીં આકમણ શબ્દ અવતરણ ચિહ્નોમાં મૂક્યો છે એટલે વાસ્તવમાં તે આકમણ છે જ નહીં. આકમણ ત્યારે જ હકેવાય કે મારી મારીને બળ જબરીથી ફરજ પાડવામાં આવે. અંગેજની બળજબરી કોઈ કરતું નથી. લોકો પોતાની મેળે, રણખુશીથી, સ્વેચ્છાએ અંગેજને અપનાવી રહ્યા છે એટલે આકમણને બદલે ‘સ્વીકાર’ શબ્દ વાપરવો જોએ. આ સ્વીકારના કારણે અસંખ્ય અંગેજ શબ્દોના પ્રવેશથી ગુજરાતીનું સ્વરૂપ મિશ્રભાષા જેવું થતું જાય છે કટાક્ષમાં તો ‘ગુજરેજ’ નામ પણ અસ્તિત્વમાં આવી ગયું છે.

ભાષામિશ્રણો અને ભાષા પરિવર્તનની પ્રક્રિયાને ઐતિહાસિક સંદર્ભમાં તો જણાશે કે ‘ગુજરાતી’ એ કોઈ સ્વતંત્ર ભાષા છે જ નહીં.

પ્રાચીન સમયમાં એટલે કે આજથી લગભગ ૫ હજાર વર્ષ પૂર્વે ભારતમાં આર્યોનું શાસન હતું. આર્યોની માતૃભાષા સંસ્કૃત હતી અને રાજવહીવટની ભાષા સંસ્કૃત હતી. તે સમયે ભારતમાં વિવિધ અનાર્ય જાતિઓ પણ હતી અને તેમની જુદી જુદી બોલીઓ હતી. આર્યોના શાસનકાળ દરમિયાન લગ્નસંબંધો વગેરે દ્વારા આર્ય-અનાર્યનાં જાતિમિશ્રણો થયાં તેની સાથે આર્યોની, સંસ્કૃત અને અનાર્યોની લોકબોલીઓનાં ભાષામિશ્રણો થયાં અને તેમાંથી એક મિશ્રભાષારૂપ ‘પ્રાકૃત’ ઓવા નામે અસ્તિત્વમાં આવ્યું, તેમાં સંસ્કૃત અને લોકબોલીઓના શબ્દોનું મિશ્રણ છે. આ મિશ્રભાષારૂપનું જ મળતી હતી અને બુર્દે પોતાના લિપીઓને આખા અને સેનાં ગ્રહે આ મિશ્રભાષારૂપમાં જ થયા આ મિશ્ર ભાષારૂપ જ તે સમયની દેશની જનવાણી હતું.

આ મિશ્ર ભાષા સ્વરૂપ આગળ જતાં બદલાયું અને તે ‘અપભંશ’ નામ પાયું. જૈનમુનિ હેમસંદાચાર્યસૂસ્ત્રના સુવિષ્ણાત વ્યાકરણથ્રે ‘શબ્દાનુશાસન’માં વ્યાકરણના નિયમોનાં દણાન્તો તરીકે જે દૂંહાઓ આવે છે તે અપભંશ ભાષામાં છે. આ અપભંશ ભાષા આગળ જતાં બદલાઈ, નરસિંહ મહેતાના સમયમાં ‘જૂની ગુજરાતી’નું સ્વરૂપ પામી, પ્રેમાંદના સમયમાં ‘મધ્યકાલીન ગુજરાતી’ બની અને દલપત-નર્મદના સમયમાં ‘અર્વાચીન ગુજરાતી’ બની. આ ગુજરાતીનાં મૂળ સંસ્કૃત અને લોકબોલીઓમાં પડેલાં છે.

જે ભાષાપ્રેમીઓ ‘ગુજરાતી’ને ભચાવવાની વાત કરે છે તે કઈ ગુજરાતી? નરસિંહના સમયની જૂની ગુજરાતી? કે પ્રેમાંદના સમયની મધ્યકાલીન ગુજરાતી? કે નર્મદના સમયની અર્વાચીન ગુજરાતી?

ઘીરીભર એમ માની લઈએ કે ભાષાપ્રેમીઓ નર્મદના સમયની અર્વાચીન ગુજરાતીને બચાવવાની વાત કરે છે, પણ નર્મદના સમયની ગુજરાતી આજ ‘આઉટ ઓફ ટે’ – જૂની વાગે છે.

ઘીરીભર એમ માની લઈએ કે અત્યારે હાલ ૨૦૧૦ની સાલમાં ગુજરાતી જે રીતે બોલાય છે તેને ભાષાપ્રેમીઓ જાળવી રાખવા માગે છે તો શું તેમાંથી અંગેજના તમામ શબ્દો કાઢી નાખવા? અને અંગેજ ઉપરાંત જિલ્લો, ખાસ, બરફ, કિલ્લો, કાયદો, ખબર, તારીખ, માર્ઝી, રકમ જેવા અરબી શબ્દો, દીવાલ, ગુલાબ, રકાબી, ઘાલો, કાકા, બાગ,

જલેની, શહેર, સરકાર, ગુનો જમીન જેવા ફારસી શબ્દો, ચમચો, છોગું, કલગી, તોપ, જાજમ જેવા તુર્કી શબ્દો, બટાટા, કાજુ, કોઝી, ઈસ્ટી, પગાર, સાબુ, તમાકુ, તિજેરી, ટોપી જેવા પોર્કિંગ શબ્દો તેમજ ચળવણ, હલકટ, નિમાણુંક, અટકણ, નિદાન, જંજાળ જેવા મચડી શબ્દો. બાબુ, બિપિન, રજની, મહાશય, દીઠી જેવા બંગાળી ચા જેવા ચીની અને હાઈકુ, કરાટે, સુડેકુ જેવા જાપાની શબ્દો તેમાં છે. તે બધા કાઢી નાખવા ? કોણ કાઢે ? કોણ કોનું માને ? વગેરે જેવા પ્રશ્નો ઉભા થાય.

હવે બીજી વાત,

વિશ્વ આખું પરિવર્તનશીલ છે, દરેક વર્ષુ જડ કે ચેતન, ધીમી કે જડપી ગતિથી, દેખાય તે રીતે કે ન દેખાય તે રીતે સતત પરિવર્તન પામતી રહે છે. આ પરિવર્તનને કોઈ રોકી શક્તિ નથી. રોકવાની કોઈ શક્તિ પણ નથી. નાનો છોડ વિકસીને વૃષ્ટ બને છે, નાનું બાળક વિકાસ પામી યુવાન બને છે. લીલાં પાંડા પીળાં પડે છે. ઝરણાં ભેગાં મળી નઢી બનેછે. બે નદીઓ ભેગી થઈ, એક બની આગળ વધે છે અને નવું નામ ધારણ કરે છે. પરિવર્તનોનાં આ દષ્ટાન્તો છે. નાનું શહેર વિકાસ પામી નગર કે મહાનગર બને છે. આદિવાસી યુવક શહેરની કોલેજમાં અભ્યાસ કરી, શહેરમાં સ્થિર થઈ, ‘નગરવાસી’ બને છે. આ પણ પરિવર્તન છે.

જેમ બે નદીઓ ભેગી થાય તેમ બે ભાષાઓ પણ ભેગી થાય છે અને નવું નામ પામે છે. ભાષામિત્રણો કે પરિવર્તનોને કોઈ રોકી શક્તયું નથી. કારણ કે ‘આકમણ’ને મારી હટાવાય પણ ‘સ્વીકાર’ને શી રીતે હટાવાય ?

અકુલબના સમયમાં રાજભાષા ફારસી હતી અને તેમાં રાજવહીવટ ચાલતો હતો. ભલે તે ફારસી નામે ઓળખાઈ પરંતુ તે અરબી-ફારસીનું મિશ્રણ જ હતું. ભારતમાં આ બે ભાષાઓની સાથે નીજી હિન્દી ભાગી અને ત્રણ ભાષાઓનું મિશ્રણ થયું અને તેને ‘ઉર્દૂ’ એવું નવું નામ પણ મળ્યું. દુનિયાની કોઈ ભાષા એના જૂના સ્વરૂપે રહી જ નથી. દરેક ભાષા પરિવર્તન પામી છે, કાંતો મિશ્રણ પામી છે. હવે વાત સંસ્કૃતિની કરવી પડશે.

આપણે બધા દંબ કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિનાં ગુણગાન ગાઈએ છીએ અને યુરોપીય સંસ્કૃતિને અપનાવતા જઈએ છીએ. આપણે પોશાક પાશાત્ય અપનાચ્યો, પેન્ટ, શાર્ટ, ટાઈ, કોટ વગેરે... સ્ટેન્ડિંગ કીચન અપનાચ્યું, બૂઝે કીનર અપનાચ્યું, બર્થ કે સેલીબ્રેશન અપનાચ્યું. રસોડું, કીચન, ડ્રોઇંગરૂમ વગેરે યુરોપીય સંસ્કૃતિનું અપનાચ્યું અને બીજું ઘણું ઘણું અપનાચ્યું અને એટલું બધું અપનાચ્યું છે કે હવે આપણી અલગ ભારતીય સંસ્કૃતિ રહી જ નથી બા-બાપા ગયા અને મામી-પપ્પા આવ્યા છે.

અત્યારે વિશ્વ આખામાં સંસ્કૃતિ સમન્વયની પ્રક્રિયા ચાલી રહી છે. કોઈ એક સંસ્કૃતિ મુખ્ય હોય અને તેમાં બીજી સંસ્કૃતિઓ ભણે અને એ રીતે એક ‘ગ્લોબલ સિવિલિઝેશન’ તેયાર થાય, આ પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે. દુનિયાના દેશો, પ્રજાઓ, ધર્મો અને સમાજો ‘વૈશ્વિક એકતા’ તરફ જઈ રહ્યા છે. ‘યત્ વિશ્વ ભવત્યેક નિર્દિની કિયા અત્યારે ચાલી રહી છે’ અને તેના લાભો ઘણા છે. જૂનું પકડી રાખવા માગતા લોકોને કેટલાક પ્રશ્નો પૂછવા જેવા છે :

૧. ડામરના રસ્તા ઉખાડી નાખી ધૂળિયા રસ્તા બનાવવા ?

૨. મોટર, ગાડી વગેરે છોડી ગાડું અપનાવવું ?
૩. પેન્ટ છોડી ધોતિયું પહેરવું ? માથે પાંઘડી બાંધવી ?
૪. કેલ્ક્યુલેટર છોડી મોઢે ગુણકાર વગેરે કરવા ?
૫. ઇસ્વરીસન છોડી સંવતમાં વ્યવહાર કરવો ?
૬. કોમ્પ્યુટર વાપરવાનું બંધ કરી, જૂની પદ્ધતિના પ્રિન્ટિંગપ્રેસ શરૂ કરવા ?
૭. એરોક્ષ મશીનો બંધ કરી, હસ્તકિંજિત કોપીઓ કરવી ?

આપણા પૂર્વજી જે રીતે જિંદગી જીવતા હતા તેનાથી તદ્દન જુદી આપણો જીવીએ છીએ. આપણે શું ગુમાયું ? પૂર્વજી કરતાં અનેકગાણું મેળવ્યું છે. પૂર્વજી તો અનેક અભાવો વચ્ચે જીવ્યા. આજે જે જોઈએ તે આપણે મેળવી શકીએ છીએ. ખરું સુખ આજે જ છે. આજના જેવું સુખ અને સગવડો પહેલાં ક્યારેયે ન હતાં. ખુરશીમાં બેસીને કોઈ પણ માણસ આખી દુનિયા સાથે મોબાઈલ દ્વારા સંપર્ક કરી મહત્વનાં કામો પતાવી શકે છે. વિદેશમાં ભાજવા મૂકેલા દીકરાની ચિંતા કરતાં મા-બાપ તેના બેડરૂમમાં દીકરાને સૂતેલો કે સ્ટડી રૂમમાં અભ્યાસ કરતો કે ડ્રોઇંગ રૂમમાં તેના મિત્રો સાથે વાતચીત કરતો પોતાના કોમ્પ્યુટરમાં કે ટી.વી.માં જોઈ શકે છે. સમય, શક્તિ અને નાશાંની કેટલી બધી બચત ! ટી.વી. અને કોમ્પ્યુટરના માધ્યમથી દુનિયાનું કોઈપણ જીવંત દશ્ય ડ્રોઇંગરૂમમાં બેઠાં બેઠાં નિહાળી શકાય છે. આ સુખ શું ઓછું છે ? અને તે નવી જીવનશૈલી અપનાવવાથી એટલે કે સંસ્કૃતિ સમન્વયથી શક્ય બન્યું છે.

‘ગુજરાતી બચાવો’ આંદોલનવાળાઓને હું દિલથી અભિનંદન આપું છું પણ ગુજરાતી અંગ્રેજ મિશ્રિત બનતી જશે. કારણ કે આપણી સંસ્કૃતિ સાથે વિદેશી સંસ્કૃતિનું પણ રાજભાષીથી કરી રહ્યા છીએ. એટલે ગુજરાતી અંગ્રેજના મિશ્રણની પ્રક્રિયા થાય જ. બહારની સંસ્કૃતિ આવે એટલે સાથે તેની ભાષા પણ આવે જ. ગાય કું આવે તેમ, સંસ્કૃતિ મિશ્ર થાય તો ભાષા મિશ્ર થયા વિના રહે જ નહીં. કારણ અને સંસ્કૃતિ અભિન્ન છે અને ભાષા દ્વારા સંસ્કૃતિ વ્યક્ત થાય છે. આજની તિને વ્યક્ત કરવા મિશ્રભાષા અનિવાર્ય છે.

## કવિતા

(૧૧) અનુભૂતિ : ડૉ. પુલિન વસા, ૨૦૦૮, ૧૮, નંદનવન સોસાયટી, માંડવી-કચ્છ, દ૫૬૨, રૂ. ૧૦૦/- (૧૨) લીની સોડમ : ડૉ. નલિની પુરોહિત, ૨૦૦૮, ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ, રાવપુરા, વડોદરા, ૧૦૧૪૮, રૂ. ૧૫૦/- (૧૩) એક ઘાતી જાકરણ : રાજ્યક ભક્ત દીક્ષરાજ' ૨૦૦૮, નાદબ્રહ્ર પ્રકાશન, તળાજા, પૂ. ૭૬, રૂ. ૬૦/- (૧૪) જ્ઞાનો જ્ઞાનોદ્વાર : મનહર ગોહિલ, ૨૦૦૮, જિશેશ ગોહિલ, ૫૦૩, વિજયનગર, તરસાલી, વડોદરા, ૧૮૬૮, રૂ. ૮૦/-



## સમીક્ષા/ગ્રંથાવલોકન

### ‘મેળો’ વિશે | નવનીત જાની

[મેળો : માવજુ મહેશ્વરી, ૨૦૦૭, આર. આર. શેઠની કંપની, પૃ. ૧૦૮, ડિ. રૂ. ૧૫૦/-]

માવજુ મહેશ્વરી મારે મન ખૂબ આશાસ્પદ વાર્તાકાર રહ્યા છે. સમકાળીન છીએ એટલે એક જ સમયમાં પસાર થવાનો અનુભવ મનઃ ભાગીદારીની સાખ પૂરે એમાં નવાઈ નથી. એમનો એક વાર્તાસંગ્રહ ‘અદશ્ય દીવાલો’ અને ભૂકુંપ-સંવેદનાલેખસંગ્રહ ‘તિરાડની આરપાર’ પ્રકાશિત થયો છે.

એમણો ‘મેળો’ નિમિત્ત દીપક-જ્યોતિની પ્રશયકથા આવેલી છે. ‘કુચ્છભિત્ર’ દૈનિકની રવિવારની પૂર્તિમાં હપ્તાવાર છપાયેલી આ કથા એક નાનકડા ગામડામાં આકાર લે છે.

મામાના ઘરે રહીને એમ.ઓ.નો અભ્યાસ કરતો દીપક વેકેશનમાં ઘરે આવ્યો છે. મિત્ર મજૂદ સાથે મેળો જોવા નીકળે છે અને મેળામાંની નિરસતા જોઈ નિરાશ થાય છે. “બને એક ખુલ્લા મેદાનમાં આવી ગયા. દીપકની આંખોને એક ઘક્કો વાગ્યો. એ જે મેળાની કલ્યાના કરતો ચાલ્યો આવતો હતો એવું કથું જ ન હતું. એ થોડો નિરાશ થઈ ગયો. તેનાથી બોલાઈ ગયું : મજૂદ યાર ! અહીં તો કાગડા ઉડે છે.” (પૃ. ૪)

એ દરમિયાન એની મુલાકાત ગામમાં રહેતા દ્યાશંકર માસ્તરની દીકરી જ્યોતિ સાથે થાય છે. દીપકનું મજૂદના ઘરે રોજ આવવું-જવું છે. એ જ રીતે મજૂદની બહેન રોમતની બહેનપણી હોવાના નાતે જ્યોતિનું પણ મજૂદના ઘરે રોજનું આવવું-જવું છે. બંને વચ્ચે પરસ્પર આકર્ષણ જન્મે છે અને પ્રેમ ઉદ્ભબરે છે. પ્રેમના ભાવિ અંગે જ્યોતિ સાંશંક છે. એ દીપકને એક પત્રમાં જ્ઞાને છે, ‘હું જાણું છું જે વલોપાત મારા હેઠામાં છે એ તારા દિલમાં પણ હશે જ. છતાં છોકરા-છોકરી વચ્ચેના સામાજિક દરજા પ્રમાણે વેદવાનું તો છોકરીના ભાગે જ આવે છે. મને તારા પર લગીરે શંકા નથી. છતાં જે ખાઈ મારે કૂદવાની છે ત્યારે સામા છેડે તું નહીં હોય તો શું ?’

જ્યોતિને ‘મળેલાં જીવ’ (લે. પન્નાલાલ પટેલ)ની નાયિકા જીવી નથી બનતું. બંનેની જ્ઞાતિ અલગ હોવાને કારણે પરણી શકવા આડે કેટલાય અંતરાયો છે. દીપક કણબીનો છોકરો છે. તો જ્યોતિ બાધાશકન્યા છે. આને કારણે બંને વચ્ચે જે પડકરો, આશાઓ, અપેક્ષાઓ ઉભાં થાય છે એ નવલકથાનો ઘણોખરો હિસ્સો રોકે છે.

દ્યાશંકર માસ્તર પોતાનો મોભો અને જ્ઞાતિસન્નમાન જાળવવા માટે જ્યોતિને બી. એડ. કરવાના બહાને પોતાના સાણાને તાં મોકલી દે છે. પણ એમ કરતાંથી તેઓ આ બંને પ્રેમીપણીદાંને મળતાં રોકી શકતાં નથી.

દીપક અને જ્યોતિના પ્રેમસંબંધની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ છે. કેટલાંક લોકો આ બાબતને લઈ દીપક સાથે દોળટીખળ પણ કરી લે છે.

દીપક કે દીપકના બાપા કરસનભાઈ, ભાઈ ધીરજ કે ભાભી મંજુલાને આ બાબતે એટલું શોષાવાનું નથી આવતું એટલું વધુ શોષાવાનું જ્યોતિના બાપ દ્યાશંકરને આવે છે. દીપકના ઘરના તો દીપકના આ પ્રેમસંબંધ ઘણા ઉદાર ભાસે છે. સામેનાનું ઘર કેટલી શરમજનક સ્થિતિમાં મુકાઈ રહ્યું છે અનું ભાન દીપકને કે દીપકના ઘરને ખાસ લગતું નથી. જેકે દીપકની ભાભી દીપકનાં લગ્ન પોતાના કાકાની દીકરી શીતલ સાથે કરવા હશે છે. પરંતુ દીપક એમાં રાજી નથી. ધીરજ પણ એવું હશે છે કે દીપકનાં લગ્ન શીતલ સાથે થાય. દીપક ના પાડે છે એમાં એને પોતાનું નાક કપાતું જણાય છે.

દીપક અને જ્યોતિ વચ્ચે સણગતા ઉંબાડિયા જેવો કાંતિયો છે. એ એક તરફ દ્યાશંકરને ચાડાવે છે તો બીજી બાજુ દીપકના ભાઈને પણ ચેતવે છે, “ઈ માસ્તરને છેડવા જેવો નથી. માસ્તર પોંચેલી માયા છે. ઈ સીધો ઝઘડો નહીં કરે પણ બારથી ટૂંકો કરી નાખે એવો છે.”

મંજુલા, મજૂદ, લક્ષ્મીકાન્ત અને રોમન દીપક-જ્યોતિના સંબંધને મંગલમય બનાવવા મથતાં રહે છે. એમાંય મંજુલાનું પાત્ર વધુ ઉઠાવ પામ્યું છે. એ દિયર દીપકને પુત્ર જેવો સેહ કરે છે.

“મંજુલાનો હાથ દીપકના વાળમાં ફરવા લાગ્યો. દીપકને લાગ્યું જાણો વર્ષોનો થાક ઉત્તરી રહ્યો હોય ! ભાભીની હેઠેણીંથી વહેતી સંજીવની તેના અણુઅ. અણુમાં પ્રસરે છે. જો ભાભીનો સાથ હશે તો ગમેતેવા મુશ્કેલ સંઝોગો પાર કરી જવાશે.”

મંજુલા જ્યોતિના પિતા દ્યાશંકર માસ્તર સાથે પણ સમજાવથી કામ લે છે. ‘સાંબે તાણી એક હાથ તો નહીં જ પડતી હોય ન ?’ એમ કહીને દીપક-જ્યોતિના પ્રેમસંબંધ માટે જ્યોતિયે કેટલી જવાબદાર છે એ બતાવે છે. સામે પણે, સ્ત્રી હોવાને કારણે જ્યોતિની મનઃસ્થિતિને પણ ઊંડાશથી સમજે છે અને હુંક આપે છે.

એ દીપકનેય, ‘તમે કેંશો તે. બાકી મારી પાંઢે તો તમારા બધા સિવાય છેય હું ? બોલો ?’ કહીને સહકારની તત્પરતા દર્શાવે છે.

દ્યાશંકર માસ્તર સિદ્ધાંતવાદી શિક્ષક છે. તેઓ પોતાના કુંદુબની આબરૂ વિશે ખાસ સભાન છે. એથી જ્યારે એમને જ્યોતિ અને દીપકના પ્રેમસંબંધની જાણ થાય છે ત્યારે ઘણા અકળાઈ ઉદ્દેશ છે. આખો દિવસ પોતાના મોપેડ ઉપર ગામ આખામાં ફરતાં દ્યાશંકરનું વ્યક્તિત્વ ધાક જમાવે એવું છે. એ દીપકના ઘરે જઈ દીપકનાં ઘરનાંને પણ ચેતવે છે.

પોતાની દીકરીને બહારગામ મૂડી આવ્યા પછી પણ એમને જંપ નથી. દિવાળીના દિવસોમાં આ સ્થિતિ પરાકાણાએ પહોંચે છે. તેઓનું ચિત્ર હાલકડોલક થવા લાગે છે. એવી સ્થિતિમાં એ સ્વખસ્થ અવસ્થામાં પહોંચે જાય છે. લાલ કમળોની હારમાળા વચ્ચે દેખાતી દેવી એમના વિચારોમાં પરિવર્તન લાવનાર સાબિત થાય છે.

દીપકે નવલકથાના પ્રારંભે મજૂદને મેળો તો માણસો થકી જ કહેવાયને...’ એવું કહું હતું. એ મેળો નવલકથાને અંતે માણસોના ભર્યા ભર્યા વાતાવરણ વચ્ચે પૂરો થાય છે.

માવજુ મહેશ્વરી નવલકથાને સરળ-સારી ભાષા દ્વારા વાચનક્ષમ બનાવી શક્યા છે એ આ નવલકથાનું જમા પાસું છે. પાત્રોની મનોદશા, અંતર્રસંવેદના અને વર્તનવ્યવહારને આવેખવાની ઝાવટ તો એમની વાર્તા વંચતાં જ પમાય છે. અહીં પણ એ શક્તિનો ક્યાંક

ક્યાંક ચમકારો જોવાય છે. જરૂરી નાટ્યાત્મકતા પણ દેખાય છે. બસ, પ્રેમકથાથી વિશેષ કશું બની શક્યું હોતું તો સારું હતું. એવી ઘણી ક્ષણો – ઘટનાઓ પણ નવલકથામાં પડેલી છે જે નવલકથાને પ્રેમકથાથી વિશેષ કથાવસ્તુનો ઘાટ આપી શકત. વધુ સંકુલતાને સ્થાન મળી શકત.

માવજી પાસે અપેક્ષા રાખી શકાય. કચ્છ ભૂમિની ધીંગી તાસીરનાં રૂપ એમની વાર્તાઓમાં જોવા મળે જ છે, શક્ય છે એ બૃહદ પટ પર પણ આવી મળે.

### એ પણ ગઝલ, આ પણ ગઝલ | ડૉ. એસ. એસ. રાહી

**એ પણ સારું, આ પણ સારું... :** રાજેશ વાસ 'મિસ્કીન', પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ-મુંબઈ, પ્ર. આ. ફેબ્રુઆરી ૨૦૦૮, કિ. ૩. ૬૫/-

રાજેશ વાસ 'મિસ્કીન' એટલે ગઝલમાં ઓતપોત થયેલું વ્યક્તિત્વ. ગઝલની સાધનામાં રત અને વ્યસ્ત આ ગઝલકારનો પ્રથમ સંગ્રહ 'તૂટેલો સમય' ઈ. સ. ૧૯૮૮નાં પ્રકાશિત થયો હતો. તે પછી 'છોડીને આવ તું' (૨૦૦૫), 'કોઈ તારું નથી' (૨૦૦૭) જેવા નકરા ગઝલસંગ્રહો આપ્યા પછી હવે તેઓ 'એ પણ સારું, આ પણ સારું...' નામનો ૮૪ ગઝલો અને ૧૨ મુક્તકો સમાવતો નવો સંચય લઈને આવ્યા છે. આ અવલોકન લખાય છે ત્યારે તેમના નવા ગઝલસંગ્રહ 'પહેલી નજર' (૨૦૦૮)ને પ્રકાશનની પાંખ સાંપડી છે.

ગઝલ જેવા રેશમી અને મખમલી સ્વરૂપને પામીને તેને પોતીકો કરવાની દીવાનજી રાજેશની ગઝલોમાં જોવા મળે છે. અભિવ્યક્તિની રીત (અંદરો-બયાં) અને આકારગત માવજતને લીધી આ સંગ્રહની ગઝલોમાં નિછ પોત પ્રકાશે છે. સ્વરીય મુદ્રા ધરાવતી છતાં સર્જતી ગઝલની ઓંશિક તાસીર અને તસવીર પ્રકટ કરતી આ ગઝલોમાં સર્જકર્મની સભાનતા પણ દર્શિયોર થાય છે.

ગઝલની પરંપરા અને આધુનિકતા – બંને પ્રવાહની લાક્ષ્ણિકતાના લસરકાનું અહીં દર્શન થાય છે :

- એમના માટે સંબંધો વસ્ત્ર છે,  
એ ત્વચા થાશો નહીં ઓણિશા ન કર. (પૃ. ૨)
- શક્ય છે કૂવા ને દરિયાનો ફરક સમજાય કે,  
કોક દી મોંઝાઓ સાથે ઊછળી તો જો જરી. (પૃ. ૨૩)
- ગુલાબ કહેતું હતું સાંજના રડીને મને,  
મળ્યું શું ? ત્હારા અંગણામાં ઊઘડીને મને. (પૃ. ૩૮)

'મિસ્કીન'ની આ ગઝલોનું એક તત્ત્વ છે તેમાં વ્યક્ત થતી બેફિકરાઈ. વળી બેફિકરાઈમાં ઉમેરાય છે દીવાનગી અને અલગારીપણું. તેમાં શાયરનું અંગત સંવેદન (ગમે-જાનાં) ભણે છે ત્યારે સર્જીય છે આવા શે'ર :

- એ લખાવે છે ને લખતો જાઉ છું,  
ગામ છો ગણતું રહે અનપઢ મને. (પૃ. ૨૫)

### બાર ઉત્તાર્યા પછીની આ દરા,

સાવ હળવે રોજ કચડાતો ગયો. (પૃ. ૪૩)

પરમતત્વને પામવાની આરત તરફ તેમની ગતિ રહી છે તે તેમના તસવુફ રંગના કેટલાક શે'ર દ્વારા ભાવક પામી શકે છે :

- જાવ ભટકી બહાર શોધીને,  
ગાહ જોતું એ. નીકળે ભીતર. (પૃ. ૧૭)
- મહેલાની જહોજલાલી ભીતરે છે,  
સાવ વગડામાં ભલે ઘરબાર જેવું. (પૃ. ૨૬)
- કેટલું બીજુંય ઊઘડી જાય છે,  
દ્વાર ખખડાવો છો એવું કેં નથી. (પૃ. ૩૭)
- 'મિસ્કીન' નદી જેવું કશું પણ નથી છતાં,  
દૂબકી અર્હી લગાવું દૂર જઈ ચઢ્યે છે. (પૃ. ૮૮)

આ ગઝલોના પ્રણયનિરૂપણામાં સ્થુળતા નથી, પણ ન દેખાતી સૂક્ષ્મતા છે. આ સૂક્ષ્મતા પકડવા-સમજવા સામે પક્ષે ભાવકે પણ સજજ થતું પડે. ઘણું ગોપિત રાખીને કહી દેવાની ક્ષમતા અને છતી થાય છે :

- ફૂલોના જ્યૂમખામાં પરિચિત છે અભરો,  
જાશે લખ્યો છે કોઈએ કાગળ વસ્તામાં. (પૃ. ૨૨)
- ઘર ગયું આખર્યું તશ્શાઈ પૂરમાં,  
અંખથી વરસ્યું જ્યાં વાણ આખરી. (પૃ. ૨૮)
- શોધવામાં જિંદગી પૂરી થઈ,  
એક સપણું એવું ખોવાણું હતું. (પૃ. ૩૦)
- ચાસ કે ઉંઘ્યાવસ હો 'મિસ્કીન' અનુભવ આ રહ્યો છે,  
કૂલની ઈચ્છા કરી છે ને ઉઝરાઈ રહ્યો છું. (પૃ. ૩૩)

આત્મકથાનાં પાણાં જેવી આ ગઝલોમાં પ્રકૃતિ, પ્રણય અને આધ્યાત્મિક ચિંતનની સાથે બાળપણ ખોવાયાની વેદના તેમ વતનરાગ અને વતનનો જુરાપો સહજ વ્યક્ત થયા છે :

- હજુ બાળપણનું એ તોણાની સપણું,  
મને ચોરવા આવતું વાડ કેં. (પૃ. ૧૦)
- અંગણના ગોખલામાં આ કોની વાટ જોતું !  
અકનંધ કોરિયું છે કુળના ચિત્તાર જેવું. (પૃ. ૪૬)
- ગામ-પાદર-નદી બધું ત્યાં છે,  
હું શીશીમાં જે રેત લઈ આવ્યો. (પૃ. ૪૭)

મન જો સ્થિર રહે તો કશું ગુમાવાનું રહેતું નથી. પણ જ્યારે મન ડહોળાય છે ત્યારે તેમાંથી તો અંતે કશું જ પામી શકતું નથી. પામવાની વાખ્યા પણ ખોટી પડતી વાગે ત્યારે શાયરની કલમમાંથી કેવો શે'ર ટપકે છે તે જુઓ :

## ક્યાં કશું ખોવાય અંતે ?

માત્ર મન ડાંડાય અંતે. (પૃ. ૫૩)

ચાલીસમાં પાને મુકાપેલ ‘મન’ રદીફ પરની ગજલ કે પછી પચાસમાં પાના પર છપાયેલી ‘મનજી’ રદીફ પરની ગજલનાં મૂળ ઉપરનાં શે’રમાં પડેલા જણાય છે. ટૂંકી રદીફમાં લખાયેલી આ બંને ગજલોનો વ્યાપ ઘણો પહોળો છે.

‘પ્રીતમ’ રદીફ પરની બંને ગજલ પણ આ પરિચેક્યમાં આસ્વાદ છે. તો ૪૮માં પાને છપાયેલી ગજલ ‘સાવ કાચી ઊંઘથી જાગી જવાયું’ પ્રયોગદેખે આવકાર્ય છે. જોકે ગજલના પ્રત્યેક શે’રમાં સાની મિસ્થાનું પુનરાવર્તન થયા કરે એવો પ્રયોગ આ પૂર્વે ‘મુહિબ્લુ’ અને ‘આદિલ’ મન્સુરીએ પણ કર્યો છે. પરંતુ રાજેશે એમાં નવતર ઉમેરો કર્યો છે. ગજલના પ્રત્યેક શેરના પ્રથમ મિસ્થાનું તેમણે રદીફ-કાફિયાની સાંકળ રચીને ગજલને નોખું પરિમાણ આપ્યું છે.

પ્રસ્તુત સંગ્રહમાં સમાવાયેલી એક અક્ષરી રદીફ ‘જી’ પરની ત ગજલો, ‘આભાર માન’ જેવા વાતોચીતિયા રદીફ પરની ર ગજલો, ‘એ પણ સાચું, આ પણ સાચું’, ‘શું છે ? કોક હી તો જાણી જો’, ‘જુદી હોય છે’, ‘મળાયું પણ ભળાયું નહીં’, ‘કોઈ રમતું લાગે’, ‘સ્વયમ્ભને છેતરું છું’ જેવા પ્રલંબ રદીફમાં લખાયેલી ગજલકૃતિઓમાં ગજલની બહર પરના ગજલકારના પ્રભુત્વનો આધો-પાતળો અંદાજ મળી રહે છે. છતાં ક્યારેક લયપ્રવાહમાં અવરોધ ઊભો થાય કે પછી લઘુ-ગુરુનું સ્થાન આંધુંપાછું થાય તેવું પણ બન્યું છે તેનો નિર્દેશ કરવો અને જરૂરી છે.

કલ્યાનાની ઊંડાઈમાં મરજીવા થઈને દૂબકી લગાવી શેરિયતનો તાગ લેવાની સાહસવૃત્તિ દાખવતા કેટલાક શે’ર મમળાવવા જેવા છે :

- થઈ ગઈ ફરી લો આશાની ડાબી રંબુંબડી,  
ફૂંઝી ગઈ છે કેટલી કુંપળ વરસ્તમાં ! (પૃ. ૨૨)
- શહેર આવ્યું યાદ જેગલમાં અને,  
કોઈ મધ્યપૂડાની માફક મન ઊરું. (પૃ. ૫૧)
- એક બારી જરાક ખૂલી ગઈ,  
ઓરડો આસમાન થઈ ચાલ્યો. (પૃ. ૬૦)

ખાલીપો, રિક્તતા, શૂન્યતા એ બધું મનની નીપજ માત્ર છે. તેની સાથે સંકળાય છે જીવનની ક્ષણભંગરૂતા. આવા સૂક્ષ્મ ભાવોને શે’રમાં ઢાળીને તેને અર્થસભર બનાવવાનો વ્યાયામ પણ અહીં નજરે ચઢે છે :

- લાગું દરેક સંધ્યાએ જાતરાનો માણસ,  
આ આંગણું હવે છે ચારેય ધામ જેવું. (પૃ. ૪૫)
- ખૂબ ગંધાય છે હવે પાણી,  
દોસ્ત ! સરજણનો ઘાટ છોડી દે. (પૃ. ૫૮)
- જેણે રીધઈની જેમ સતત ખોખલા કર્યા,  
થોડુંક ખોતરો તો કોઈ વાહ નીકળો. (પૃ. ૮૮)

ગજલના પરિવેશમાં સંદર્ભમાં બોલચાલની વહેવાર ભાષાનો રાજેશે સર્જનાત્મક વિનિયોગ કર્યો છે. કહેવતો, રદીફયોગો, પુરાકલ્યન અને ઐતિહાસિક સંદર્ભ જેવાં કાચ્યાત્મક પરબ્ર. v માર્ચ, 2010

ઓજારોને ખપ પૂરતાં વશી લઈને ‘મિસ્ટિને’ ગજલિયત સિદ્ધ કરવા મથામણ કરી છે :

- આંખ ખૂલ્યા પછીનો ફરક આટલો,  
ત્યાં હતાં માત્ર ચક્કર, અઠે દ્વારકા. (પૃ. ૮)
- કોઈ નથી રડવાનું પાછળ, આપ મૂંઝે સબ દૂબ ગઈ દુનિયા,  
જાણી લે જુદી છે જળહળ, આપ મૂંઝે સબ દૂબ ગઈ દુનિયા. (પૃ. ૯)
- કરી જ્યારે જ્યારે આ દુનિયાથી નેકી,  
અમે પણ પછી અને દરિયામાં ફેકી. (પૃ. ૧૦)
- વાતોમાં ને વાતોમાં કયાં વાટ ખૂટી ગઈ બબર પડી ના,  
એ પણ જ્યાલ રહ્યો ના કયારે ઉમ્ભર આંદો મારી ગઈ છે. (પૃ. ૧૨)
- આ દેહ ગળે, જળહળે છે એ પરમ સ્મરણ,  
‘મિસ્ટિન’ જિંદગી એ સુદામાની ટેક છે. (પૃ. ૨૭)
- આ તે કેવું શહેર વસ્તાયું ઓ અહેમદશા,  
આખેઆખું જવતર લાગે અફિવા જાણે. (પૃ. ૬)

ઉત્તરોત્તર બળવત્તર થતી જતી આ ગજલોમાં સર્જકની લયસભાનતા અને સરળ અભિવ્યક્તિ ધ્યાન બેચે છે. એમની અભિવ્યક્તિક્રમતા કોંપેક્ટ ડિસ્ક જેવી છે. એમના શ્વાસ-ઉચ્છ્વાસમાં ધબકતો પ્રેમનો લય અહીં ગજલનું રૂપ પામ્યો છે. ભાવની સ્વચ્છતા અને સરળતા એમની ગજલોને પૂર્વકાલીન ગજલકારોની ગજલોથી જુદી પાડે છે.

અંતમાં, અટલું નોંધનું જોઈએ કે ભીતરમાં દ્બુરાયેલા સંશેષને તેઓ અવારનવાર પ્રગટ કરે છે ત્યારે કેટલાક શે’ર જોખમાય છે. ‘ભીતર’નું બણકટ આવેખન એ એમની સ્થિર છે તો તેનું વળગણ એ આ ગજલોની મર્યાદા પણ બની રહે છે.

આમ છતાં, કાર્ય-કારણભાવ, વિરોધોની ટેકનિક, અર્થનાટીન્ય અને તાજળી પ્રકટાવતી મારા સમકાવીન ગજલકવિની આ ગજલોનું ગજલદરબારમાં સ્વાગત કરું છું.

## ઝનૂનથી ખરડાયા વગરની હિજરતકથા | એસ. ડી. દેસાઈ

**ધ. બર્દિન અબ્ર રેફ્ઝ્યુઝ (અંગ્રેજી) :** રીય ક્રોટારી, સુધારેલી પેપરબેક આવૃત્તિ, ૨૦૦૮, ઓરિએન્ટ લેન્ડસ્ટોન, નવી દિલ્હી, પૃ. ૨૪+૨૦૬, ડિ. નિર્દિષ્ટ નથી]

૧૯૪૭માં દેશનું વિભાજન થયું તે પૂર્વના સો અને પછી આજપર્યતના સાઈ વર્ષ સુધીના સંદર્ભ સિંધી કોમના અસ્તિત્વની ઝાંખી કરાવતું આ પુસ્તક છે. રાજકીય અને સાંસ્કૃતિક મુખ્ય પ્રવાહથી દૂર સરહદી પ્રાંત સિંધ અને ત્યાંની સ્થાનિક સિંધી ભાષા બોલનારાં લોકોમાં ત્રણ ભાગનાં મુસ્લિમો અને એક ભાગનાં હિન્દુ. હિન્દુઓમાં કેટલાંક પાસે વહીવટી કાબેલિયત, મોટા ભાગનાં દુકાન ચલાવે કે શરારી કરે, કેટલાંક ઔંતરરાષ્ટ્રીય કક્ષા સુધીનો વેપાર પણ. આના કારણે મુસ્લિમો પણ એમના પર આધાર રાખે.

મુસ્લિમ મુખ્ય પ્રવાહ વચ્ચે સિંધમાં સદીઓ સુધી રહેલાં આ હિન્દુઓનું હિન્દુત્વ સંસ્કૃત પ્રશાલીના હિન્દુત્વથી થોડું ભિન્ન છે. સિંધી હિન્દુઓ એમના તિકાના મંદિરમાં જાય

છે અને શીખ ધર્મ તથા સૂક્ષી સંપ્રદાયની અસર ધરાવે છે. એમના ખોરાક, પહેરવેશ વગેરે પર ઈસ્લામની પણ અસર છે. આની પ્રારંભિક નોંધ લીધા પછી ઈ. સ. ૭૧૧માં થયેલા આરબ આકમાણથી માંતીને ૧૮૪૭માં અંગેજોએ સિંધ આંચડી લીધું ત્યાં સુધીનાં રાજકીય-સામાજિક-ધાર્મિક પરિબળો અને તે વચ્ચે ઉભારતી સિંધી પ્રતિભાની લેખિકા સંક્ષિપ્ત ચર્ચા કરે છે.

૧૮૪૭થી ૧૯૭૬ના સોએક વર્ષના ગાળા દરમ્યાન સિંધ બૌંબે પ્રેસિડન્સીનો ભાગ રહ્યું ત્યારપછી ૧૯૭૭માં સિંધનું અલગ પ્રાંત તરીકે અસ્તિત્વ આવ્યું. અગાઉનાં સો અને આ દસ વર્ષના સમયગાળાની વિશાદ ચર્ચા લેખિકા, પરિશ્રમપૂર્વકના અભ્યાસને આધારે, બે અલગ પ્રકરણોમાં કરે છે. અગાઉ સંયુક્ત મુનબઈમાં હિન્દુઓ બહુમતીનો દરજાને ધરાવતાં હતાં, તે હવે અલગ સિંધમાં લઘુમતી બન્યાં. એટલું જ નહીં, સિંધમાં હિન્દુ કોમવાદનો પણ ઉદ્ય થયો. સિંધ પ્રાંત અંગે લેખિકાએ બે સૂચ્યક અવતરણો ટાંકેલાં છે. “સિંધ એવો વિચિત્ર પ્રાંત છે,” સરદાર પટેલ કહે છે, “જ્યાં સિંધાંત કોઈ ક્ષેત્રમાં જોવા મળતો નથી, અને કોઈ પણ વ્યક્તિનો અહીં વિશ્વાસ ન થાય.” ૧૯૪૪ સુધીમાં એન. આર. મલ્કાણી નોંધ છે, “સિંધમાં બે જ સંગઠનો રહ્યાં હતાં – લીગ અને આર.એસ.એસ.”

આ પશ્ચાદ્ભૂમાં પુસ્તક બે રસપ્રદ બાબતો પર કેન્દ્રિત થાય છે – દેશના વિભાજન સમયનાં સિંધીઓના અનુભવો અને ગુજરાતમાં આવીને વસેલાં સિંધીઓ પ્રત્યે ગુજરાતીઓના પૂર્વગ્રહો તથા પોતાની અલગ પહેચાન અને ભૂતકાળ ભૂલી-મિયાવીને હિન્દુઓના મુખ્ય પ્રવાહમાં એકરૂપ થઈ જવાના સિંધીઓના પ્રયાસો. વિભાજન સમયની વેરઝેર અને લોહી નીંગણી વિવિધ કથાઓથી જુદી પડતી હોવાની સાથે આ કથનીઓમાં વાસ્તવિકતા સ્વીકારી લઈ આગળ વધવાની લિંદાદિલી તો છે, પરંતુ તે સાથે અસ્વાભાવિક પરિબળોને કારણે પોતાની સામુહિક ધાર્મિક-સામાજિક અલગ પહેચાન ઓગાળી દેવાની અનિવાર્યતાનું દર્દ ઓછું હદ્દસ્પર્શી નથી.

વિભાજનના પગલે સિંધનાં હિન્દુઓ અને શીખોએ હિજરત કરી તે પંજાબ સાથે સંકળાયેલ હિજરતથી જુદી હતી. અધિકૃત અહેવાલો મુજબ હિજરતીઓની સંખ્યા મર્યાદિત હતી તથા હિજરત હિસ્ક અને લોહિયાળ ન હતી. આચાર્ય કિપલાણીએ એના મૂળમાં સૂક્ષી અને વેદાન્તની અસર ગણાવી છે. અહીં ધાર્મિક ઝનૂન ન હતું, આર્થિક હતું. સિંધી હિન્દુઓ સરખામણીમાં સમૃદ્ધ હતા. ઝનૂન અને હિસાનો ભોગ બનેલ, ઘરબાર વિનાનાં મુસ્લિમો સિંધમાં આવ્યા, તેમજે પણ સિંધી હિન્દુઓને સિંધ છોડવવામાં ભાગ ભજવ્યો. આમ છતાં, નોંધપત્ર છે કે, સિંધી મુસ્લિમો અને સિંધી હિન્દુઓ વચ્ચે પેઢી દર પેઢી ચાલે એવાં વેરઝેરનાં બીજ ન રોપાયાં. વિભાજન પછીની પહેલી પેઢીનાં સિંધી હિન્દુઓ અને સિંધી મુસ્લિમોના હિન્દુમાં પણ આ વાત પ્રતિબિનિત થાય છે.

સિંધીઓ લગભગ છ દાયકથી ગુજરાતમાં વસી રિશ્ર અને સમૃદ્ધ થયાં છે. ભૂતકાળ બાબતે જૂની પેઢી લાગણીશીલ થતી નથી. આજે ઊછરી રહેલી યુવા પેઢી એમની સિંધી ભાષા, રહેણીકરણી અને અસલ ઓળખનાં ચિહ્નો ભૂસીને ધીરેધીરે અધ્યતન જીવનશીલી અપનાવી નવી પહેચાન વિકસાવવા પ્રયત્નશીલ છે. કેટલાંક તો જૂલેવાલ નામથી પણ અજ્ઞાત છે. આ પરિવર્તનમાં વડીલોનો પણ સહકાર છે. આના મૂળમાં એમની ગંદાંગોબરાં,

માંસાખારી, પાપડખાઉ, અપામાણિક, અશીકિત અને અભિરુચિ વિનાના હોવાથી પ્રચાવિત છાપ છે, એવું લેખિકા પોતે નિખાલસતાથી સ્વીકારે છે. અનેક મુલાકાતો દરમ્યાન પણ આ છાપ અને પ્રયાસ સ્વીકારાયાં છે.

૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો દરમ્યાન સિંધીઓનું જે વલશ રહ્યું તેનું વિશ્વેષણ લેખિકા નિર્ભાક તાટસ્થથી કરે છે. આ વલશ પાછળ રહેલી માનસિકતા લેખિકાએ ગોધરા, અમદાવાદ, સુરત, ભાવનગર જેવાં નગરો અને અન્ય સ્થળોએ વસતાં સિંધીઓની મુલાકાત લઈ એમના શબ્દોમાં પણ જીલી છે. રેલવે સ્ટેશન પરની ઘટનાનો પડઘો ગોધરાનાં વહેવારુ વેપારી સિંધીઓએ શેરીમાં ન પાડ્યો. તો વળી, આવાં રમખાણો માટે નામચીન નહીં એવાં સ્થળોમાં પણ ‘હિન્દુઓથી વધુ હિન્દુ’ પુરવાર થવાની ઉત્તાવળે સિંધીઓએ ગુજરાતી હિન્દુઓ સાથે ભાઈયારો સાધી હાથ મિલાવ્યા અને વિભાજનના ઈતિહાસને પણ મરીડીને રજૂ થતા જતા કોમવાદના ઝનૂનમાં ઝુકાવ્યું. લેખિકા યાદ કરાવે છે કે આજે પણ સિંધી મુસ્લિમો હિન્દુ સૂક્ષી સંતોને મળે છે અને એમનો આદર કરે છે. જૂની પેઢીના સિંધીઓને વિભાજન સમયે શારીરિક બળજબરી કે હિસા આચારી હોય એવી કોઈ સ્મૃતિ નથી. તેમને અળગા ગજાવાનું વલશ પણ મુસ્લિમોએ અપનાવ્યું ન હતું.

અંતમાં એક અંગત નિરીક્ષણ. નાંદોક દાયકા પહેલાં અમદાવાદ આવીને વસ્યાં ત્યારથી રીટા કોડારીનો પરિયય. સિંધી હોવાનો અહેસાસ ક્યારેય થયો નથી. ભાષા, અભિરુચિ અને અભિગમને કારણે. સિંધી કોમ ‘દૂધમાં સાકરની જેમ’ ભજી ગઈ છે એવું તો નથી. છતાં, પરિચિતોમાં, રીટાની જેમ બીજા પણ થોડા અપવાદો છે. ફુશાગ્રબુદ્ધિ યુવા લેખિકાએ વલેલું આ પુસ્તક, એની શૈલી અને એના વલશને કારણે, વાચનક્ષમ બન્યું છે. સિંધી ભાઈબહેનો માટે પથદર્શક અને રૂઢિઓંકી સરહદોમાંથી ‘અન્ય’ લોકોને જોતાં કેટલાંક ગુજરાતી હિન્દુઓ માટે બોધપ્રદ છે. લેખિકાનો સમાપનનો સૂર એ છે કે સિંધીઓ (હિન્દુ-શીખ-ઇસ્લામના સમન્વયરૂપ) ‘સિંધીપણાં’ દાવો કરે તો તે માનવીય અભિગમ ધરાવતા, સુસંસ્કૃત અને ઈતિહાસ સાથે સુસંગત એવા સિંધીપણાં હોય.

## બાલપુષ્પો પ્રત્યેનું વહાલ | શ્રદ્ધા ત્રિવેદી

**‘કૂલદાં વહાલાં લાગો’:** જગદીશ ધનેશ્વર ભણ, પ્ર.આ. જાન્યુ. ૨૦૦૮, પ્રકાશક : પોતે, મુખ્ય વિકેતા : રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૮૪૪૦, ક્રિ. ૩. ૫૦/-]

‘કૂલદાં વહાલાં લાગો’ એ શ્રી જગદીશ ધનેશ્વર ભણનો ૪૦ બાલકાવ્યોનો સંગ્રહ છે. બાળક પણ જીવનવાડીનું એક પુષ્પ છે. બંગીઓ જેમ કૂલોથી રણિયામણો લાગે તેમ કૂલબંધ-ઘર બાળરૂપી પુષ્પથી મહેકતાં હોય છે. બાળકનો કિલાકિલાટ ઘરમાં આંદંદું વાતાવરણ પ્રસરાવે છે. અહીં કવિઓ બાલપુષ્પો પ્રત્યેનું પોતાનું વહાલ ભાવવૈવિદ્ય અને કલ્યાણવૈવિદ્યસભર કાવ્યો દ્વારા વક્ત કર્યું છે. આ સંગ્રહની ઊડીને આંખે વળગે તેવી બાબત છે તેની ગેયતા. લય-ગ્રાસયુક્ત આ કાવ્યો બાળકોને ગાતાં કરી દે તેવાં છે. કાવ્યસંગ્રહનું પ્રથમ જ ગીત છે : ‘પ્રાર્થના’.

“અમે સૌ નાનાં નાનાં બાળ, પ્રભુજી ! લેજો અમ સંભાળ.” આવાં અન્ય ગીતો છે : “અમે પંખીડાં રે ઊંચા તે આભનાં.” (“પંખીડાં”), “શૈટા વચ્ચે ઊભો હો રાજ ! / સૌની વચ્ચે ઊભો હો રાજ ! /કેવો મજાનો ચબૂતરો.” (“મજાનો ચબૂતરો”); “આવો મહેમાન મારે આંગણો રે લોલ / દેવાં કાંઈ અદકેરાં માન રે; / આવો મહેમાન મારે આંગણો રે લોલ.” (“આવો મહેમાન”); “મારે તે આંગણો આવ્યો છે મોરલો, / થનગન થનગન નાચે છે મોરલો” (“મોરલો”) વગેરે. કાવ્યસંગ્રહના ઊઘડતા પાને પ્રસ્તુત સંગ્રહની એક રચનાની ત્રણ પંક્તિઓ કવિએ મૂકી છે તે આ પ્રમાણો છે : “આવો હળીમળીને રહીએ, / સૌ મીડા કલશોર કરીને સાચે રહીને રમીએ, / આવો હળીમળીને રહીએ.” – સાચે મળીને આનંદ કરવાની આ વાત ખાસ નોંધાવત્ર છે.

કવિની રચનાઓમાંથી પસાર થતાં એક પ્રકારની તાજળીનો અનુભવ થાય છે. કુદરત-પ્રકૃતિ સાચે કવિનો ઘરોબો આપણનેય પ્રતીત થાય છે. આ સંગ્રહમાં પ્રકૃતિ, વતનપ્રેમ, શાળા, રમકડાં, પંખી, રમતગમત અને ‘તાવડી’ જેવા કાવ્ય દ્વારા ગૃહઉપયોગી સાધન કાવ્યના વિષયો છે. વિષય ગમે તે હોય પણ કવિએ પ્રાસાનુપ્રાસ તરફ સભાનતાથી કામ કર્યું છે તે જ્ઞાય છે.

કાવ્યસંગ્રહનો પ્રારંભ ‘પ્રાર્થના’ કાવ્યથી થયો છે તે સૂચક છે. દિવસ ઊરો કે પહેલી આવે પ્રાર્થના ! આ પ્રાર્થનામાં ભણીને અફસર થઈ દેશસેવાની વાત સાંકળીને કવિ જાણે કહેવા માંગે છે કે બાળકરૂપી પુષ્પ ક્રીમળ છે પણ તે દેશ માટે કઠણ પણ થઈ શકે છે, એ પછી આવે છે ‘રોજની વાત.’ દિનચર્યા કેવી હોવી જોઈએ તે અહીં બતાવવામાં આવ્યું છે. દાંત સાંદ્ર કરવા, સ્નાન કરવું – એ તો સ્વાભાવિક રીતે બધાં કરે. અહીં બાળકોને ‘તન-દુરસ્તી’ માટે જે કહેવામાં આવ્યું છે તે ધ્યાનપાત્ર છે. જેમકે, ‘વહેલી સવારે સૂરજ તડકે, કસરત હળવી કરીએ રે... ભોજન યાજો એકચિત્તે સૌ, આવીને રસ કરીએ રે... સૂવા યાજો સ્તુતિ કરતાં, નીંદર માણી લઈએ રે.’

આ સંગ્રહમાં પંખીઓનું અને પ્રકૃતિનું વિશાળ સામ્રાજ્ય છે. તેમાંય વરસાદ-વાદળની વાત તો અનેક રીતે આવી છે. ‘મેહુલા’, ‘શું શિખવાડે ?’ ‘મને ગમતાં રે’, ‘અચરાજ’, ‘સૂરજદાઢા’, ‘ચાંદી’, ‘તલાવડી’, ‘વસંત’, ‘પંખીઓ તમામ’, ‘મને ગમે’, ‘વૃક્ષોને...’, ‘મોરલો’, ‘પંખીનો મેળો’, ‘લીમડો’ ને ‘ફૂલડાં વહલાં લાગે’ – જેવાં અનેક કાવ્યોમાં પુષ્પ-પંખી-કુદરત અને બાળકની ભાવનાસૂચિ રજૂ થઈ છે. ‘ગમે’ કાવ્યમાં બાળકને શું શું થવું ગમે તે સમજવા જેવું છે. બાળક કહે છે : “બા ! મને સૂરજ થવું ગમે, સૂરજ થઈને તપવું ગમે.” પછી તે કહે છે કે મને ચાંદો થવું, વાદળ થવું, કળી થવું, પંખી થવું ને ઝરણું થવું ગમે. જોઈ શકાય છે કે બાળકમાં કેટલી બધી કુદરતપ્રીતિ છે. ને વળી એમ ચાંદો કે ઝરણું થઈને પછી એ શું કરશે તે પણ કહે છે; જેમકે, ઝરણું બનીને તે ગીત ગાવા ઈચ્છે છે. આમ બાળમાનસસૂચિ અહીં બહુ સહજ રીતે અભિવ્યક્ત થઈ છે. તો તેના આંગણો થયેતા ‘પંખીના મેળા’ના વર્ણનમાં તે પોપટ, કાગડો, મોર વગેરેનું પણ સુંદર વર્ણન કરે છે. ‘પાંખ બે આપો’માં તે ગાય છે : ‘મને ઊડવાની પાંખ બે આપો, કે મારે જાવું ઊંચેરા આભયાં.’ ‘વૃક્ષો...’ કાવ્ય એ વૃક્ષ વિષય ઉપર લખાયેલો નાનકડો પદ્ધનિબંધ છે. તેમાં લય-પ્રાસ કરતાંય વૃક્ષની મહત્ત્વાં સુંદર રીતે વ્યક્ત થઈ છે. ‘ચાંદો’ કાવ્યમાં રજૂ થયેલું કાવ્યાત્મક વર્ણન રમણીય

છે : ‘વૃક્ષ વૃક્ષને પાંદ પાંદ પટ રમત રે અજવાણું રે, બણખળ વહેતાં પાણી માંહે મોં જુએ લટકાણું રે.’” આ સંગ્રહમાં આમ કુદરતનાં અનેક મનોહર ચિત્રો પ્રાપ્ત થયાં છે.

બાળક માત્ર કુદરત કે પંખીઓ સાચે જ તાદાત્મ્ય અનુભવે છે એવું નથી. એને ઘર-કુટુંબ-શાળા-વતન-દેશ વગેરે માટે પણ એટલો જ ભાવ છે. ‘નાનકડી બહેન’ તેને વહાલી છે. બહેન વિશેની વાત બહુ કલાત્મક અને ચિત્રાત્મક ફબે રજૂ થઈ છે : “નાની શી આંખ જાણો એ રૂપેરી તારલા !” તો આ ચિત્ર જુઓ : “પીળી પીળી ઓછણી ને રાતી છે ઘાઘરી, અંજર ઝણકાવતી દોડે એ પાધરી.” બાળકને દાદી વહાલી છે ને તે કેવી રીતે પોતાનો ઉમળકો વ્યક્ત કરે છે તે ‘દાદી આવેમાં જોવા મળે છે. સામાન્ય રીતે દાદી બાળકની સંભાળ લે, અહીં બાળક દાદીની સંભાળ કેવી રીતે લે છે તે જોવા જેવું છે : “જરમર ઝરમર વર્ષા ટાણો દાદીમાને છની આપું, બહાર ફરીને દાદી આવે સામે દોડી આપું છાપું.” ‘હળીમળીને રહીએ’ કાવ્યની ભવ્ય ભાવના માણસવા જેવી છે, પણ તેની ભાષા બાલભોગ્ય ઓછી લાગે છે. તેની સામે ‘નેહાબહેન લટકાણાં’ની શબ્દપસંદગી બહુ સ્વાભાવિક લાગે છે : “ભોળા ભટક બહુ લાગે નેહાબહેન લટકાણાં” એ જ રીતે રવિવારની રજાની વાત પણ સહજ રીતે વ્યક્ત થઈ છે. વળી બાળકને માત્ર રમણું જ ગમે છે તેવું નથી. તેને ભણણું પણ ગમે છે. તેથી તે કહે છે : “મને વહાલી લાગે રે નિશાળ, નિશાળમાં જાવું છે.” (નિશાળ) અને કહે છે કે, ‘અંક શીખવા દે.’ અલબત્ત, અંક શીખવાની સાચે તે બીજી અનેક પ્રક્રિયાઓ પણ કરવાનું કહે છે તે પણ ધ્યાનમાં રાખવા જેવું છે.

અહીં કુટુંબપ્રેમનાં કાવ્યો છે તેમ વતનપ્રેમ – દેશપ્રેમનાં કાવ્યો પણ છે. ‘ગુર્જર ધરણી !’, ‘અમે’, ‘અમે ભારતવાસી’ કાવ્યો આ સંદર્ભમાં વાંચવા જેવાં છે. ભારત એ ગામડાંઓનો બનેલો દેશ છે. અહીં પણ ગ્રામ્યમાહોલનાં સુંદર કાવ્યો છે. કવિકલ્પના પણ અહીં માણસવા જેવી છે : “જળ માંહે સૂરજ હાલે તલાવડી છાકમ છોળ, રંગ સોનેરી છલકાવે તલાવડી છાકમ છોળ..” ‘તલાવડી’, ‘મજાનો ચબૂતરો’, ‘લીમડો’ વગેરે કાવ્યો ગામડું જવતું કરે છે.

કેટલાંક કાવ્યો તેના વિષયને કારણે વિશિષ્ટ બન્યાં છે. જેમકે, ‘તાવડી’ એ જ રીતે ‘મજાની વાડી’ કાવ્યમાં ચિત્રોની હારમાળા રચાઈ છે અને વાડી જાણે કે તાદશ થાય છે. બાળકોને ઉખાણાં-ઝોડકણાં ગમે. અહીં નમૂનારૂપ ઝોડકણાં પણ છે. એક બાજુ ‘તાવડી’ પર ગીત છે, તો બીજી બાજુ સંપ્રત સમયનું એક મહત્વાનું માધ્યમ – ટી.વી. પર પણ કાવ્ય છે, ટી.વી. દ્વારા કવિએ તેમાં જોવા મળતી આખી દુનિયા કાવ્યમાં બતાવી છે. ‘શસ્વલાભાઈને શરદી થઈ’ – એ નિમિત્ત લેખકે આયુર્વેણી વાત પણ સાંકળી છે. બાળક પોતે જે જુએ-જાણે તે પ્રમાણે તે પશુ-પંખીને પણ કરાવે. ને એટલે સસ્વલાભાઈને ‘નાસ’ લેવડાવે. બાળકાવ્યસંગ્રહ હોય ને કોઈ રમત કે કોઈ તહેવારની વાત ન આવે તો તે સંગ્રહ અધૂરો ગણાય. અહીં ‘દિવાળી’નું કાવ્ય છે અને દિવાળી નિમિત્ત રીતરિવાજોની વાત સાંકળી છે. તો ‘સંતાકૂકડી’ની રમત પણ કવિએ બાળકોને રમાડી છે.

પ્રસ્તુત સંગ્રહમાં કવિએ સાચા અર્થમાં બાલભોગ્ય કાવ્યો આપ્યાં છે. પોતે બાળક બનીને જગતને જોવા પ્રયત્ન કર્યાં છે. અને એ રીતે જ સંવેદનો અનુભવ્યાં છે તેને અહીં લયબદ્ધ કર્યાં છે. બાળકોને ગમે તેવાં સુંદર બાળકાવ્યોનો આ સંગ્રહ છે. કવિની કલ્પનાશક્તિ અને લયપ્રભુત્વનો તેને સરસ લાભ મળ્યો છે.

## પત્રસેતુ

### આત્મકથા સાહિત્યપ્રકાર નથી ?

પ્રિય રવીન્દ્ર,

‘પરબ’ (જાન્યુ. ’૧૦)માં પ્રકાશિત તારો અભ્યાસલેખ વાંચીને થયું, પહેલાં નાટક, પછી નવલકથા, વિવેચન, હવે આત્મકથાનો વારો ? આમ એક યા બીજું કારણ આગળ ધરીને આપણે એક પછી એક સરૂપને સાહિત્યમાંથી દેશનિકાલ કરતા જઈશું તો કવિતા – વાર્તા સિવાય બચશે શું ? (અને કવિતા દેખે પણ કેટલી રચનાઓ ?) આત્મકથાને પગલે પગલે જીવનચિત્ર, વ્યક્તિચિત્ર કે રેખાચિત્ર, સ્મૃતિકથા, પત્ર, ડાયરી, પ્રવાસનિબંધને પણ હંડી કાઢવામાં જ આવશે ?

તારા લેખમાંના વિધાનને આ પત્રના શીર્ષકમાં પ્રશ્ન રૂપે મૂકવાનું કારણ એ છે કે આત્મકથાને સાહિત્યપ્રકાર ગણવા સામે તેં જે પ્રશ્ન ઉઠાવ્યા છે એમાં જ મને એના ઉત્તર દેખાયા છે, તો હું એ રીતે જ વાત કરું.

(૧) તું જ્યારે એમ કહે છે કે ‘કોઈ પણ સાહિત્યપ્રકારમાં કલ્યાનાનો વિશેષ મહિમા છે, પણ આત્મકથામાં કલ્યાનાને અવકાશ નથી. જો આત્મકથામાં કલ્યાન ભણે તો આત્મકથાનું સત્યઘટના પર આધારિત, હું કેન્દ્રી નવલકથા બનવાનું જોખમ નકારી શકાય નહીં’ ત્યારે તું સાહિત્યસર્જનમાં કલ્યાનાત્ત્વની સક્રિયતાને બહુ સીમિત કરી દઈને માત્ર સામગ્રીની ઉત્પાદ્યતા, એટલો જ એનો અર્થ કરે છે. કોઈ કૃતિને આપણે ‘સર્જન’ રૂપે જોઈએ છીએ ત્યારે શું માત્ર તેની સામગ્રીનો જ વિચાર કરીએ છીએ ? અભિવ્યક્તિના સૌંદર્યને, તેની અસરકારકતાને એની સાથે કેટલોબધો સંબંધ છે ! એક અલંકાર કે કલ્યાન, અરે, વાક્યભંગી સાથે પણ કલ્યાન કેટકેટલી રીતે સંયોજય છે ! આત્મકથામાં નિરૂપાયેલી તથયુલ્ક ઘટનાને સપ્રાણ કરવામાં એનો કેટલોબધો હિસ્સો છે ! આત્મકથામાં કહેવાયેલી ‘કોઈક’ની વાતનો સ્પર્શ આપણને શાથી થાય છે ? બીજી બાજુ, શું તથાત્મક વસ્તુની સાહિત્યરચના ન થઈ શકે વારુ ?

(૨) ‘આત્મકથાકાર બાળપણ જીવો હોવા છતાં તેના દ્વારા થતું નિરૂપણ ઘણુંખરું સ્મૃતિ આધારિત રહેવાનું. કોઈક રીતે એનું દસ્તાવેજકરણ થયું હોય તોપણ.’ – એમ તે કહ્યું છે. વાત ખોરી નથી પરંતુ (જેમ સાહિત્યકૃતિ માત્ર પાસે તેમ અહીં પણ) એ સ્વીકારીને જ ભાવકે આત્મકથા પાસે જવાનું છે. આત્મકથા પાસે એને દસ્તાવેજની અપેક્ષા પણ નથી, જેમ કોઈ પણ સાહિત્યકૃતિ પાસે નથી.

(૩) તું અહીં જ કહે છે, ‘આત્મકથાનું મંડાણ જ કલ્યાનાશ્રિત હોય ત્યાં સત્યનો કેવો અને કેટલો મહિમા હોય તે સમજી શકાય તેમ છે.’ ખરો ગુંચવાયો છે તું ! શરૂઆતમાં તે કહ્યું, ‘આત્મકથામાં કલ્યાનાને અવકાશ નથી.’ અને હવે કહે છે કે એનું મંડાણ જ કલ્યાનાશ્રિત છે ! એટલે એમને કે કલ્યાનાની મદદ લેવાની ન હોવા છતાં એ લે છે ? પણ અહીં અગાઉ કહ્યું તેમ એ એની ગુંજાશ ન હોવાનું નહિ કહી શકાય.

(૪) તારી નોંધમાં આગળ કહેવાયું છે : ‘આત્મકથાકાર ...જિવાઈ રહેલી

વાસ્તવિકતાને જ નિરૂપતો હોય તોપણ તેનો દસ્તિકોણ જ વાસ્તવને બદલી નાખવા પૂરતો છે. ગમે તેવું કહીર સત્ય કે વાસ્તવ શબ્દમાં કે અન્ય માધ્યમમાં મુકાવા માત્રથી બદલાનું હોય છે, ત્યાં વ્યવહારનું સત્ય કે વાસ્તવ ખોળવાનો અર્થ ખરો ? પણ આ તો કોઈ પણ માનવપ્રવૃત્તિની મર્યાદા છે. એમ કહી શકાય કે આ જ કારણો આત્મકથા ઈતિહાસ નથી, સાહિત્યવૃત્તિ છે. અલબંત, ઈતિહાસલેખનમાં પણ તેના લેખકનો દસ્તિકોણ પ્રભાવક ક્યાં નથી બનતો હોતો ? એઝો વિવાદો પણ જગેવા છેને ?

એ પણ સમજવા જેવું છે કે પ્રશ્ન માત્ર વાસ્તવના રૂપાંતરનો નથી, સંદર્ભ-યોજનાનો છે : વસ્તુ એને લઈને જ ‘રચના’નું રૂપ પામતું હોય છે. અને નિતાંત સત્ય – Absolute Truth – જેવી કોઈ વસ્તુ છે કે કેમ તે પ્રશ્ન પણ છે.

(૫) તે ભાષાનો મુદ્દો ઊભો કર્યો છે. આત્મકથાને લગતી આ ચર્ચામાં એ કઈ રીતે પ્રસ્તુત બને એ મને સમજાયું નથી, છતાં એને પકડું સાહિત્યકૃતિમાં સંવાદની ભાષા પાત્રની વાણી હોવાનો – અને એ રીતે એ વાસ્તવનો અભ્યાસ રચે એ પૂરતું ગણાનું જોઈએ; બોલીનું વિશાળ આપવાની જરૂર નથી. પણ તેં જે ઉદાહરણ આયું છે એમાં સોમાલીની ઉક્તિમાં આવે છે એમ સહજ રીતે અલંકાર આવે તો તને વાંધો ન હોવો જોઈએ; જોવાનું એ રહે છે કે એ સાદ્યય રચે છે તે એના પરિચિત જગત સાથે રચે છે કે કેમ.

‘પાત્રોના સંવાદો, ઉક્તિઓ જે તે કાણે જે કેમ રજૂ થયા હોય તે જ કેમ આત્મકથામાં આવે એવું દર વખત ન પણ બને’ ન પણ બને નહિ, ન જ બને. એકેએક વ્યક્તિની એકેએક ઉક્તિગત લાક્ષણિકતાની નોંધ શક્ય નથી. વળી, વાસ્તવમાં એવી લાક્ષણિકતાઓ જેતન જગતીની હેતી પણ નથી, શિક્ષણાં વાપ તથા બાદુનસામાન્યાં ભાગયાનાં તો નહિ જ. પણ મુદ્દો એ છે કે આત્મકથા પ્રત્યે આવો આત્યંતિક આગાહ ઉચિત છે ?

(૬) આ જ બાબત ચરિત્રચિત્રણને પણ લાગુ પડે. માણસ સદ્યસર્વદા સર્વથા સૌ કોઈને માટે એકસરખો છે જ નહિ, તો પછી આત્મકથામાં પણ શી રીતે હોઈ શકે ? એ એવો નથી એ જ તો એની વિશેષતા છે એને આપણા રસનો વિષય છે. તો ભલેને એનું એવું બહુઆયામી રૂપ આત્મકથામાં પ્રગટે. આપણી એ જ તો અપેક્ષા છે. મજાની વાત એ છે કે જ્યાં એ પોતાને છાવરવાની કોણિશ કરતો હોય છે ત્યાં પકડાઈ ગયા વિના રહેતો નથી.

(૭) ‘આત્મકથા ગમે તેટલી પોતાને માટે હોય તોપણ તે ભાવક માટે છે એ વાતે આત્મકથાકાર પૂરતો સભાન હોય છે. આ સભાનતા જ તેને રસિક બનાવવા તરફ પણ જેંગે છે ન એ કારણે પણ તે સત્ય, પ્રમાણિકતા, વાસ્તવ કે અનુભવને મચડવા મથે છે.’ – આમ કહેવામાં અત્યુક્તિ છે. જગતની ઉત્તમ ગણાયેલી આત્મકથાઓ ‘રસિક’ બનવા માટે સત્ય, પ્રમાણિકતા, વાસ્તવ કે અનુભવને મચડતી હોય એવું લાગે છે ? ખરેખર તો એ તત્ત્વોને મચડવા વગર એ રસપ્રદ અને રોચક બની શકી છે એ જ કારણે તો ઉત્તમ ગણાઈ છે. આત્મકથાનો નિકષ પણ એ જ છે. કોઈ એ કસોટીમાંથી પાર ન ઊતરે એને સ્વરૂપગત મર્યાદા કહીશું કે લેખકગત ?

(૮) આત્મકથાકાર ‘નાયક’ નથી, ચિત્રણ છે. એ ‘નાયક’ છે એવા ખ્યાલથી જ રવીન્દ્ર, તારા મનમાં આ ભાન્તિઓ ઊભી થઈ છે એમ મને જગાય છે. ‘એ પોતાનાં કે

અન્યનાં સમલનો ઢાકે (છે) અથવા એવી રીતે પ્રસ્તુત કરે (છે) કે તેમાં સમલનો ક્ષમ્ય ગણાય અને આત્મકથાના નાયક તરીકેનું ઊભું થયેલું તેનું મૂલ્ય દૂષિત ન થાય.' - આ વિધાનમાં પણ અતિવ્યાપ્તિ છે. ખરેખર તો આત્મકથાકારની એ કોશિશ રહી હોય છે કે આવું ન બને. એટલે તો એ આત્મકથા લખવા પ્રવૃત્ત થયો હોય છે. એક પ્રકારનો સર્જનાત્મક આવેગ પણ એમાં નકારી શકતો નથી.

(૮) કોઈ પણ સાહિત્યકૃતિની જેમ આત્મકથામાં પણ કથાનિરૂપણમાં પરોવાયેલું તેના નિરૂપકનું દસ્તિબિંદુ પકડાવું અત્યંત આવશ્યક હોય છે. એનું અર્થઘટન એના પર અવલંબે છે. વળી, વાચકની કલ્યક્શાક્સિસ સંક્ષિપ્ત બને તેવી અપેક્ષા પણ રહે છે. જો એમ બને તો બાળ મોહના કંદું ચોરવાના પ્રસંગનું દસ્તાવેજ આપીને રવીન્ડ, તું જે પ્રશ્ન ઉપસ્થિત કરે છે તે ઉપસ્થિત નહિ થાય. તું કે હું વાચક તરીકે શું એ કલ્યા ન શકીએ કે બાળ મોહને કંદું ચોર્યું એ વેળા તેના અને કુંદુંબીજનોના માટે એ પ્રસંગની તીવ્રતા કેટલી હશે? પણ મૂળ વાત નિરૂપણ પાછળના દસ્તિબિંદુની છે. તે એ છે કે મહાત્મા આ પ્રસંગને સ્મરે છે અને મહાત્માના જીવનમાં પણ આમ બન્યું હતું એ જાણીને 'માણસ' એટલે શું અને તેનામાં કેટકેટલી અને કેવી કેવી શક્યતા પડેલી છે તે તું અને હું આત્મકથાને કારણે જાણવા પામીએ છીએ અને વિસ્મયના અનુભવમાં મુકાઈએ છીએ. સાહિત્યકૃતિનું બીજું પ્રયોજન પણ શું છે?

તું પોતે કહે છે કે 'આત્મકથાલેખનનાં મૂળ આત્મકથાકારને આવી મળેલી નોંધી જીવનશૈલીમાં પડેલાં છે. એકધારું, નીરસ અને સામાચ જીવન કોઈ રીતેય પ્રેરણા કે પરિવર્તનને ન ચીધતું હોય તો આત્મકથા લખવાનું ભાગ્યે જ કોઈ કારણ બચે. આવા એકધારાપણામાંથી પણ આત્મકથાકારની પોતાની કોઈ સાધના કે ઈચ્છા તેને નોંધો થવા ન પ્રેરે તો પણ આત્મકથા લખવાનો અર્થ ન રહે એમ બને.' બાળમોહનની મહાત્મા બનવા સુધી આખી પ્રક્રિયા આવી પ્રેરણા કે પરિવર્તન ચીધનારી બરી કે નહિ? એ સાધના નહિ? નોંધ થવા માટે પ્રેરતી ઈચ્છા વિના સત્યના પ્રયોગો થઈ શક્યા હોત ખરા?

(૯૦) પ્રકાશનના સ્તરે, અન્યને હાનિ ન થાય તે માટે (કે લેખકને લગતી અમુક ગુપ્ત માહિતી બહાર ન પડે એવા ડેટુથી પણ) કેટલીક હકીકત છુપાવતી હોય છે એ ઠીક નથી. તારી એ વાત સાથે સંપૂર્ણ સમ્મત. આત્મકથાને અભિપ્રેત જ એ છે કે ચિત્રિ પૂર્ણપણે પ્રગટે. આ તો અને ટૂંપવાની વાત થઈ. વ્યવહારજગતનો આ અભિગમ સાહિત્યજગતમાં ન ચાલે.

(૯૧) આત્મકથાને પડકારવાનાં ઓજારો? તેના લેખકનું વ્યક્તિત્વ એમાં પ્રગટ થાય છે કે નહિ તેની નિરીક્ષા એ જ ઓજાર. સર્જનાત્મક, અને ભાવકચિત્તમાં પુનર્સર્જન પામતી હોવાને કારણે સાહિત્યકૃતિના મૂલ્યાંકન માટે સર્વસ્વીકૃત ધોરણો ઉપજાવવાં મુશ્કેલ.

રવીન્ડ, મારી શગાને સંકોરીને આ મુદે આટલું અજવાણું કરવા તું નિમિત્ત બન્યો એ માટે કૃતજ્ઞ.

૨૧-૦૧-૧૦

ધીરેન્દ્ર મહેતા

r



## પરિષદવૃત્તા

સંકલન : રાજેન્દ્ર પટેલ

શ્રી ગની દહીવાલા વ્યાખ્યાનમાળા અંતર્ગત તા. ૧૩-૨-૧૦ના રોજ અશોક ચાવડાએ પાકિસ્તાનનાં ઉર્દૂ કવિયત્રી પરવીન શાકીર (જીવન અને કવન) વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આધુનિક ઉર્દૂ સાહિત્યમાં પરવીન શાકીરનું મોખરાનું સ્થાન છે. અશોક ચાવડાએ પરવીન શાકીરના જીવનતિશેષોની વાત કરી તથા એમની ઉત્તમ ગઝલોના ઉદાહરણ સાથે એમની સર્જક ચેતનાનો સંસ્પર્શ કરાયો. ઉર્દૂ સાહિત્ય ઈતિહાસમાં સ્ત્રીસહજ અપ્રતિમ સંવેદન વ્યક્ત કરતી એમની કૃતિઓના પોતે કરેલા અનુવાદનું પણ પઠન કર્યું હતું.

### 'નાનીડ' પર વ્યાખ્યાન

રવીન્દ્રભવન અંતર્ગત તા. ૩ ફેબ્રુઆરીના દિવસે, રવીન્દ્રનાથ યગોરની વાર્તા 'નાનીડ' વિશે શ્રી ભોગાભાઈ પટેલે વ્યાખ્યાન આપ્યું હતું.

S

રવિશંકર રાવળ વ્યાખ્યાનમાળા અંતર્ગત ૩૦ જાન્યુ.ના રોજ સેપ્ટ યુનિ.ના સહયોગથી સુપ્રસિદ્ધ ચિત્રકાર નલીન માલિની અનેરી રજુઆત માણી. એમણે એમના સર્જનની વિશિષ્ટ કૃતિઓનાં ઓરિયો-વિરિયો નિર્ધારન કર્યું. ચિત્રકલામાં બહુવિધ કલા દ્વારા બહુપરિમાણિક આભિવ્યક્તિ સંયોજનીયી જોઈ ઉપસ્થિત સૌ કાઈ અભિભૂત થઈ ગયાં હતાં. ચિત્રકલા સાથે સંગીત, નાટક, ડ્રિલ્બ, સ્થાપત્ય, વિદ્યોગ્રાસી જેવાં અનેક કલામાધ્યમોના સાયુજ્યથી ઉભી થતી કલાસ્થાનિકે એક અનેરી અનુભૂતિ કરાવી હતી. ગુલામ મહેમદ શેખના માર્ગદર્શન હેઠળ યોજાતી આ વ્યાખ્યાનશૈલીનું પ્રતેક વ્યાખ્યાન અનન્ય રહ્યું હતું.

### સાહિત્યસિદ્ધાન્ત વ્યાખ્યાનશૈલી

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક. લા. સ્વાધ્યાયમંહિર અંતર્ગત 'સાહિત્યસિદ્ધાન્ત વ્યાખ્યાનશૈલી'નું ત્રીજું વ્યાખ્યાન ૧૧૧ એપ્રિલ, ૨૦૧૦ ને ગુરુવાર, સાંજે ૫.૩૦ કલાકે ડૉ. વિજય પંડ્યા 'ભરત અને એરિસ્ટોટલ : નાટ્યસ્વરૂપની વિભાવના' વિશે આપશે. સાહિત્યસિદ્ધાન્તની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પદ્ધતિમાં કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાગ્રતારી મળે એ આ શ્રોણીનો ઉદેશ છે.

S

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક. લા. સ્વાધ્યાયમંહિર દ્વારા પૂર્વ અને પદ્ધતિમાના સાહિત્યવિચારનો તુલનાત્મક અભ્યાસ થાય તથા નૂતન પ્રવાહોની જાગ્રતારી મળે તે ડેટુથી 'સાહિત્યસિદ્ધાન્ત વ્યાખ્યાનશૈલી' આયોજિત થઈ છે જેના અંતર્ગત પ્રથમ વ્યાખ્યાન તા. ૪-૨-૨૦૧૦ના રોજ ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાલાના 'રસસિદ્ધાન્ત અને અભિગ્રહણ સિદ્ધાન્ત (રિસેપ્શન થિયરી)' વિષય પર યોજાયું. આરંભે શ્રી ક. લા. સ્વાધ્યાયમંહિરના કાર્યકારી નિયામક શ્રી પારુલબહેન દેસાઈએ શ્રોણી વિશે ભૂમિકા બાંધી આપી હતી અને શ્રી

ગાજેન્ડરબાઈ પટેલે ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાના સંનિષ્ઠ સર્જન વ્યક્તિત્વનો આછો ચિત્તાર વ્યક્ત કર્યો.

વ્યાખ્યાનના વિષયમાં પ્રવેશ કરાવતાં ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ જગ્ગાબું, 'સિદ્ધાંતો એટલે સાહિત્યને સમજવાનું સાધન.' સાહિત્યને લેખક-વાચક-કૃતિ-જગત અમે ચાર ભાગમાં વહેંચીને સમજી શકાય એવી ભૂમિકા બાંધી તેમજે રસસિદ્ધાંતને મનોવૈજ્ઞાનિક સંદર્ભોથી કઈ રીતે સમજી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજે જગ્ગાબું કે રસસિદ્ધાંત જેમ નાટક અને ભાવકને અનુલક્ષીને રજૂ થાય છે તેમ અભિગ્રહણ-સિદ્ધાંતના કેન્દ્રમાં કૃતિ અને વાચક હોય છે. વાચક પૂર્વાનુભવનું ભાથું બાંધીને કૃતિની પ્રત્યક્ષ જાય છે, ત્યારે કૃતિમાંથી જે પણ ગ્રહણ કરે છે તેમાં તેના પૂર્વાનુભવની ક્ષાળો તેને મદદરૂપ બને છે. ટૂંકમાં, રસસિદ્ધાંત અને અભિગ્રહણ-સિદ્ધાંતની મૂળ વાત તો એક જ છે; માત્ર બંનેની પદ્ધતિ અલગ અલગ છે.

આ નૂતન શ્રેષ્ઠીના આરંભના વ્યાખ્યાનમાં સિસ્ટેરથી અંશી જેટલા શ્રોતાઓ જોડાયા. જેમાં મધુસૂદન બક્ષી, સુમન શાહ, પ્રશાંત દવે, પ્રદીપ ખાંડવાલા જેવા વિદ્ધદ્જનો પણ હતા. ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ખૂબ ઓછા સમયમાં સાહિત્યના બે વિશાળ સિદ્ધાંતોની રસપ્રદ ચર્ચા કરી. અંતમાં શ્રોતા અને વક્તા વચ્ચે થયેલી પ્રશ્નોત્તરીએ વિષયની વધુ નજીક સરકવાની નેમ સાધી. પ્રશ્નોત્તરીમાં શ્રી સુમન શાહ, રમેશ ૨. દવે, હરિભાઈ ઉમરેઠિયા, અજય રાવલ વગેરે જોડાયા અને ચર્ચાની જીવંત બનાવી. વક્તવ્યની સમાપનવેળાએ શ્રી ઈતુભાઈએ શ્રોતાગણ અને વક્તાશ્રીનો આભાર માન્યો.

શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિર દ્વારા આવા વધુ ને વધુ કાર્યક્રમ યોજાતા રહે તો અમારા જેવા વિદ્યાર્થીજીઓમાં સાહિત્યિક સજ્જતા ખીલે.

- વિભાગિકી

### ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્વારા યોજાતો 'ગ્રંથગોળ્ઝ'નો કાર્યક્રમ તા. ૧૬-૨-૨૦૧૦ના રોજ સાંજે ૬ વાગ્યે શ્રી રઘુવીર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. પ્રારંભે પારુલ કંદ્રા દેસાઈએ કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી હતી. પ્રફૂલ્લ રાવવે અધ્યક્ષ અને વક્તાઓનો પરિચય આયો હતો. શ્રી નીતિન વડગામાએ શિરીષ પંચાલના સર્જન અને વિવેચનની ગોળ્ઝ થાય છે તેનો આનંદ પ્રગટ કર્યો હતો. ઉષાબહેન ઉપાધ્યાયે શિરીષ પંચાલના ટિલ્લી સાહિત્ય અકાદમી પુરસ્કૃત ગ્રંથ 'વાત આપણાં વિવેચનની' વિશેના વક્તવ્યમાં શિરીષ પંચાલના બ. ક. ઠાકોર વિશેના લેખને મુજબ આધાર બનાવી શિરીષ પંચાલની વિવેચનની લાક્ષ્ણીક શૈલીનો પરિચય કરાવ્યો હતો. શ્રી અજય રાવવે વાતાંગ્રહ : 'અંચાઈ' વિશે વાત કરતાં 'અંચાઈ', 'મજૂસ', 'હવેલી' તેમજ 'આયનો વાતાંગ્રહ' અંચાઈએ 'ઓરડામાંથી બહાર' અને 'આ ઝુબેદા અને આ કલ્લોલ' વાતાંગ્રહોનો આસ્વાદ કરાવીને વાતાંગ્રહ શિરીષ પંચાલનો પરિચય કરાવ્યો હતો. રઘુવીર ચૌધરીએ અધ્યક્ષીય વક્તવ્યમાં શિરીષ પંચાલે ગુજરાતી સાહિત્યમાં કરેલા પ્રદાનને બિરદાબું હતું.

### કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની મૂલ્યના

જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમને મોબાઇલ નંબર ૮૮૨૭૦-૨૨૭૫૫ ઉપર SMS કરી પોતાનું નામ - મોબાઇલ નંબર તથા ઈ-મેઇલ એન્ટ્રેસ જગ્ગાવવાં.

### શ્રી. મં. ગ્રંથાલયમાં આવેલ દાનની વિગત

શ્રી રમણલાલ સોનીનાં પુસ્તકો અને તે રાખવા માટેનાં બે કબાટો ખરીદવા માટે રૂ. ૧૬૦૦૦/- શ્રી શ્રીરામભાઈ સોની તરફથી મળ્યા છે.

### દીપિતી શાહ

### ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો

૨૦૦૮ અને ૨૦૦૯નાં બે વર્ષના ગાળામાં પ્રસિદ્ધ થયેલાં પ્રથમ આવૃત્તિવાળાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી નીચે પ્રમાણેનાં પારિતોષિકો અનાયત કરવામાં આવશે. સર્વ લેખકો અને પ્રકાશકોને મે માસની ત્રીસીમી તારીખ સુધીમાં દરેક પુસ્તકની બે નકલો, કયા પારિતોષિક માટે છે તે વિગત પુસ્તકના પહેલા પાના પર દર્શાવીને પરિષદ કાર્યાલય પર મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે.

**૧. શ્રી ભગીની નિવેદિતા પારિતોષિક :** ૨૦૦૮ અને ૨૦૦૯નાં બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં લેખિકાઓના વર્ષદીઠ એક એક સર્વશ્રેષ્ઠ પુસ્તકને શ્રી હરિઃ ઊં આશ્રમપ્રેરિત આ પારિતોષિક અનાયત કરવામાં આવશે.

**૨. શ્રી અરવિંદ (સુવર્ણાંદ્રક) પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં ભક્તિવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને શ્રી હરિ ઊં આશ્રમપ્રેરિત આ પારિતોષિક અનાયત કરવામાં આવશે.

**૩. શ્રી ઉમા-સ્નેહરાશિમ પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં સર્વશ્રેષ્ઠ સાહિત્યિક પુસ્તકને આ પારિતોષિક અનાયત કરવામાં આવશે.

**૪. શ્રી કાકસાહેબ કાલેલકર પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં નિબંધ, પ્રવાસ, સ્મરણો, જીવનચરિત્રો આદિ પ્રકારનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક અનાયત કરવામાં આવશે.

**૫. શ્રી બટુભાઈ ઉમરવાડિયા એકાંકી પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં એકાંકીઓમાંથી સર્વશ્રેષ્ઠ એકાંકીને પારિતોષિક અનાયત કરવામાં આવશે.

**૬. શ્રી. પ્ર. નિવેદી પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં શિક્ષણ વિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક અનાયત કરવામાં આવશે.

**૭. શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં સમાજ, શિક્ષણ વગેરે વિશેના યિતનાત્મક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક અનાયત કરવામાં આવશે.

**૮. શ્રી જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક :** ૨૦૦૮ અને ૨૦૦૯નાં વર્ષ દરમ્યાન

પ્રકાશિત થયેલા હાસ્ય, વિનોદ, કટાક્ષ વગેરેના વર્ષફીઠ એક એક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૮. શ્રી બી. અન. માંકડ ખિચ્છૂર્તિ પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા લોકભોગ્ય વિજ્ઞાનવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૦. શ્રી રમપ્રસાદ પ્રેમશંકર બક્ષી પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા સાહિત્યશાસ્ત્રના સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૧. શ્રી તખ્તસિંહ પરમાર પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા લેખકના પ્રથમ સર્જનાત્મક સર્વશ્રેષ્ઠ પુસ્તક (કવિતા, નાટક, નવલકથા સ્વરૂપના)ને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૨. શ્રી હરિલાલ માણેકલાલ દેસાઈ પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રગટ થયેલા વિવેચન અથવા સામાજિક તત્ત્વજ્ઞાનવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૩. શ્રી નટવરલાલ માળવી પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા બાળસાહિત્યના સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૪. શ્રી ઉશનસ્ક પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં સર્વશ્રેષ્ઠ દીર્ઘકાલ્યો (સોનેટમાળા, ઝંડકાલ્યો, પદ્ધનાટક કે અન્ય પ્રકારનાં વર્ષનાત્મક ચિંતનાત્મક દીર્ઘકાલ્યોની કૃતિ ગંથસ્થ અથવા કોઈ સામયિકમાં પ્રગટ થયેલી હોવી જરૂરી છે.)ને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૫. શ્રી દિલીપ ચં. મહેતા પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા સર્વશ્રેષ્ઠ ગજલસંગ્રહને અથવા જે કાવ્યસંગ્રહમાં ગજલોની નોંધપાત્ર સંખ્યા હોય તેને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૬. શ્રી મહેન્દ્ર ભગત (દીર્ઘનાટક) પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા દીર્ઘનાટકોને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૭. શ્રી રમશ પાઠક ખિચ્છૂર્તિ પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા સર્વશ્રેષ્ઠ નવલકિસંગ્રહને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૮. શ્રી સદ્ગુણાર પરિવાર પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રગટ થયેલા સર્વશ્રેષ્ઠ પ્રેરક સાહિત્યના પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૧૯. શ્રી ગોપાળરાવ વિદ્વાંસ પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા ભારતીય ભાષાઓમાંથી થયેલા ભાષાંતરના સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૦. શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ (સમાજશાસ્ત્ર) પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા ભૂગોળ-સમાજશાસ્ત્રના સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૧. શ્રી રમજલાલ સોની (બાળ-કિશોર સાહિત્ય) પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા સર્વશ્રેષ્ઠ બાળ-કિશોરસાહિત્યના પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૨. શ્રી સુરેશ મજૂમદાર પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રગટ થયેલા સ્ત્રી-અનુવાદકના અનુવાદથ્રને અથવા ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં કવિત્રી રચિત સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૩. ડૉ. રમજલાલ જોશી વિવેચન પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા વર્ષફીઠ એક-એક વિવેચનવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૪. ડૉ. ઉપેન્દ્ર પંડ્યા (મહાનિબંધ) પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત-અપ્રકાશિત બંને પ્રકારના પરંતુ નિર્દિષ્ટ સમયગાળામાં યુનિવર્સિટી દ્વારા મંજૂર થયેલા સર્વશ્રેષ્ઠ મહાનિબંધને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૫. ડૉ. ઉપેન્દ્ર પંડ્યા (લિતિતનિબંધ) પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા લિતિતનિબંધના સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૬. શ્રી દિનકર શાહ 'કવિ જ્ય' પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા કવિના પ્રથમ સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૭. શ્રી દોલત ભટ પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી ગ્રામજીવન પર લખાયેલી સર્વશ્રેષ્ઠ નવલકથા અથવા લોકસાહિત્યવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૮. શ્રી પિયકાન્ત પરીખ નવલકથા પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી વર્ષફીઠ એક-એક સર્વશ્રેષ્ઠ નવલકથાઓને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૨૯. શ્રી પદ્મિત બેચરદાસ જીવરાજ દોશી પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા સંસ્કૃત-પ્રાકૃત ગુજરાતી વાકરણવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૩૦. કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યા પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા મૌલિક ગીતસંગ્રહના પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૩૧. શ્રી વિષ્ણુપ્રસાદ નિરેદી પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા ચિંતનાત્મક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૩૨. શ્રી ચમુ પંડિત (અર્થશાસ્ત્ર, વાણિજ્ય, ઉદ્યોગ) પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા અર્થશાસ્ત્ર-વાણિજ્ય-પ્રબંધ-ઉદ્યોગમાં માનવીય સંબંધવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**૩૩. શ્રી પ્રભાશંકર તેરેયા પારિતોષિક :** ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રસિદ્ધ થયેલા ભાષાવિજ્ઞાન-વાકરણવિષયક સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં

આવશે.

**ઉ૪. સર્વોદય આશ્રમ સણાલી 'કરુણામૂર્તિ ભગવાન મહાવીર કાઉન્ટેશન'**  
પારિતોષિક : ૨૦૦૮-૨૦૦૯નાં બે વર્ષ દરમિયાન પ્રકાશિત લોકસાહિત્યવિષયક શ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**ઉ૫. ડૉ. બી. ટી. નિવેદી (ચર્ચાપત્રી) પારિતોષિક :** આ પારિતોષિક સંદર્ભે એન્ટ્રી મોકલવાની રહેતી નથી કે કશી રજૂઆત પણ કરવાની થતી નથી.

**ઉ૬. ગુજરાત દર્શા પારિતોષિક :** (દરિયાપારના સાહિત્યકારો માટે) વર્ષ ૨૦૦૬-૦૭-૦૮નાં ત્રણ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવવિકાસંગ્રહના સર્વશ્રેષ્ઠ પુસ્તકને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.

**નોંધ :** 'પરબ' પારિતોષિકો વર્ષ ૨૦૦૮-૨૦૦૯ દરમ્યાન 'પરબ'માં પ્રકાશિત થયેલ શ્રેષ્ઠ કાવ્ય, લેખ, નિબંધ અને નવવિકાને પ્રતિવર્ષ એક એક પારિતોષિક આપવામાં આવે છે.

પ્રફુલ્લ રાવલ  
પ્રકાશનમંત્રી

r

#### 'પરબ'ની માલિકી તથા બીજી માહિતી અંગે નિવેદન (ફોર્મ નં. ૪)

૧. પ્રસિદ્ધ સ્થાન	: અમદાવાદ
૨. પ્રસિદ્ધ ગાળો	: માસિક
૩. પ્રકાશક-મુદ્રક	: પ્રફુલ્લ રાવલ (ગુજરાતી સાહિત્ય પરિષદ વર્તી)
રાષ્ટ્રીયતા	: ભારતીય
સરનામું	: ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮
૪. તંત્રી	: યોગેશ જીશી
રાષ્ટ્રીયતા	: ભારતીય
સરનામું	: ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન ભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮
૫. માલિકી ધરાવનાર	: (૧) શ્રી પ્રફુલ્લ અનુભાઈ (૨) શ્રી શ્રેષ્ઠિકભાઈ
કુલ થાપણના એક	કસ્તુરભાઈ (૩) શ્રી બળવંત પારેખ
ટકાથી વધારે	(૪) વિનોદ ભટ્ટ (૫) શ્રી રઘુવીર ચૌધરી
રોકનાર ભાગીડાર શેર	(૬) શ્રી નિર્ંજન ભગત
ધરાવનાર ટ્રસ્ટીઓનાં	
નામ-સરનામાં	

## સાહિત્યવૃત્ત

સંકલન : પ્રફુલ્લ રાવલ

### સાહિત્ય અકાડેમીના ફેલો તરીકે બોળાભાઈ પટેલની વરણી

૧૬ મી ફેબ્રુઆરીના રોજ રવીન્દ્રભવન, દિલ્હીમાં મળેલી સાહિત્ય અકાડેમીની જનરલ કાઉન્સિલે ભોળાભાઈ પટેલની 'સાહિત્ય અકાડેમીના ફેલો' તરીકે વરણી કરી છે.

સમગ્ર ભારતીય ભાવાઓમાં થઈને ૨૧ની સંખ્યાથી ન વધે એ રીતે ઈ. સ. ૧૯૬૮થી વ્યક્તિગત રીતે સાહિત્યકોને કરેલા વિશેષ પ્રદાન માટે સાહિત્ય અકાડેમીના ફેલો (Fellow of Sahitya Akademi) ચૂંટવામાં આવે છે. પહેલા ફેલો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું ૧૯૬૮માં ચૂંટવા હતા. ગુજરાતી સાહિત્યકારોમાંથી આ ફેલો પદ અગાઉ કાકસાહેબ અલેલકર, વિજુપ્રસાદ નિવેદી, ઉમાશંકર જોશી અને રાજેન્ડ શાહની વરણી થઈ હતું.

સાહિત્ય અકાડેમીના ફેલોનું પદ આજીવન હોય છે.

### હસમુખ બારાડીનું વ્યાખ્યાન

૧૭ ફેબ્રુઆરીના રોજ હસમુખ બારાડીએ ગુજરાત વિશ્કોશ ટ્રસ્ટ દ્વારા ચલાવાતી શ્રી ભદ્રકાર વિદ્યારીપક શાન-વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત 'ગુજરાત થિયેટરમાં હાસ્યરસિક પાત્રો' એ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.

### નાન્ન સેકાંડિયોનું સંચાર

૬ ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિશ્કોશ લિલિતકલા કેન્દ્ર દ્વારા 'ઝંબુદિયા રંગનું ફૂલ', 'બે જલ્દાદો' અને 'શી'નું કેડ' એ ત્રણ એકાંકીઓનું મંચન થયું હતું. દિગ્દર્શન નિમેષ દેસાઈએ કર્વું મૂળ વિદેશી આ ત્રણેય એકાંકીઓનો ગુજરાતી અનુવાદ શ્રી મહેન્દ્ર અમીને કર્વો છે.

### ગાંધીનગર સાહિત્યસભાનો વાર્ષિકોત્સવ

ગાંધીનગર સાહિત્યસભાનો વાર્ષિકોત્સવ ૧૩-૧૪ ફેબ્રુઆરીએ યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ કર્યું હતું. ભોળાભાઈ પટેલ અને કિરીટ દૂધાત ઉપસ્થિત હતા. પછીની બેઠકમાં 'ચરિત્ર નિબંધની વિભાવના' એ વિષય પર પ્રફુલ્લ રાવલે અને 'ચરિત્ર નિબંધનું આંતરસત્ત્વ' એ વિષય પર પ્રવીશ દરજાએ વક્તવ્ય આપ્યું હતું. ભોળાભાઈ પટેલે અધ્યક્ષસ્થાનેથી ચરિત્રનિબંધ વિષે વિશેષ પ્રકાશ પાડ્યો હતો. બોપોરની બેઠકમાં પ્રવાસ નિબંધમાં મણિલાલ હ. પટેલનો લેખ પ્રકાશ લાલાએ વાંચ્યો હતો. કિશોરસિંહ સોલેંકીએ પોતાના પ્રવાસથી થયેલ આંતરશ્વનના ઉઘાડની વાત કરી હતી. હરિકૃષ્ણ પાઠકે પ્રવાસ - કાવ્યના પઠનથી ગુજરાતી પ્રવાસ નિબંધનો આલેખ આપ્યો હતો. ૧૪ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સાહિત્યસભા સભ્યના પુસ્તકોનું પ્રદર્શન દોલત ભણ દ્વારા ખુલ્લુ મુકાયું હતું. અને પછીની બેઠકમાં 'બાળસાહિત્યની આજ અને આવતીકાલ' એ વિષય પર યશવંત મહેતાએ વક્તવ્ય આપ્યું હતું. યોસેફ મેકવાન અને પ્રકાશ લાલાએ પણ વક્તવ્યો આપ્યાં હતાં.

## ‘તત્ત્વ’ ગજલસર્વગ્રહનો લોકપર્ણ સમાર્થબ

૨૪ જાન્યુઆરીએ રાજકોટમાં લક્ષ્મી દેવભરિયા, દિનેશ કાનાણી અને રાકેશ હંસવિયાની ૧૧૧ ગજલોના સંગ્રહ ‘તત્ત્વ’નું લોકપર્ણ ગૌરંગ ટાકરના હસ્તે થયું હતું. સંજુ વાળા અધ્યક્ષ હતા.

## કમળાશંકર પંડ્યા સાહિત્યકાર એવોર્ડ

કમળાશંકર પંડ્યા શાઉન્ડેશન દ્વારા વડોદરાના સાહિત્યકારે પ્રતિવર્ષ કમળાશંકર પંડ્યા સાહિત્યકાર અવોર્ડ આપાય છે. ૨૦૦૭નો અવોર્ડ ખલીલ ધનતેજીને અને ૨૦૦૮ના અવોર્ડ ડૉ. રમણ સોનીને આપ્ણા કરાયો છે. ભગીરથ બ્રહ્મભં અને ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાના હસ્તે સન્માનપત્ર આપાયેલ હતા.

## કલિકાલ સર્વજ્ઞ હેમયંડાચાર્ય સુવર્ણચંદ્રક

વિશ્વ કલાગુર્જરી ફેરેશન દ્વારા ૨૦૧૦નો કલિકાલ સર્વજ્ઞ હેમયંડાચાર્ય સુવર્ણચંદ્રક બ્રિટનસ્થિત ડૉ. જગદીશ દવેને આપ્ણા થયો હતો. આ સમારોહના અધ્યક્ષસ્થાને ડૉ. કુમારપાળ દેસાઈ હતા.

## ગજલ ડિપ્લોમા પ્રમાણપત્રનું વિતરણ

૧૭ જાન્યુઆરી પૂર્વો મોરારિબાપુની નિશાયાં ગુજરાતી ગજલ વિદ્યાપીકમાં ડિપ્લોમા કરનારને પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા. સંસ્થાનો પરિચય પણિક પરમારે આપ્યો હતો.

## કલાપીને કાલ્યાંજલિ

પ્રેમાનંદ સાહિત્યસભા, વડોદરાના ઉપક્રમે ડૉ. રશીદ મીરની અધ્યક્ષતામાં કલાપીને કાલ્યાંજલિનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. ગુલામ અભિસ ‘નાશાદ’ અતિથિવિશેષ હતા. ડૉ. વિરંચિ ત્રિવેદીએ કલાપીની પ્રણય-પ્રકૃતિની કવિતા વિશે વક્તવ્ય આપ્યું હતું.

## નાનાભાઈ ડૉ. જેબલિયાના સાહિત્ય પર પરિસંવાદ યોજાયો

શ્રી નૂતન કેળવશી મંડળ સંચાલિત, સાવર કુંડલાની શ્રી વી. ડી. કાણ્ણકિયા આદર્શ એન્ડ શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭-૦૧-૨૦૧૦ના રોજ કોલેજ સભાભંડમાં ‘નાનાભાઈ ડૉ. જેબલિયા એક પુનઃ મૂલ્યાંકન’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જાણીતા સાહિત્યકાર શ્રી રધુવીર ચૌધરીના અધ્યક્ષ પદે યોજાયેલા આ પરિસંવાદમાં નાનાભાઈના વિવિધ સર્જનો પર વિદ્રોધજોએ અભ્યાસપૂર્ણ વક્તવ્યો આપ્યા હતા. જેમાં નાનાભાઈની વાર્તાસુચિ પર રજનીકુમાર પંડ્યાએ અને નાનાભાઈની વાર્તાકળા સંદર્ભે કિરીટ દૂધાતે; નાનાભાઈની નવલકથાઓ. વિશે મનસુખ સલ્લાએ અને નાનાભાઈની ઐતિહાસિક કથાઓ પર મનોજ રાવલે તેમજ નાનાભાઈના કટારલેખન પર શ્રી રતિલાલ બોરીસાગરે મનનીય પ્રવચનો આપ્યા હતા. જુદી જુદી ત્રણ બેઠકોમાં યોજાયેલ આ પરિસંવાદની ત્રણે બેઠકોના અધ્યક્ષ સ્થાને જુદા જુદા ત્રણ વિદ્ધાન સાહિત્યકારોમાં અનુક્રમે રઘુવીર ચૌધરી, નરોત્તમ પલાશ અને વસંત પરીએ નાનાભાઈના સાહિત્યના સત્ત્વ-તત્ત્વને ચીંધી આપ્યા હતા. સંચાલન કેસર મકવાણાએ કર્યું હતું.

## કાવ્યસર્જન પ્રક્રિયા પર કાર્યક્રમ

નર્મદ સાહિત્યસભાના ઉપક્રમે રીના મહેતાએ પોતાની કાવ્યસર્જન પ્રક્રિયા પર વક્તવ્ય આપ્યું હતું. એમણે ‘કવિતામાં ઓગળવું એનો અર્થ છે ઈશ્વરમાં ઓગળવું’ કહ્યું હતું. રીના મહેતાએ સ્વરચિત કાલ્યોનું પઠન પણ કર્યું હતું.

## વિશ્વગુર્જરીની દિશામાં નિરાગુર્જરીની યત્તા

ગુજરાતી ભાષાના સત્ત્વશીલ ગ્રંથોની રાખ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા માટે અન્ય ભાષાઓમાં એમને અનૂદિત કરીને પ્રકાશિત કરવવાનું અભિયાન ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાને છેલ્લા પાંચ વર્ષથી આદર્યું છે. ૨૦૦૮ સુધીમાં કુલ ૧૬ ગ્રંથો હિન્દી, મરાಠી, અંગ્રેજ અને તેલુગ ભાષામાં જે તે વ્યાવસાયિક પ્રકાશકો દ્વારા પ્રકાશિત કરવાં પછી હવે ૨૦૦૯ના વર્ષમાં આ સંસ્થા દ્વારા નીચેના ચાર ગ્રંથોનો લોકપર્ણ સમારોહ તા. ૪ ફેબ્રુઆરી ૨૦૧૦ના હિન્દી ખાતે વિશ્વ પુસ્તક મેળામાં યોજાયો હતો. (૧) ‘સરસ્વતીયદ’ લેખક – ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (સંક્ષિપ્ત આવૃત્તિ) (હિન્દી), (૨) ‘ભારેલો અજિન’ – (‘દર્બી હુંએ આગ’) લેખક – હિંમતભાઈ મહેતા (હિન્દી), (૩) ‘પ્રકાશનો પડશાયો’ (ઓળીએન નીળજી) – લેખક – હિન્કર જોષી (તમિલ).

જાણીતા હિન્દી દૈનિક ‘જનસત્તા’ના તંત્રી શ્રી ઓમ માથુરના હસ્તે આ લોકપર્ણ વિધિ થયો હતો. સરદાર પેટેલનું એક પણ જીવનવૃત્ત અત્યાર સુધી હિન્દી ભાષામાં નહોતું. પ્રદાન પ્રતિષ્ઠાને આવું પહેલું જ પુસ્તક હિન્દી ભાષામાં પ્રગટ કરવાં છે.

## હિન્દી-ગુજરાતી દલિત સાહિત્યનો રાખ્રીય સેમિનાર ખેરાલુ કોલેજમાં યોજાયો

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુ.જ.સી.) અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુના સંયુક્ત ઉપક્રમે તા. ૮ અને ૧૦ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ હિન્દી ગુજરાતી દલિત સાહિત્ય વિષયક સેમિનાર યોજાયો. જેમાં કાર્શાંક ચાયના ડૉ. શ્રીધર હેગડેએ બીજ ભાષા રજૂ કરી દલિત સાહિત્યની પ્રારંભિકતા રજૂ કરી હતી. શ્રી જોસેફ મેકવાને ઉદ્ઘાટન કર્યું હતું. આવકાર પ્રવચન આચાર્યશ્રી રણાંગેઝ ચૌધરીએ આપેલ. સેમિનારના પ્રમુખપદે ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવશી મંડળના પ્રમુખશ્રી મોહનભાઈ દેસાઈ હતા. આભારવિધિ સેમિનાર સંયોજક અને હિન્દી વિભાગના વડા ડૉ. નરસિંહદાસ વણકરે કરી હતી.

સૌરાષ્ટ્રના પંથકના અગ્રણી ડૉ. નાથલાલ ગોડિલે (કેશોદ) ભારતીય અને દલિત સાહિત્ય ઉપર મનનીય પ્રવચન આપ્યું હતું. જ્યારે દલિત સાહિત્યનું ભવિષ્ય એ વિષય પર ગુજરાત યુનિ. ભાષા ભવનના અધ્યક્ષ ડૉ. રંજનાબહેન અરગડેએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. દ્વિતીય સંગ્રહીના વડા હતા ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ પૂર્વ હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ. કુંજબિહારી વાર્ષિક અને ડૉ. જશવંત પંડ્યા. ડૉ. ધીરજ વણકરે ડૉ. સીતારામ બારોટે, ડૉ. ગોવર્ધન વણગારા, ડૉ. બી. પી. ચૌહાણ, ડૉ. ભાનુભાઈ રોહિટે, પ્રા. રમણ રોહિટે, ડૉ. સોમભાઈ પટેલ (યોગારીયા), ડૉ. ભરતભાઈ પટેલ, પ્રા. ઈશ્વરભાઈ પટેલ, ડૉ. મમતા શર્મા (અંબાજી)એ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતો. જેનું સંચાલન ડૉ. ધીરજ વણકર, ડૉ. કીર્તિ આદવે કર્યું હતું.

ગુજરાતી દખિત સાહિત્યની સંગ્રહીમાં ગુજરાતભરના વિદ્ધાનો જોડાયા હતા, જેનું અધ્યક્ષપદ શ્રી બબલદાસ ચાવડા (બુદ્ધિધન વિસનગરી) ડૉ. મોહનભાઈ પરમાર (ચાંદખેડા) ડૉ. રાજેશ મકવાણા (મહેસાણા) એ શોભાબું હતું. પ્રા. વશવંત વાધેલા, શ્રી કનુભાઈ ખડકિયા, ડૉ. સનીલ જાદવ, શ્રી ભી. ન. વણકર, ડૉ. અમૃત જાદવ, ચંદ્રાબહેન શ્રીમાળી, ડૉ. પી. છ. જયોતિકર, ડૉ. શિવરામ શ્રીમાળી (ઊંઝા), પ્રિ. ડૉ. અમૃત પટેલે વક્તવ્યો આપ્યાં હતાં.

### ડૉ. જ્યંત પાઠક કવિતા પુરસ્કાર

સુરતની એમ.ડી.બી. આર્ટર્સ કોલેજની ડૉ. જ્યંત પાઠક કવિતા પુરસ્કાર સમિતિ તરફથી આપવામાં આવતા ઉપરોક્ત પુરસ્કાર માટે ૨૦૦૬-૦૭ના વર્ષ દરમાન પ્રગત થયેલા કાવ્યસંગ્રહોમાંથી તજ્જ્વાએ કવિશ્રી ભાનુપ્રસાદ ત્રિવેદીના કાવ્યસંગ્રહ ‘ઋતુપર્ણ’ને પસંદ કર્યો છે. તજ્જ્વા તરીકે શ્રી હરિકૃષ્ણ પાઠક તથા શ્રી જ્યંતેવ શુક્રે સેવા આપી હતી..

### કવિશ્રી બાલમુકુન્દ દવેના ગવદેખન સાહિત્ય અંગે

કવિશ્રી બાલમુકુન્દ દવેના સમગ્ર સાહિત્યના સંપાદનની કામગારી મને સૌંપાઈ છે તે સંદર્ભમાં કવિના કાવ્યસંગ્રહો તથા ગ્રંથરથ થયેલું ગવદેખન પ્રાપ્ત થયું છે. પરંતુ આ કવિએ કાવ્યસંગ્રહો – વિશેષ બાલકાચ્ચોના અન્ય કવિઓના સંગ્રહોની પ્રસ્તાવનાઓ લખી છે. ક્યારેક કોઈ અભિનંદનગ્રંથ કે સ્મૃતિગ્રંથમાં કે કેફિયત રૂપે પણ ગવદેખન કર્યું છે. તો જે સર્જકો-કવિઓને આ કવિની કલમનો લાભ મળ્યો હોય તેઓ તે અંગેની વિગત, વિકલ્પે તેવા લખાણોની ફિલોસોફી નકલ કે શક્ય હોય તો પુસ્તક ઉપલબ્ધ કરે તો કવિના પ્રદાનને સમુચ્ચિત રૂપે મૂલતી શકાય. આશા છે કે કવિના ચાહકો-પ્રશંસકો, સેહીઓ અને સર્જકોનો સહકાર મળી રહેશે – સામગ્રી આ સરનામે મોકલવી : હરિકૃષ્ણ પાઠક, પ્લોટ નં. ૬૨/૨, સેક્ટર ૨-એ, ગાંધીનગર ૩૮૨ ૦૦૭. ફોન : ૦૭૯-૨૩૨૨૮૮૩૮.

### પાદ્રિકી

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ‘પાદ્રિકી’ના ઉપકમે પ્રીતિ સેનગુપ્તા સાથે એક સાંજાનો કાર્બકમ તા. ૨૩-૨-૨૦૧૦ના રોજ સાંજે ૫-૩૦ વાગ્યે યોજાયો હતો. પ્રારંભે રાજેન્ડ્ર પટેલે વિશ્વપ્રવાસી પ્રીતિ સેનગુપ્તાનો પરિચય આપ્યો હતો. પ્રીતિબહેન કાવ્યોનું પઠન કરતાં કરતાં કે પ્રવાસપુસ્તકમાંથી ગંધીબંડ વાંચતાં વાંચતાં પોતાના અનુભવોને પણ વર્ણિત હતા. જેમાં શ્રોતા-ભાવકો તલ્લીન થયા હતા. પ્રશ્નોત્તરી દરમિયાન પ્રીતિબહેનનું પ્રવાસી વ્યક્તિત્વ ઉઘડી આવ્યું હતું. પારુલ કંદર્ફ દેસાઈએ પ્રીતિબહેન અને સૌનો આભાર માન્યો હતો.

r

### આ અંકના લેખકો

- અનિલ ચાવડા : ૨૦૨, પેલિકન હાઉસ, નટરાજ સિનેમા પાસે, આશ્રમરોડ, અમદાવાદ-૮
- આબિદ ભટ્ટ : નિર્જ મદીના મસ્ઝિદ રોડ, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર-૩૮૨૦૦૧
- એ.સ. ડી. દેસાઈ : સૂચિતા એપાર્ટમેન્ટ, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ-૮
- એ.સ. એ.સ. રાડી : Eezee Society Block No. 13, Behind Rupee Park, Kondhva Road, PUNE-411048
- કાજલ ઓ.આ વૈદ્ય : ૩૦૮, સુપર પ્લાઝ, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫
- કાવિની પરીખ : ૩, દેના બેન્ક સોસાયટી, સેશન રોડ, અમરેલી-૩૬૫૬૦૧
- ગિરીશ ભટ્ટ : પ્રશાંતિ નિલિયમ, માધ્વનગર, સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧
- શિનુ મોદી : ૧૬, જિતેન્દ્રપાઈક, પાલચી, અમદાવાદ-૩૮૦૦૦૭
- જનક ડ. દવે : ૨૦, સૈરવિહાર સોસાયટી, ડૉ. વિક્રમ સાચાભાઈ માર્ગ, અમદાવાદ-૧૫
- દિલીપ જોશી : હિન્કર, ૩, મારુતિનગર, એપોર્ટ રોડ, રાજકોટ-૩૬૦૦૦૭
- ધીરેન્દ્ર મહેતા : જીવનશાયા, જનરલ હોસ્પિટલ રોડ, ભૂજ-૩૭૦૦૦૧ (કષ્ટ)
- નરોત્તમ પલાશ : ‘દર્શન’, ૩, વારીખોલોટ, પોરબદ્ધ-૩૬૫૪૭૫
- નવનિત જાની : જાનીલા રોડ, તા. રાણપુર, જિ. અમદાવાદ-૩૮૨૨૪૫
- નીતિન વડગામા : ‘તાંકુલ’, ૧૮, સ્વાતિ સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૪
- પ્રકુલ્પ ચાવલ : ૩, રાજમહેલ ફ્લેટ, આઈઓસી કોલોની રોડ, વીરમગામ-૩૮૨૧૫૦
- પ્રવિજી દરજી : કુવાચ પાસે, લુણાવાડા-૩૮૮૨૨૩૦૧૦ જિ. પંચમહાલ
- Preeti Seengupta : 15, Stewart Place, White Plains, N.Y. 10603 (U.S.A.)
- ભગવતીકુમાર શર્મા : ઉર્બ/બી, પવિત્રા રોહાઉસ, ગેટ નં. ૨, સહજ સુપર સ્ટોર્ની ગલીમાં, આનંદમહલ રોડ, અડાજા, સુરત-૩૮૫૦૦૮
- ભાનુપ્રસાદ પંડ્યા : ૨૪/એ, સૌરભ બંગલોઝ, સત્યસાંદી હાર્ટ હોસ્પિટલ માર્ગ, રાજકોટ-૫
- યોગેશ જોશી : કે-૩૧/૩૭૨, શિવશક્તિ એપાર્ટમેન્ટ, અભબારનગર સામે, નવાવાડીજ, અમદાવાદ-૩૮૦૦૧૩
- રમેશ નિવેદી : ઉર્બ, રોયલ બ્લ્યુ કડી-કરણનગર રોડ, કડી જિ. મહેસાગા-૩૮૨૭૧૫
- ચાંદ્રન્દ્ર પટેલ : ૭૮, નિહારિકા બંગલોઝ, હિંમતલાલ પાઈ સામે, અંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫
- લાલભાંકર ટાકર : એ/૨, કેપિટલ કોર્પિશિયલ સેન્ટર, ૧૬૮ માળ, સંન્યાસ આશ્રમ પાસે, એલિસાભિજ, અમદાવાદ-૩૮૦૦૦૮
- વસ્ત્રલ ૨. શાહ : એ/૧, શ્રેયંસનાથ સોસાયટી-૧, ધરણીધર દેરાસર પાછળ, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭
- શાલી નિવેદી : એક/૩૧, નંદનવન-૩, જોધપુર સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫
- સુર્સિતા જોશી : C/o. જયેશ ભોગાયતા, ગુજરાતી વિભાગ, એમ. એસ. યુનિ., વડોદરા-૩૮૦૦૦૨
- સોમભાઈ સી. પટેલ : ૨૮૪/૮, ગણેશ ફ્લેટ, આરાધના સ્ક્રૂલ પાસે, સેક્ટર-૨૮, ગાંધીનગર-૨૮
- નળીબાસ મનમુખી (આવરણ) : પ્લોટ નં. ૬૪૨/૨, ચર્ચ પાસે, સેક્ટર-૨૮, ગાંધીનગર-૩૮૨૦૨૮

r